



“કબ્ર જનત કે બાગો મેં સે એક બાગ હૈ યા દોઝખ કે ગઢો મેં સે એક ગઢો”

# કબ્ર મેં આને વાલા દોસ્તા



- વફાદાર કોન ?
- સુદખોર કી ઉલાંકત
- મૌત કો યાદ કરને કા ફાઅદા
- કબ્ર કો જનત કા બાગ બનાને વાલે આંમાલ
- કબ્ર કો જહનમકા ગઢા બનાને વાલે આંમાલ
- અજાબે કબ્ર સે મહિઝ રહને વાલે ખુશ નસીબ
- લૂટ કે માલ સે હજ કરને વાલે કા અન્નામ



الْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعُلَمَاءِ وَالصَّلوةُ وَالسَّلَامُ عَلٰى سَيِّدِ الْمُرْسَلِينَ  
أَمَّا بَعْدُ فَاعُوذُ بِاللّٰهِ مِنَ الشَّيْطَنِ الرَّجِيمِ بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيمِ

## કિતાબ પઠને કી હુઅ॥

આજ : શૈખે તરીકત, અમીરે અહલે સુન્નત, બાનિયે  
દા'વતે ઈસ્લામી, હજરતે અલ્લામા મૌલાના અભૂ બિલાલ  
બુન્ધમાણ ઈલ્લાયા અગાર કાદિરી ૨-જવી દાઢ કાદિરી

દીની કિતાબ યા ઈસ્લામી સબક પઠને સે પહલે જૈલ  
મેં દી હુઈ દુઆ પઠ લીજિયે એન શاء اللہ عزوجلٰ જો કુછ પઢેંગો યાદ  
રહેગા. દુઆ યેહ હૈ :

اللّٰهُمَّ افْتَحْ عَلَيْنَا حِكْمَتَكَ وَانْشُرْ  
عَلَيْنَا رَحْمَتَكَ يَا ذَالْجَلَالِ وَالْاَكْرَامِ

તરજમા: એ અલ્લાહ ઉર્જુજીં હમ પર ઈલ્મો હિકમત કે દરવાજે ખોલ દે  
ઓર હમ પર અપની રહમત નાજિલ ફરમા ! એ અ-જમત ઔર બુગુર્ગી  
વાદે. (المُسْتَطْرِف ج ٤٤، دار الفکر بیروت)

નોટ : અવ્વલ આખિર એક એક બાર દુર્દદ શરીફ પઠ લીજિયે.

તાલિબ ગમે મદ્દીના

વ બકીઅ

વ મઞ્ચિંરત



13, શવાલુલ મુકર્રમ સિ. 1428 હ.

## કબ્ર મેં આને વાલા દોષત

યેહ કિતાબ (કબ્ર મેં આને વાલા દોષત)

મજલિસે અલ મદીનતુલ ઈલિમયા (દા'વતે ઈસ્લામી)

ને ઉર્ડૂ જબાન મેં પેશ કી હૈ.

મજલિસે તરાજિમ (દા'વતે ઈસ્લામી) ને ઈસ કિતાબ કો ગુજરાતી રસ્મુલ ખત મેં તરતીબ દે કર પેશ કિયા હૈ ઔર મક-ત-બતુલ મદીના સે શાઅએઅ કરવાયા હૈ. ઈસ મેં અગાર કિસી જગાહ કમી બેશી પાણેં તો મજલિસે તરાજિમ કો (બ જરીઅએ મકતૂબ, ઈ-મેઈલ યા SMS) મુતલઅ ફરમા કર સવાબ કમાઈયે.

**રાખિતા : મજલિસે તરાજિમ (દા'વતે ઈસ્લામી)**

**: મક-ત-બતુલ મદીના :**

સિલેક્ટેડ હાઉસ, અલિફ કી માર્ક્ઝિટ કે સામને,

તીન દરવાજા, અહમદાબાદ ગુજરાત.

**Mobile. 9374031409**

**E mail : translationmaktabhind@dawateislami.net**

યોગ દર્શિત

દૌરાને મુતા-લાયા જરૂરતન અન્ડર લાઈન ક્રિજિયે, ઈશારાત લિખ કરણી સહૃદાન નમબર નોટ ફરમા લીજિયે. مَوْلَى اللّٰهِ عَزَّ وَجَلَّ ના ઈલમ મેં તરક્કી હોગી.

“કુશ જન્મત કે બાગોં મેં સે એક બાગ હૈ યા દોષાખ કે ગઢોં મેં સે એક ગઢા”

(الترْعِيْبُ وَالرَّهِيْبُ ج٤، ص٢٠١، الحدیث ٤١١٥)

# કબી મેં આને વાલા દોષા

[www.dawateislami.net](http://www.dawateislami.net)

પેશકશ

મજલિસે અલ મદીનતુલ ઈલ્મિયા (શો'ખાઓ ઈસ્લાહી કુતુખ)

નાશિર

મક-ત-બતુલ મદીના અહમદઆબાદ

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

- નામ કિતાબ : કબ્ર મેં આને વાલા દોષત
- પેશકશ : મજલિસે અલ મદીનતુલ ઈલ્મિયા (શો'ખએ ઈસ્લાહી કુતુબ)
- સિને તથાઅત : જુમાદિલ અવ્વલ 1432 હિ.
- નાશિર : મક-બ-તુલ મદીના અહમદાબાદ

### તસ્ટીક નામા

તારીખ : ..... હવાલા : .....

الحمد لله رب العلمين والصلوة والسلام على سيد المرسلين وعلى الله واصحابه اجمعين

તસ્ટીક કી જાતી હૈ કે કિતાબ

### “કબ્ર મેં આને વાલા દોષત”

(મત્ભૂઆ મક-ત-બતુલ મદીના) પર મજલિસે તફતીશે કુતુબો રસાઈલ કી જાનિબ સે નજરે સાની કી કોશિશ કી ગઈ હૈ. મજલિસ ને ઈસે અકાઈદ, કુઝિયા ઈભારાત, અખલાકિયાત, ફિક્હી મસાઈલ ઔર અ-રબી ઈભારાત વગેરા કે હવાલે સે મકદૂર ભર મુલા-હજા કર લિયા હૈ, અલબત્તા કમ્પોઝિંગ યા કિતાબત કી ગ-લતિયોં કા જિમ્મા મજલિસ પર નહીં.

મજલિસે તફતીશે કુતુબો રસાઈલ  
(દા'વતે ઈસ્લામી)

14-12-2010

E-mail : ilmia26@dawateislami.net

maktabahind@gmail.com

[www.dawateislami.net](http://www.dawateislami.net)

મ-દની ઈલિજા : કિની ઓર કો યોહ કિતાબ ધાપને કી ઈજાજત નહીં.

الْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعُلَمَيْنَ وَالصَّلٰوٰةُ وَالسَّلَامُ عَلٰى سَيِّدِ الْمُرْسَلِيْنَ  
أَمَّا بَعْدُ فَأَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطَنِ الرَّجِيمِ بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيمِ  
“آہاں کے کتاب بے شک ہے” کے 13 ہزار کی نیزbat سے  
یہ کتاب کو پढنے کی “13 نیزbat”

فِرَمَانَهُ مُسَلِّمًا نَّبِيُّ الْكُوْمَنِ خَيْرٌ مِّنْ عَمَلِهِ: صَلَّى اللّٰهُ تَعَالٰى عَلٰيهِ وَآلِهِ وَسَلَّمَ (المعجم الكبير للطبراني، الحديث: ۵۹۴۲، ج. ۶، ص. ۱۸۵)

دو م-دنی کوئل : **(1)** بیگنے اور ایکی نیزbat کے کسی بھی آ-ملنے پر کا سواب نہیں میلتا.

**(2)** جیتنی ایکی نیزbat کی خیادا، عیناً سواب بھی کی خیادا.

**(1)** ہر بار ہم و **(2)** سلماں اور **(3)** تابعوں و **(4)** تasmیم سے آگاہ کر دیں۔ (یہی سکھتا پر عیپر دی ہوئی دو آ-ربھی ہندوستان پढ لئے سے چاروں نیزbatوں پر املاک ہو جائے گا)۔

**(5)** ہر لفڑی و سبھ کوئی کوئی ایکی نیزbat کی خیادا رے موتا-لਆ کر دیں۔ **(6)** کبھی دو موتا-لਆ کر دیں۔ **(7)** کوئی آیات اور **(8)** احادیث سے موباکر کی خیادا کر دیں۔ **(9)** جہاں جہاں ”اللہا عَزَّوَجَلَّ“ کا نامے پاک آئے گا وہاں اور **(10)** جہاں جہاں ”سرکار“ کا ہر سے موباکر آئے گا وہاں اور **(11)** شر-دی مسائیل سیخون گا۔

**(12)** اگر کوئی بات سمجھ ن آئی تو ہندوستان سے پوچھ لے گا۔ **(13)** کتابت وغیرہ میں شر-دی گلتوں میں تو ناشرین کو تکریری توار پر موتا لفڑی کر دیں۔ (مुسٹیک یا ناشرین وغیرہ کو کتابوں کی اگلائات سیکھ جانی باتا نہیں بلکہ موسیٰ نبی کے نام پر۔)

الْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلٰوةُ وَالسَّلَامُ عَلٰى سَيِّدِ الْمُرْسَلِينَ  
أَمَّا بَعْدُ فَأَعُوذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيمِ بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيمِ

### અલ મદીનતુલ ઈલ્મયા

અજ : બાનિયે દા'વતે ઈસ્લામી, આશિકે આ'લા હજરત, શૈખે તરીકત,  
અમીરે અહલે સુન્નત, હજરતે અલ્લામા મૌલાના અભૂ બિલાલ  
મુહમ્મદ ઈલ્યાસ અતાર કાદિરી ૨-જવી જિયાઈ ડામત بِرَكَاتُهُمُ النَّاهِيَةُ

الحمد لله على إحسانه وبفضل رسله صلى الله تعالى عليه وسلم

તજ્જીગે કુરાનો સુન્નત કી આલમગીર ગૈર સિયાસી  
તહરીક, “દા'વતે ઈસ્લામી” નેકી કી દા'વત, એહ્યાએ સુન્નત ઔર  
ઈશાઅતે ઈલ્મે શરીઅત કો દુન્યા ભર મેં આમ કરને કા અજૂમે  
મુસમ્મમ રખતી હૈ, ઈન તમામ ઉમૂર કો બ હુસ્નો ખૂબી સર અન્જામ  
દેને કે લિયે મુ-તઅદ્વદ મજલિસ કા કિયામ અમલ મેં લાયા ગયા હૈ  
જિન મેં સે એક મજલિસ “અલ મદીનતુલ ઈલ્મયા” ભી હૈ જો  
દા'વતે ઈસ્લામી કે ઉલમા વ મુફ્તિયાને કિરામ بِرَكَاتُهُمُ اللَّٰهُ تَعَالٰٰيْ પર  
મુશ્તમિલ હૈ, જિસ ને ખાલિસ ઈલ્મી, તહકીકી ઔર ઈશાઅતી કામ  
કા બીડા ઉઠાયા હૈ. ઈસ કે મુન્દરી-જાઓ જૈલ છ શો'બે હું :

- (1) શો'બાએ કુતુબે આ'લા હજરત (2) શો'બાએ દર્સી કુતુબ  
(3) શો'બાએ ઈસ્લાહી કુતુબ (4) શો'બાએ તરાજિમે કુતુબ  
(5) શો'બાએ તરફતીશે કુતુબ (6) શો'બાએ તખરીજ

“અલ મદીનતુલ ઈલ્મયા” કી અવ્યલીન તરજીહ સરકારે

આ'લા હજરત ઈમામે અહલે સુન્નત, અગ્રીમુલ બ-ર-કત, અગ્રીમુલ મર્તબત, પરવાનાએ શરમે રિસાવત, મુજદ્દિદે દીનો ભિલ્ખત, હામિયે સુન્નત, માહિયે બિદ્દાત, આલિમે શરીઅત, પીરે તરીકત, બાઈસે ઐરો બ-ર-કત, હજરતે અલ્લામા મૌલાના અલહાજ અલ હાફિજ અલ કારી શાહ ઈમામ અહમદ રગા ખાન عَلَيْهِ رَحْمَةُ الرَّحْمَنِ કી ગિરાં માયા તસાનીઝ કો અસ્રે હળિર કે તકાજોં કે મુતાબિક હતાલ વસણ સહ્યાલ ઉસ્લૂબ મેં પેશ કરના હૈ. તમામ ઈસ્લામી ભાઈ ઔર ઈસ્લામી બહને ઈસ ઈલ્મી, તહકીકી ઔર ઈશાઅતી મ-દની કામ મેં હર મુદ્દિન તઆવુન ફરમાએં ઔર મજલિસ કી તરફ સે શાઅએ હોને વાલી કુતુબ કા ખુદ ભી મુતા-લાયા ફરમાએં ઔર દૂસરોં કો ભી ઈસ કી તરગીબ દિલાએં.

અલ્લાહ “દા'વતે ઈસ્લામી” કી તમામ મજલિસ બ શુમૂલ “અલ મદીનતુલ ઈલ્મિયા” કો દિન જ્યારહવીં ઔર રાત બારહવીં તરક્કી અતા ફરમાએ ઔર હમારે હર અ-મલે જૈર કો જેવરે ઈલ્માસ સે આરાસ્તા ફરમા કર દોનોં જહાં કી ભલાઈ કા સબબ બનાએ. હમેં જેરે ગુમ્બદે ખજરા શહાદત, જન્નતુલ બડીએ મેં મદ્દિન ઔર જન્નતુલ ફિરદૌસ મેં જગા નસીબ ફરમાએ.

أَمِينٌ بِجَاهِ اللَّبِيِّ الْأَمِينِ صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ



૨-મજાનુલ મુખારક 1425 હિ.

ફિહરિસ્ત

ઉન્વાન	સરફણી નંખર	ઉન્વાન	સરફણી નંખર
હુરુદ શરીર કી ફિજીલત	9	અભી સે તથ્યારી કર લીજિયે	33
વફાદાર કૌન ?	11	જન્નત કા બાગ યા જહન્નમ કા ગઢા	35
હમ કિસ પર મેહરબાન હોય ?	12	કબી કો જહન્નમ કા ગઢા બનાને વાલે આ'માલ	35
પીછે ક્યા છોડા ?	13	ચુગુલ ખોરી	35
અહલો અયાલ કો અપના સબ કુછ સમજ્ઞને વાલે	14	કબી મેં આગ ભડક રહી થી	36
અપને આપ કો હલાકત મેં ડાલને વાલા બદનસીબ	14	ગીબત	37
કિયામત કે હિન અહલો અયાલ કા દા'વા	15	ગીબત કિસે કહતે હોય ?	38
કયું રોતે હો ?	16	અક્સરિયાત ગીબત કી લપેટ મેં હે	38
અમલ ને કામ આના હૈ	18	નમાજ ન પઢના	39
મુર્દુ કી હસરત !	19	સિયાહ ખચ્ચ્યર નુમા બિચ્છૂ	40
નેક વ બદ દોનોં કો હસરત હોગ્યી	20	વાલિદેન કી ના ફરમાની	41
હમ ભી તુમ્હારે પીછે આને વાલે હોય	21	રૈંકને વાલા ગધા	42
ધોકે મેં ન રહિયે	21	કિન બાતોં મેં ઈતાઅત કી જાએગી ?	43
કબી કી પુકાર	23	જકાત ન દેને કા વબાલ	43
તનાદાઈ હી કાઝી હૈ	24	ગન્જા સાંપ ગળે મેં ડાલ દિયા જાએગા	45
હુન્યા સે જાને વાલોં કો યાદ કીજિયે	25	અજાબાત કા દર્દનાક નકશા	45
એક હિન મરના હૈ આભિર મૌત હૈ	26	જકાત કિસ પર ફરજ હૈ ?	47
મૌત કો યાદ કરને કા ફાન્દેદા	27	વૂટ કે માલ સે હજ કરને વાલે કા અન્જામ	47
અપની મૌત કો યાદ કીજિયે	27	શરાબ, જિના, ગીબત, જૂટી કસમે	
હમ પર ક્યા ગુરુરેગી ?	29	ખાના ઓર રોજા ન રખના	48
મુર્દુ કે સદમે	30	શરાબી કા અન્જામ	49
કબી વાલે કિસ પર રશક કરતે હોય ?	32	બિન્જીર નુમા મુર્દા	49

ઉન્વાન	સરફણ નામભર	ઉન્વાન	સરફણ નામભર
આગ કી કીલેં	50	બદ અકી-દગી સે તૌબા	66
આગ કી લપેટ મેં	50	મસ્તિષ્ઠ રોશન કરને કી ફરીલત	69
જવાની મેં તૌબા કા ઈન્નામ	50	મરીજ કી ઈયાદત	70
પેશાબ સે ન બચના	51	ઈયાદત કે મ-દની ફૂલ	70
મિલાવટ કરને કી સજા	51	મરીજ કે લિયે એક દુઅા	71
મિલાવટ કા શર-ઈ હુકમ	52	મ-દની ઈન્નામાત ઔર ઈયાદત	71
ગુસ્લે જનાબત મેં તાખીર	54	સૂરએ મુલ્ક પઢને કા ઈન્નામ	73
ગુસ્લે જનાબત મેં તાખીર કબ હરામ હૈ	54	કબ્ર મેં સૂરએ મુલ્ક પઢી જા રહી થી	73
જનાબત કી હાલત મેં સોને કે અહકામ	55	કબ્ર મેં ફિરિશતા કુરાન પઠાએગા	74
સૂદખોર કા અન્જામ	56	સૂરએ યાસીન શરીફ કી બ-ર-કત	74
મુર્દા ઊંઠ બૈઠા	57	સૂરએ સજુદહ શફાઅત કરેગી	74
માં સે જિના કરને વાલા	58	સૂરએ જિલજાલ પઢને કી બ-ર-કતેં	75
પેટ મેં સાંપ	58	સૂરએ ઈખ્લાસ પઢને કા ફાઅદા	76
મસ્કિછ મેં હંસના	59	શબે જુમુઆ કા હુરુદ	76
લઘૂકત પર નહીં હવાકત પર નહીં રખિયે	59	કબ્ર કી ગમ ગુસાર	76
કબ કે જન્નત કા બાગ બનાને વાલે આ'માલ	61	તહજજુદ કા નૂર	77
નમાઝ, રોજા, હજ ઔર ઝકાત વગેરા	62	એક હજાર અન્વાર	78
મુઝે નમાઝ પઢને દો	63	નેકી કી દા'વત	79
કબ્ર મેં નમાઝ પઢને વાલે બુઝુર્ગ	64	મુખલિલગીન કી કબ્રે	79
દો અંધેરે દૂર હોંગે	64	જગ-મગાઓંગી	79
ખુશબૂદાર કબ	65	હુન્યા મેં મુસીબત ઉઠાના	80
કબ્ર મેં તિલાવત કરને વાલે બુઝુર્ગ	65	લોગોં કો તકલીફ ન પહોંચાને કા ઈન્નામ	80
સબ્ર કે અન્વાર	66	ઈસાલે સવાબ	81

ઉન્વાન	સર્ફાનામભર	ઉન્વાન	સર્ફાનામભર
કિન્દો કા તોઢકા	81	કબ્ર મેં ખુશ ખબરી પાને વાલો કી હિકાયાત	91
“કરમ” કે તીન હુરુફ કી નિસ્બત સે ઈસાલે સવાબ કી 3 હિકાયાત	82	કલિમાએ શહાદત કી તસ્ટીક કરને વાલે કી બજ્જિશા હો ગઈ	91
બાગ સ-દકા કર દિયા	82	અજાન કે જવાબ કી ફરીલત	93
ફસાડી કી મજિફરત	82	3 કરોડ 24 લાખ નેકિયાં કમાઈયે	93
રોજાના એક કુરાને પાક ઈસાલે સવાબ કરને વાલા નૌ જવાન	83	અજાન વ ઈકામત કે જવાબ કા તરીકા	94
સ-દકા દેને સે કબ્ર કી ગરમી દૂર હોતી હૈ	84	સૂરાએ કહુફ કી તિલાવત કી બ-ર-કત	96
રાડે ખુદા મેં ખર્ચ દીજિયે	84	કબ્ર મેં લાયબ્રેરી	97
અપને સ-દકાત દા'વતે ઈસ્લામી કો દીજિયે	85	શૈખેન કે દીવાને કી નજીત	97
ખત્મ ન હોને વાલે 7 આ'માલ ઈલ્મ કબ્ર મેં સાથ રહેગા	86	ઔલિયા કે નામ લેવા કી નજીત	97
ઈલ્મ કબ્ર મેં સાથ રહેગા	86	બેશક મુઝે દો જન્નતે અતા કી ગઈ	98
ઔલાદ કે ઈલે દીન સિખાને કી બ-ર-કત મુસલ્માન કે દિલ મેં ખુશી દાખિલ કરને કા સવાબ	86	દ-રજીત મેં ફક	100
કિસી કે દિલ મેં ખુશી દાખિલ કરને કે ચન્દ કામ	87	મુઝિત્યે દા'વતે ઈસ્લામી કી જબ કબ્ર ખુલ્લી	101
અજાબે કબ્ર સે મહફૂજ રહેને વાલે	88	કબ્ર મેં મચ્યિત કે સાથ તબર્કુકાત રખિયે	104
ખુશ નસીબ	89	હજરતે સચિયદુના અમીરે	
શહીદ અજાબે કબ્ર સે મહફૂજ રહતા હૈ	89	મુઆવિયા <small>رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ</small> કી વસિય્યત	104
પેટ કે મરજ મેં મરને વાલા	90	તબર્કુકાત રખને કા તરીકા	105
જુમુઆ કે દિન ફૌત હોને વાલા	90	કબ્ર પર તલ્કીન કા તરીકા	105
કબ્ર મેં વહૃશત ન હોણી	91	કબ્ર પર અજાન દીજિયે	106
		કફન કે લિયે તીન અનમોલ તોડકે	107
		માખજ વ મરાજેઅ	109
		અલ મદીનતુલ ઈલિમ્યા કી કુતુબ વ રસાઈલ	111

الْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعُلَمَائِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلٰى سَيِّدِ الْمُرْسَلِينَ  
أَمَّا بَعْدُ فَاعُوذُ بِإِلٰهِ النَّاسِ الرَّحِيمِ بِسْمِ إِلٰهِ الرَّحْمٰنِ الرَّحِيمِ

## کب مें آगे वाला ढोखा

शैतान आप को लाख सुस्ती दिलाए भगव आप येह किताब पढ़ लीजिये, कब्र व हशर की तथ्यारी का झेहन बनेगा, إِنْ شَاءَ اللّٰهُ عَزَّ وَجَلَّ

### दुरुद शरीक की इग्नीलत

बेचैन हिलों के थैन, रहमते दारैन, ताजदारे ह-रमैन, सरवरे कौनैन का फरमाने रहमत निशान है : जब जुमा'रात का दिन आता है **अल्लाह** उर्जोजल फ़िरिश्तों को भेजता है जिन के पास चांदी के कागज और सोने के कलम होते हैं वोह लिखते हैं, कौन योमे जुमा'रात और शबे जुमुआ मुझ पर कसरत से हुरुदे पाक पढ़ता है.

(كتاب العمال ج ۱ ص ۲۵۰ حدیث ۴۷۱۲)

**صَلُوٰعَلَى الْحَبِيبِ ! صَلَوٰتُ اللّٰهُ تَعَالٰى عَلٰى مُحَمَّدٍ**

उम्मुल मुआमिनीन हजरते सच्चि-दतुना आईशा सिदीका سے मरवी है के एक दिन नूर के पैकर, तमाम नबियों के सरवर, सुल्ताने बहूरो बर ने सहाबे किराम से रضي الله تعالى عنهم سे दरयाइत फरमाया : “तुम जानते हो के तुम्हारी, तुम्हारे अहलो अयात, माल और आमाल की भिसाल कैसी है ?” अर्ज की : “**أَلَّهُ وَرَسُولُهُ أَكْلُمُ**” और उस का रसूल ने जवाब दिया : “**تُعْلَمُ**” इशाई फरमाया : “तुम्हारी,

## કબ મેં આબે વાલા દોષત

તુમ્હારે અહલો અયાલ, માલ ઔર આ'માલ કી મિસાલ ઉસ શખ્સ કી તરહ હે જિસ કે તીન ભાઈ હોં, જબ ઉસ કી મૌત કા વક્ત કરીબ આએ તો વોહ અપને તીનોં ભાઈયોં કો બુલાએ ઔર એક સે કહે : “તુમ મેરી હાલત દેખ રહે હો, યેહ બતાઓ કે તુમ મેરે લિયે ક્યા કર સકતે હો ?” વોહ જવાબ દે : “મૈં તુમ્હારે લિયે ઈતના કર સકતા હું કે ફિલહાલ તુમ્હારી તીમાર દારી કરું, તુમ્હારે સાથ રહ કર તુમ્હારી હાજાત વ ઝરાયાત કો પૂરા કરું ફિર જબ તુમ્હારા ઈન્જિકાલ હો જાએ તો તુમ્હેં ગુસ્સા દે કર કફન પહનાડિં ઔર લોગોં કે સાથ મિલ કર તુમ્હારા જનાઓ ઉઠાડિં કે કબી મૈં કન્ધા દું તો કબી કોઈ ઔર શખ્સ, જબ (તુમ્હેં દફન કર કે) વાપસ આડિં તો જો કોઈ તુમ્હારે બારે મેં પૂછે ઉસ કે સામને તુમ્હારી ભલાઈ હી બયાન કરું.” યેહ ભાઈ દર હકીકત ઉસ શખ્સ કે અહલો અયાલ હેં. યેહ ફરમાને કે બા'દ સરકારે મદ્દીના صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَسَلَّمَ ને સહાબે ડિરામ સે પૂછા : “ઈસ કે બારે મેં તુમ્હારા ક્યા બયાલ હૈ ?” અર્જ કી : “યા રસૂલલ્હાહ ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَسَلَّمَ હમ ઈસ મેં કોઈ ભલાઈ નહીં પાતે.” આપ صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَسَلَّمَ ને કલામ જારી રખતે હુએ ઈશાં ફરમાયા : ફિર વોહ અપને દૂસરે ભાઈ સે કહે : “તુમ ભી મેરી હલાત દેખ રહે હો, મેરે લિયે ક્યા કર સકતે હો ?” તો વોહ જવાબ મેં કહે : “મૈં ઉસ વક્ત તક તુમ્હારા સાથ દુંગા જબ તક તુમ જ્ઞાન હો, જુંદી તુમ દુન્યા સે રૂખ્સત હોગે હમારે રાસ્તે જુદા હો જાઓગે કયુંકે તુમ કષ્ટ મેં પહોંચ જાઓગે ઔર મૈં યહીં દુન્યા મેં રહ જાઉંગા.” યેહ ભાઈ અસ્ત મેં ઉસ શખ્સ કા માલ હૈ, ઈસ કે બારે મેં તુમ્હારા

ક્યા ખ્યાલ હૈ ? સહાબે કિરામ ઉલ્લેખ રિઝ્વોન ને અર્જ કી : “યા રસૂલલલાહ ! હમ ઈસે ભી અચ્છા નહીં સમજતે.”

મ-દની આકા સહાબે કિરામ ને મજીદ ઈશ્વરીં ફરમાયા : ફિર વોહ શાખ અપને તીસરે ભાઈ સે કહે : “યકીનન તુમ ભી મેરી હાલત દેખ રહે હો ઔર તુમ ને મેરે અહલો અયાલ ઔર માલ કા જવાબ ભી સુન લિયા હૈ, બતાઓ તુમ મેરે લિયે ક્યા કર સકતે હો ?” વોહ ઉસે તસ્લી દેતે હુએ કહે : “મેરે ભાઈ ! મૈં તો કષ્ટ મેં ભી તુમ્હારે સાથ રહ્યુંગા ઔર તુમ્હેં વહ્યશત સે બચાઉંગા ઔર જબ યૌમે હિસાબ આયેગા તો મૈં તેરે મીજાન મેં જા બૈદ્યુંગા ઔર ઉસે વજ્ઞન દાર કર દુંગા.” યેહ ઉસ કા અમલ હૈ, ઈસ કે બારે મૈં તુમ્હારા ક્યા ખ્યાલ હૈ ? સહાબે કિરામ ને અર્જ કી : “યા રસૂલલલાહ ! યેહ તો બહુત અચ્છા દોસ્ત હૈ.” હુજુરે પુરનૂર, શાફીએ યૌમુન્નુશૂર ઈશ્વરીં ફરમાયા : “ا'લ્માર્હ હક્કા” “ની યેહી હકીકત હૈ.”

(કન્તુલુંઘ, કાબિલી, મુદ્રા, જ ૧૫, પ ૩૧૮)

صَلَوَاتُ اللَّهِ تَعَالَى عَلَى مُحَمَّدٍ  
صَلَوَاتُ اللَّهِ تَعَالَى عَلَى الْحَبِيبِ !

**વર્ણાદાર કોન ?**

મીઠ મીઠે ઈસ્લામી ભાઈયો ! આપ ને મુલા-હજા ફરમાયા કે હમારે આકા, મક્કી મ-દની મુસ્તફા ને એક આસાન મિસાલ કે જરીએ અમલ કી અહિમિયત કો બયાન ફરમાયા. યકીનન માલ, અહલો અયાલ ઔર આ'માલ મેં સે હમારા સબ સે વર્ણાદાર

દોસ્ત “અમલ” હૈ જો કબ્ર વ હશર મેં ભી હમારા મદદગાર હોગા.

તું અપણી મૌત કો મત ભૂલ કર સામાન ચલને કા અમીં કી ખાક પર સોના હૈ ઈટોં કા સિરહાના હૈ  
ન બેલી હો સકે ભાઈ ન બેટા બાપ તે માઈ તું ક્યુંફિરતા હૈ સોદાઈ અમલ ને કામ આના હૈ

## હમ કિસ પર મેહરબાન હું ?

ઈન્સાન વફાદાર દોસ્ત કા કદરાન ઔર ઉસી પર જિયાદા મેહરબાન હોતા હૈ, ઈસી બાત કે પેશે નજર હમેં જિયાદા અહિમિયત “કબ્ર વ હશર મેં કામ આને વાલે દોસ્ત” યા’ની અમલ કો દેની ચાહિયે થી મગર અફસોસ ! એસા નહીં હૈ, હમ મેં સે કુછ લોગ માલ કો જિયાદા અહમ સમજતે હૈને હાલાંકે યેહ ઉસ વકત તક હમારા સાથ દેતા હૈ જ્યા તક હમારી સાંસેં બહાલ હૈને, આંખેં બન્ધ હોતે હી હમેં છોડ કર હમારે વારિસોં કે પાસ ચલા જાતા હૈ ઔર કબ્ર મેં “ફૂટી કોડી” ભી હમારે સાથ નહીં જાતી ક્યુંકે કફન મેં થેલી હોતી હૈ ન કબ્ર મેં તિજોરી ! ઝરાયાતે જિન્દગી કી તકમીલ કે લિયે માલ કી અહિમિયત સે ઈન્કાર નહીં મગર આજ હમારી ગાલિબ અકસરિયત માલો દૌલત કી મહિયત મેં ઐસી ગરિફતાર હૈ કે જિયાદા સે જિયાદા માલ કમાને કી ધુન મેં હરામ વ ના જાઈજ જરાએએ બે દરેગ ઈસ્તિ’માલ કિયે જાતે હૈને મ-સલન રિશવત ઔર સૂદ કા લૈન હૈન કિયા જાતા હૈ, જખીરા અન્દોડી કી જાતી હૈ, જમીનોં પર કષે કિયે જાતે હૈને, લોગોંને કે કર્ણે દબાએ જાતે હૈને, અમાનત મેં ખિયાનત કી જાતી હૈ, વક્ફ કે અમ્વાલ મેં ખુર્દ ખુર્દ કી જાતી હૈ, ચોરી કી જાતી હૈ, ડાકા મારા જાતા હૈ, ચિછિયાં ભેજ કર લોગોંને સે ભતા વુસૂલ કિયા જાતા હૈ, માલદારોં કો તાવાન કી ખાતિર ઈગવા કિયા જાતા હૈ, અલ ગરાજ તિજોરી કો રૂપૈ પૈસે ઔર સોના ચાંદી સે ભરને કે લિયે નામએ

## કબુ મે આની વાલા દોષ

આ'માલ કો ખૂબ ગુનાહોં સે ભરા જાતા હૈ. ઐસા કરને વાલોં કે દિલો દિભાગ પર દિર્સ વ લાલચ કા ઈતના ગ-લબા હો જાતા હૈ કે ઉન્હેં યેહ એહસાસ તક નહીં હોતા કે એક દિન સબ યહીં છોડ જાના હૈ, જૈસા કે

## ਪਿੱਛੇ ਕਥਾ ਛੋਡਾ ?

ਹਾਰਤੇ ਸਥਿਅਨਾ ਅਭੂ ਛੁਰੈਰਾ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْ ਸੇ ਮਰਕੂਅਨ  
 ਮਰਵੀ ਹੈ : “ਜਬ ਕੋਈ ਸ਼ਖਸ ਮਰ ਜਾਤਾ ਹੈ ਤੋ ਫਿਰਿਥੇ ਕਹਤੇ ਹੋਣ ਕੇ ਇਸ  
 ਨੇ ਆਗੇ ਕਿਆ ਭੇਜਾ ? ਔਰ ਲੋਗ ਪ੍ਰਦੱਤੇ ਹੋਣ : ਇਸ ਨੇ ਪੀਛੇ ਕਿਆ ਢੋਡਾ ?”

(شعب الایمان، الحديث ٤٧٥، ج ٧، ص ٣٢٨)

ਮੁੜਿਸ਼ਾਰੇ ਸ਼ਹੀਰ ਛਕੀਮੁਲ ਉਮਮਤ ਦੁਆਰੇ ਮੁੜਤੀ ਅਹਮਦ ਧਾਰ  
 ਖਾਨ علیہ رحمةُ اللہ ਈਸ ਛਦੀਸੇ ਪਾਕ ਕੇ ਤਫ਼ਤ ਫਰਮਾਤੇ ਹਨ : “ਧਾਰੀ  
 ਮਰਤੇ ਵਕਤ ਉਸ ਕੇ ਵਾਰਿਸੀਨ ਤੋ ਛੋਡੇ ਹੁਏ ਮਾਲ ਕੀ ਫਿਕ ਮੌਹਾਂ ਵਿੱਚ ਹੋਤੇ ਹਨ ਕੇ  
 ਕਿਆ ਛੋਡੇ ਜਾ ਰਹਾ ਹੈ ? ਔਰ ਜੋ ਮਲਾਏਕਾ (ਧਾਰੀ ਵਿੱਚੋਂ) ਉਸ ਕੀ  
 ਕਢੇ ਰੂਹ ਵਗੈਰਾ ਕੇ ਲਿਧੇ ਆਤੇ ਹਨ ਵੋਹ ਉਸ ਕੇ ਆਮਾਲ ਵ ਅਕਾਈਂਦ ਕਾ  
 ਲਿਸਾਬ ਲਗਾਤੇ ਹਨ.” (ਮਿਰਾਤੁਲ ਮਨਾਤੁਲ, ਖਿ. 7, ਸ. 84)

(મિરઆતુલ મનાજીહ, જિ. 7, સ. 84)

ਦੌਲਤੇ ਫੁਨ੍ਹਾ ਕੇ ਪੀਛੇ ਤੂ ਨ ਜਾ ਆਖਿਰਤ ਮੇਂ ਮਾਲਾ ਕਾ ਹੈ ਕਾਮ ਕਿਆ

ਇਲ ਸੇ ਫੁੱਲ ਕੀ ਮਹਿਸੂਸ ਹੂਰ ਕਰ      ਇਲ ਨਵੀ ਕੇ ਈਥਰ ਸੇ ਮਾ'ਮੂਰ ਕਰ

ਲਾਂਡਨੀ ਪੇਰਿਸ ਕੇ ਸਪਨੇ ਛੋਡ ਦੇ

ਖਸ ਮਈਨੇ ਹੀ ਸੇ ਰਿਖਤਾ ਆਂਡ ਲੇ

(વસાઈલે બચ્છિશા, સ. 375)

صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

## અહલો અયાલ કો અપના રાબ કુછ સમગ્રને વાલે

હમ હુન્યા મેં તન્દા આએ થે ઔર તન્દા હી લૌટ જાઓંગે,  
લેકિન ઈસ હુન્યા મેં હમ તન્દા નહીં રહેતે બલ્કે બહુત સે અફરાદ  
મ-સલન માં બાપ, બહન ભાઈ, બીવી બચ્ચે, અઝીજો અકારિબ  
ઔર દોસ્ત અહબાબ વગેરા હમારી જિન્દગી કા હિસ્સા હોતે હું,  
વોહ હમારા ઔર હમ ઉન કા ખયાલ રખતે હું ઔર રખના ભી  
ચાહિયે ક્યુંકે શરીઅત ને ભી ઈન કે હુકૂક બયાન કિયે હું. ફિન્ડી તૌર  
પર હમેં ઈન સે મહિષત હોતી હું મગર અક્સર લોગ અપને અહલો  
અયાલ કી મહિષત મેં ઐસા ગુમ હો જાતે હું કે ફિર ઉન્હેં કષ્ટ યાદ  
રહતી હું ન મૈદાને મહિશર, જિસ કા નતીજા યેહ નિકલતા હું કે  
મુઅજ્રિઝન નમાજ કે લિયે બુલા રહા હોતા હું મગર યેહ ઘર વાલોં સે  
ખુશ ગળ્પિયોં મેં ઐસે મગન હોતે હું કે ભરી મહિલ છોડ કર મસ્જિદ  
કા રૂખ કરને કો ઈન કા જી નહીં ચાહતા, ઈન કે બચ્ચોં કા કિસી કે  
બચ્ચોં સે જગડા હો જાએ તો અપની ઔલાદ કા કુસૂર હોને કે બા  
વુજૂદ મુઆફી માંગને કે બજાએ તૂ તુકાર બલ્કે મારધાડ પર ઉત્તર  
આતે હું, શરીઅત ઔરત સે પદ્દ કા તકાજા કરતી હું મગર યેહ  
અપને શોહર કો રાજી રખને કે લિયે બે પદ્દગી કા ઈશ્ટિહાર બન કર  
રહ જાતી હું, ઈસી તરફ બા'જ નાદાન અપને ઘર વાલોં કી ફરમાઈશેં  
ઔર ઝરૂરતેં પૂરી કરને કે લિયે માલે હરામ કા વબાલ ભી અપને સર  
લે લેતે હું જો કે સરાસર ખસારે કા સૌદા હૈ, ચુનાન્યે

## અપને આપ કો હલાકત મેં ડાલને વાલા બદ વરીબ

હમારે ઘારે આકા, તમામ નબિયોં કે સરવર, દો જહાં કે  
તાજવર ને ચَلِيَ اللَّهُ تَعَالَى عَلَيْهِ وَبِرَحْمَةِ رَسُولِهِ وَسَلَّمَ ઈશ્રાદ ફરમાયા : “લોગોં પર એક  
ઝમાના ઐસા આએગા કે મોમિન કો અપના દીન બચાને કે લિયે

એક પહાડ સે દૂસરે પહાડ ઔર એક ગાર સે દૂસરી ગાર કી તરફ ભાગના પડેગા તો ઉસ વક્ત રોજી અલ્લાહ ગુર્રોજલ્ કી નારાજી હી સે હાસિલ કી જાએગી ફિર જબ ઐસા જમાના આ જાએગા તો આદમી અપને બીવી બચ્ચોં કે હાથોં હલાક હોગા, અગર ઉસ કે બીવી બચ્ચે ન હોં તો વોહ અપને વાલિફૈન કે હાથોં હલાક હોગા, અગર ઉસ કે વાલિફૈન ન હુએ તો વોહ રિશ્ટેદારોં ઔર પડેસિયોં કે હાથોં હલાક હોગા.” સહાબાએ કિરામٌ عَلَيْهِمُ الرَّضْوَانُ ને અર્જ કી : “યા રસૂલલખાહ ! વોહ કેસે ?” ફરમાયા : “વોહ ઉસે માલ કી કમી કા તા’ના ઢંગે તો આદમી અપને આપ કો હલાકત મેં ડાલને વાલે કામોં મેં મસરૂફ કર દેગા.” (તો ગોયા ઉન્હીં કે હાથોં હલાક હુવા)

(التر غيب والترهيب، كتاب الأدب بباب في العزلة لمن لا يأبه من ...الخ رقم ١٦، ج ٣، ص ٢٩٩)

અપને ઘર વાલોં કો હરામ કમા કર જિલાને વાલોં કો સંભલ જાના ચાહિયે કે મૈદાને મહશર, કે જહાં એક એક નેકી કી સખ્ત હાજત હોગી, યેહી “અપને” ઉસ સે ક્યા સુલૂક કરેંગે ? યેહ જાનને કે લિયે નીચે દી ગઈ રિવાયત બાર બાર પઢિયે, ચુનાન્યે

## કિયામત કે દિન અહલો અચાલ કા દા'વા

મરવી હૈ કે “મુર્દું સે તઅલ્લુક રખને વાલોં મેં પહલે ઉસ કી જોજા ઔર ઉસ કી ઓલાદ હૈ, મગર યેહ સબ (યા’ની બીવી, બચ્ચે કિયામત મેં) અલ્લાહ ગુર્રોજલ્ કી બારગાહ મેં અર્જ કરેંગે : “એ હમારે રબ ! હમેં ઈસ શાખ્સ સે હમારા હક લે કર દે, ક્યૂંકે ઈસ ને કબી હમેં દીની ઉમ્ર નહીં સિખાએ ઔર યેહ હમેં હરામ જિલાતા

था جिस کا ہم میں ہلکا نہیں था۔” چوناًन्ये उस शाखा से उन का बदला लिया जाएगा।” एक और रिवायत में है कि “बन्दे को भीजान के पास लाया जाएगा, फ़िरिश्ते पहाड़ के बराबर उस की नेकियां लाएंगे तो उस से उस के अयात की खबर गीरी और जिदमत के बारे में सुवाल होगा और माल के बारे में पूछा जाएगा कि कहां से हासिल किया? और कहां खर्च किया? हत्ता के उस के तमाम आ’माल उन के मुता-लबात में खर्च हो जाएंगे और उस के लिये कोई नेकी बाकी नहीं रहेगी, उस वक्त फ़िरिश्ते आवाज देंगे: “ये होष वोष शाखा है जिस की नेकियां उस के अहलो अयात ले गये और वोष अपने आ’माल के साथ गिरवी है।”

(قوت القلوب، باب ذكر التزويج الخ، ج ٢ ص ٤٧٨، ٤٧٩)

ہماری بیگانی ہوئی آداتِ نیکل جائے میلے گناہوں کے امراء سے شیکھ یا رہب رہنے بلائی کی راہوں میں گامزن ہر دم کرنے ن رہ میرے پاٹ گناہ کا یا رہ

(وساہلہ بخشش، س. 56)

صَلَوَاتُ اللَّهِ تَعَالَى عَلَى مُحَمَّدٍ

**ک्यूं रोते हो ?**

एक शाखा शटीच बीमार था, ऐसा लगता था कि हुन्या में कुछ ही देर का मेहमान है. उस के बच्चे, जौजा और मां बाप ہر गिर्द खड़े आंसू बहा रहे थे. उस ने अपने वालिद से पूछा: “अब्बाजन! आप को किस चीज़ ने रुलाया?” कहने लगे: “मेरे जिगर के दुक्के! जुदाई का गम रुला रहा है, तुम्हारे मरने के बाद हमारा क्या बनेगा?” उस शाखा ने अपनी वालिदा से पूछा:

“ଯାରୀ ଅଭ୍ୟାସ ! ଆପ କ୍ୟୁଁ ରୋ ରହି ହୁଁ ?” ମାଂ ନେ ଜ୍ଵାବ ଦିଯା :  
 “ମେରେ ଲାଲ ! ଦୁନ୍ୟା ସେ ତେରି ରୂପସତୀ କା ସୋଚ କର ରୋ ରହି ହୁଁ, ମୈ ତେରେ  
 ବିଗେର କେସେ ରହ ପାଇଗି ?” ଫିର ଅପଣି ବିବି ସେ ପୂଛା : “ତୁମ୍ହେ କିସ  
 ଚିଙ୍ଗ ନେ ରୋନେ ପର ମଜବୂର କିଯା ?” ଉଥି ନେ ଭି କହା : “ମେରେ ସରତାଜ !  
 ଆପ କେ ବିଗେର ହମାରୀ କିନ୍ଦଗି ଅଞ୍ଚଳନ ହୋ ଜାଏଗି, ଜୁଦାଈ କା  
 ଗମ ମେରେ ଦିଲ କୋ ଧାଈଲ କର ରହା ହୈ, ଆପ କେ ବା’ଦ ମେରା କ୍ୟା ବନେଗା ?”  
 ଫିର ଅପଣେ ରୋତେ ହୁଏ ବଚ୍ଚୋଂ କୋ କରିବ ବୁଲାଯା ଓଁର ପୂଛା : “ମେରେ  
 ବଚ୍ଚୋ ! ତୁମ୍ହେ କିସ ଚିଙ୍ଗ ନେ ରଲାଯା ହୈ ?” ବଚ୍ଚେ କହନେ ଲଗେ : “ଆପ  
 କେ ବିସାଲ କେ ବା’ଦ ହମ ଯତୀମ ହୋ ଜାଏଗେ, ହମାରେ ସର ସେ ଆପ କା  
 ସାଧା ଉଠ ଜାଏଗା, ଆପ କେ ବା’ଦ ହମାରା କ୍ୟା ବନେଗା ?” ଉନ ସବ  
 କୀ ଯେହ ବାତମ ସୁନ କର ବୋହ ଶାଖ୍ସ କହନେ ଲଗା : “ତୁମ ସବ ଅପଣି  
 ଦୁନ୍ୟା କେ ଲିଯେ ରୋ ରହେ ହୋ, ତୁମ ମେଂ ସେ ହର ଶାଖ୍ସ ମେରେ ଲିଯେ ନହିଁ ବଲ୍କେ  
 ଅପନା ନର୍କା ଖତମ ହୋ ଜାନେ କେ ଖୌଫ୍ ସେ ରୋ ରହା ହୈ, କ୍ୟା ତୁମ ମେଂ ସେ  
 କୋଈ ଔସା ଭୀ ହୈ ଜିକେ ଈସ ବାତ ନେ ରଲାଯା ହୋ କେ ମରନେ କେ ବା’ଦ କଷି  
 ମେଂ ମେରା କ୍ୟା ହାଲ ହୋଗା, ଅନ୍କରୀବ ମୁଝେ ଵହ୍ନଶତ ନାକ, ତଂଗେ ତାରିକ  
 କଷି ମେଂ ଛୋଡ଼ ଦିଯା ଜାଏଗା, କ୍ୟା ତୁମ ମେଂ ସେ କୋଈ ଈସ ବାତ ପର ଭୀ  
 ରୋଯା କେ ମୁଝେ ମରନେ କେ ବା’ଦ ମୁନ୍କର ନକ୍ରିର (ୟା’ନୀ କଷି ମେଂ ସୁଵାଲାତ କରନେ  
 ବାଲେ ଫିରିଥିଲାମ) ସେ ଵାସିତା ପଡ଼େଗା ! କ୍ୟା ତୁମ ମେଂ ସେ କୋଈ ଈସ ଖୌଫ୍ ସେ  
 ଭୀ ରୋଯା କେ ମୁଝେ ମେରେ ପରବର୍ଦ୍ଦ ଗାର ଗୁରୁଜ଼ିଲ କେ ସାମନେ ହିସାବୋ କିତାବ କେ  
 ଲିଯେ ଖାଦ୍ୟ କିଯା ଜାଏଗା ! ଆହ ! ତୁମ ମେଂ ସେ କୋଈ ଭୀ ମେରୀ ଉପର୍ବୀ  
 ପରେଶାନିଯିମ କୀ ବଜାହ ସେ ନହିଁ ରୋଯା ବଲ୍କେ ହର ଏକ ଅପଣି ଦୁନ୍ୟା କୀ  
 ବଜାହ ସେ ରୋ ରହା ହୈ.” ଈସ ଗୁରୁତ-ଗୁରୁ କେ କୁଛ ହି ଦେର ବା’ଦ ଉଥ କୀ ଦେଇ  
 କିମ୍ବା ଉନ୍ନୁରୀ ସେ ପରବାଜ କର ଗାଈ.

(عيون الحكايات ص ٨٩ ملخصاً)

میठے میठے ہر سلسلہ می بھائیو ! ہر س لہکاریت میں ہمارے لیے  
ہبھات ہی ہبھات ہے کے وہ احمدلو ایساں جس کے ائمہ آرام کے  
لیے ہم اپنی نہیں کو ربان کر دتے ہیں، جسکے آسائشون ہنے کے  
لیے ہم بڑی بُشی سے مشرکتے برداشت کرتے ہیں، جس کی راہتوں  
کے لیے ہم بُعد کو گاموں کے ہوا لے کر دتے ہیں، جو ہی ہمارا سفرے  
جیونگی بتم ہوتا ہے یعنی ہماری نہیں اپنی فیک ساتانے لگاتی  
ہے کہ ہر کے جانے کے باعث ہمارا کیا بنے گا ? کاش وہ یہ بھی  
سوچتے کہ مرنے کے باعث ہر س کا کیا بنے گا ? اور ہمارے لیے  
دعاۓ میکھیرت و ہر سالے سواب کی کسرت کرتے.

جب کے پہنچے اجل رہ لے جائے گا۔ جس سے بے جان تذپر کر ڈھر جائے گا  
لہذا میں کوئی تری نہیں آجائے گا۔ تуж کو دکنا کے ہر ہر ک پلٹ جائے گا  
(وسائیں بخشش، ص. 355)

## امال نے کام آنا ہے

میठے میठے ہر سلسلہ می بھائیو ! دوسروں کی ہونیا روشان کرنے کے  
لیے اپنی کبھی میں اندھرا مات کیجیے، دللت و مال اور احمدلو  
ایساں کی مہبوبت میں نہ کیاں چوڑیے ن چوناہیں میں پڑیے کہ ہر  
سab کا ساتھ تو آنکھ بند ہوتے ہی ڈھوٹ جائے گا جبکہ نہ کیاں  
کبھی و آبیزت بالکے ہونیا میں بھی کام آئے گی،  
مگر افسوس ! کے آج ہماری اکساریت کی تواناہیاں سوچ  
سے لے کر شام تک اپنی ہونیوی جیونگی کو ہی بے ہتھ سے بے ہتھ  
اور مژہدار بنانے کی دلخواہ میں سفر ہو رہی ہے، سامانے آبیزت  
کی فیک بھوت کم دی�اہی دتی ہے، یاد رجیے ! نہ کہ آممال کی

કદ્ર આજ નહીં તો કલ ઝડુર મા'લૂમ હો જાએગી મગર ઉસ વક્ત સિવાએ હસરત કે કુછ હાથ ન આએગા, જૈસા કે

## મુર્દું કી હસરત !

દા'વતે ઈસ્લામી કે ઈશાઅતી ઈદારે મક-ત-બતુલ મદીના કે મતબૂઆ 32 સફ્ફાત પર મુશ્તમિલ રિસાલે “કબ્ર કા ઈમ્તિહાન” કે સફ્ફાત 4 પર શૈખે તરીકત અમીરે અહલે સુન્ત હજરતે અલ્લામા મૌલાના મુહમ્મદ ઈલ્યાસ અતાર કાઢિરી ﴿بِرَحْمَةِ اللَّهِ تَعَالَى عَنْهُمْ فَرِمَمْાતَهُ﴾ નકલ કરતે હોય : હજરતે સચ્ચિદાનાના અતા બિન યસાર રૂપી ફરમાતે હોય : “જબ માયિત કો કબ્ર મેં રખા જાતા હૈ તો સબ સે પહુલે ઉસ કા અમલ આ કર ઉસ કી બાઈ રાન કો હ-ર-કત દેતા ઔર કહતા હૈ : મૈં તેરા અમલ હું. વોહ મુર્દું પૂછતા હૈ : “મેરે બાલ બચ્યે કહાં હોય ? મેરી ને'મતોં, મેરી દૌલતોં કહાં હોય ?” તો અમલ કહતા હૈ : “યેહ સબ તેરે પીછે રહ ગયે ઔર મેરે સિવા તેરી કબ્ર મેં કોઈ નહીં આયા.” વોહ મુર્દું હસરત સે કહતા હૈ : “એ કાશ ! મૈં ને અપને બાલ બચ્યોં, અપની ને'મતોં ઔર દૌલતોં કે મુકાબલે મેં તુઝે તરજીહ દી હોતી કૃદૂકે તેરે સિવા મેરે સાથ કોઈ નહીં આયા.”

(شرح الصدور، باب ضمة القبر لكل أحد، ص ١١١، ١١٢)

ધુપ અંધેરી કબ્ર મેં જબ જાએગા બે અમલ ! બે ઈતિહા ઘબરાએગા॥

કામ માલો ઝર વહાં ન આએગા ગાફિલ ઈન્સાં યાદ રખ પદ્ધતાએગા॥

(વસાઈલે બજીશાશ, સ. 376)

صَلُوٰ عَلَى الْحَبِيبِ ! صَلُوٰ اللّٰهُ تَعَالٰى عَلٰى مُحَمَّدٍ

## નેક વ બદ દોનો કો હસરત હોગી

મહિબુબે રજબે જુલ જલાલ, સાહિબે જૂદો નવાલ, પૈકરે હુસ્નો જમાલ જી માલ, ચલી લાલ ઉલ્લાલ ! ને ફરમાયા : જો ભી યહાં સે મર કર જાતા હૈ નાદિમ ઝડુર હોતા હૈ. સહાબએ કિરામ ઉલ્લાલ રૂપોનાનું ને અર્જ કી : “યા રસૂલ લલાહ ! નદામત કિસ બાત કી ?” ફરમાયા : અગર વોહ નેક હો તો નાદિમ હોતા હૈ કે કાશ કુછ ઔર નેકી કર લેતા ઔર અગર ખતાકાર હો તો નદામત ઔર હસરત કરતા હૈ કે વોહ (ગુનાહોં સે) કયું બાજ ન આયા.

(جامع الترمذى، كتاب الزهد، باب ما جاء فى ذهاب البصر، الحديث ٢٤١١، ج ٤، ص ١٨١)

**મુફસ્સિસરે શહીર હકીમુલ ઉમ્મત હજરતે મુફતી અહમદ યાર ખાન** “મિરઆતુલ મનાજુહ” જિલ્લા 7 કે સરફા 378 પર ઈસ હદ્દીસ કે તહૃત લિખતે હૈને : લિલાજા હર શાખસ કો ચાહિયે કે મૌત સે પહલે જિન્દગી કો, બીમારી સે પહલે તન્હુરુસ્તી કો, મશ્ગુલિય્યત સે પહલે ફરાગત કો ગનીમત જાને જિતના મૌકાએ મિલે (નેકી) કર ગુજરે

ઉત્તરતે ચાંદ ટલતી ચાંદની જો હો સકે કર લે અંધેરા પાખ આતા હૈ યેહ દો દિન કી ઉઝલી હૈ ઈસ દુન્યા કા એક હી ફેરા મુડનહીં આના દૂજા વાર જો કરના હૈ કર લે યાર ! હો જા સમજદાર

હતા કે અગર કોઈ શાખસ અપની સારી જિન્દગી સજદા સુજૂદ મેં ગુજાર દે વોહ યેહ કહેગા કે મેરી ઉમ્ર ઔર જિયાદા કયું ન હુઠી કે મૈં સજદે સુજૂદ ઔર જિયાદા કર લેતા ઔર આજ ઈસ સે ભી ઉંચા દ-રજા પાતા ! ઈસ ફરમાન મેં કુફ્ફાર ઔર ગુનહગાર સબ દાખિલ હૈને, કુફ્ફાર કો શરમિન્દગી હોણી કે હમ મુસલ્માન કયું ન બને ? ગુનહગાર કો શરમિન્દગી હોણી, હમ નેકૂકાર પરહેજ ગાર કયું ન બને ? ગુનાહોં સે બાજ કયું ન આએ, મગાર કુફ્ફાર કો ઉસ

વક્ત કી યેહ નદામત કામ ન દેગી. (મિરાતુલ મનાજી, જિ. 7, સ. 378)

## હમ ભી તુમારે પીછે આને વાલે હોએ

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! ઈસ હુન્યા મેં રોજાના મુ-તઅદ્દ  
બગ્યે પૈદા હોતે હોએ તો કુછ ઈન્સાન યહાં સે રૂખ્સત ભી હોતે હોએ, યું  
આના જાના લગા રહેતા હોએ, ઈસ લિયે યેહ સમજના નાદાની હોએ કે  
હમ હમેશા દૂસરોને જનાજે હી દેખતે રહેંગે, ભૂલિયે મત ! એક દિન  
વોહ ભી આએગા કે હમારા લી જનાજા ઉઠાયા જાએગા. હજરતે  
સચ્ચિદાનંદા અબૂ હુરૈરા રઃ્ચી الل્હ تَعَالَى عَنْ جَبَرِ كَوْكَبِيْ જનાજા દેખતે તો  
ફરમાતો : “ચલો હમ ભી તુમ્હારે પીછે આને વાલે હોએ.”

(البداية والنهاية، سنتين ستين من الھجرة، ج ٨، ص ٦١٦) વાકેઈ આએ દિન ઉઠને વાલે  
જનાજે હમારે લિયે ખામોશ મુખલિંગ કી દૈસિયત રખતે હોએ.

જનાજા આગે આગે કહ રહા હોએ જહાં વાલો

મરે પીછે ચલે આઓ તુમ્હારા રહનુમા મેં હું

صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

## ધોકે મેં ન રહિયે

જું જું દિન, મહીને ઔર સાલ ગુજરતે જા રહે હોએ જિન્દગી  
હમ સે દૂર ઔર મૌત કરીબ તર હોતી ચલી જા રહી હોએ, લિહાજા અપની  
સાંસોં કો ગનીમત જાનિયે ઔર ગુનાહોંને સે તૌબા કર કે નેકિયાં  
કમાને મેં મસરૂફ હો જાઈયે, કિતને હી લોગ ઐસે હોએ જો આને વાલે  
કલ કે મુન્જાજિર હોતે હોએ કે “યેહ કરેંગે વોહ કરેંગે” ફિર વોહ “કલ”

تو آتا ہے مگر اس کا یعنی اکار کرنے والے اپنی کتب میں اور  
چوکے ہوتے ہیں، جسما کے ہمارے ساییدنَا منسُورِ بیانِ اماماَر  
علیہ رَحْمَةُ اللَّهِ الْغَفَّار نے اُنکے نئے جوان کو نسیحت کرتے ہوئے کہا : “اے  
نئے جوان ! تुجے تیری جوانی کوئے میں نداشے، کیتھے ہی جوان اسے  
थے جنہوں نے توبا میں تابیہ کی اور لمبی لمبی عمدیں باندھ لی،  
میت کو بولنا کر یہہ کھاتے رہے کے کل توبا کر دے گے، پرسوں توبا  
کر دے گے یہاں تک کہ یہی گسلات کی ہالات میں ٹھنڈے میت آگئی  
اور ہوہ انہیں کتب میں جا سوئے، ٹھنڈے ٹھنڈے مال، گولابیوں،  
اویلاں اور مان بادپ نے کوئی فائیڈا نہ دیا، فرمائے یہ لادی ہے :

[www.dawateislami.net](http://www.dawateislami.net)

يَوْمَ لَا يَنْفَعُ مَالٌ وَلَا بَنْوَنٌ ﴿١﴾ تر-۷-میں کنیتِ یہ میان : جس دین

إِلَّا مَنْ أَتَى اللَّهَ بِقُلْبٍ سَلِيمٍ ﴿٢﴾ ن مال کام آئے گا ن بے تھے مگر

وَهُوَ أَلَّا يَنْلَاخُ (عَزَّوَجَلَّ) کے ہنگوں  
(۹۸، اشعراء: ۱۹)

ہاں پر ہوا سلامت دل لے کر.

(مکافحة القلوب، باب فی العشق، ص ۴۳)

آہ ! ہر لمبھا گونھ کی کسرتوں برماں ہے گ-ل-ب اے ہیتاں ہے اور نہ سے باد اتھاں ہے

میٹھی کی شامِ دلخیلی جا رہی ہے ہاے نہ سے ! گرم رہے اے شاب گوناہوں کا ہی بس باجہاں ہے

(واساہلِ بخشش، ص 47)

صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

## کتب کی پुکار

مोہن ترجم نبھی، مکھی م-دھنی، مہبوبے رجھے گانی۔  
 صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ کا فرمائے ہے : “کبھی رومانیا  
 پوکار کر کھتی ہے کہ میں موسا-فرات کا گھر ہوں، میں تاجراہ کا گھر ہوں،  
 میں بیٹھی کا گھر ہوں اور میں کڑیوں کا گھر ہوں۔” جب مومین بندھا  
 دھنایا جاتا ہے تو کبھی کھتی ہے : “مرہبنا ! تू اپنے ہی گھر  
 آیا ! میری پیٹ پر چلنے والوں میں سے تुम میں جیسا مہبوب  
 ہو، آج جب تुم میرے ہواں کر دیتے گئے ہو تو تुم انکریب  
 دے بھوگے میں تुم سے کیا (அங்கு) سुலوک کرتی ہوں۔” چوناںکے کبھی اس کے  
 لیے ہدیہ نیگاہ تک کوشیدا ہو جاتی ہے اور اس کے لیے جنات کا  
 دروازہ بول دیتا جاتا ہے۔ مگر جب گونڈگاڑ یا کاسکر  
 آدھی دھن کیا جاتا ہے تو کبھی کھتی ہے : “ن تो تुہے موبارک  
 ہو اور ن ہی یہ تیرا گھر ہے۔ میری پیٹ پر چلنے والوں میں سے میرے  
 نجدیک تو سب سے بُرًا ہے، آج جب کے تُو میرے سیپُورٹ کیا گیا ہے  
 تو انکریب تُو دے بھوگا میں تیری ڈسی بُر لِتی ہوں !” یہ تیر کر کر  
 کبھی اسے ہس ترہ دبھاتی ہے کہ مُورٹ کی پستی یا ایک دُسروں میں پہنچت  
 ہو جاتی ہے۔ راوی کھتے ہے : یہ تیر بات فرماتے ہوئے رسوئیلیاہ  
 نے اپنے ہاتھوں کی ٹیکلیوں کو ایک دُسروں میں<sup>صلی اللہ تعالیٰ علیہ وآلہ وسلم</sup>  
 ڈالا، لیکر فرمایا : “اُس کے لیے ساتھ اجڑاہے مُسالحت کر دیتے  
 جاتے ہے کہ اگر اُن میں سے ایک بھی جمین پر ٹکڑے مار دے تو رہتی  
 ہوں یا تک جمین سے کوچھ ن ہو، یہ تیر اجڑاہے اسے اساتھ اور نوچتے  
 رہنگے یہاں تک کہ اسے ہیساں کے لیے دے جائے جائے۔”

(جامع الترمذی، کتاب صفة القيامة، الحدیث ۸۶۴۲، ج ۴، ص ۸۰۲)

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! હાએ હમારા ક્યા બનેગા !

ਇਮ ਤੋਂ ਅਪਨੀ ਕਥਾ ਕੋ ਧਕ਼ਸਰ ਭੂਲੇ ਹੁਏ ਹੋਣੇ। ਫਿਲ੍ਹੇ ਬਾਰੀ ਮੌਜੂਦਾ :

“أَنَّ الْبُرْزَخَ مَقْدَمَةُ الْآخِرَةِ”<sup>١٦</sup> مُؤْمِنَةً بِهِ شَكِّ لَا يَجِدُهُ بَعْدَهُ بَشَّارُ عَلِيٌّ وَالْمُؤْمِنُونَ.

<sup>٣٩٩</sup> فتح الباري، كتاب الأدب، تحت الحديث ٦٠٥٥، ج ١٠، هـ ٦٤١٢ !

ਗਫਲਤ, ਕੇ ਨਜ਼ਾਰੇ ਦੀ ਸਭਿਆਂ, ਕਥਾ ਦੇ ਅਂਧੇਰੋਂ, ਇਸ ਮੌਜੂਦ ਕੀਤੇ ਮਹੋਤਵਾਂ, ਮੁਨਕਰ ਨਕੀਰ ਦੇ ਸਖ਼ਤ ਲਹਜ਼ੇ ਮੈਂ ਕਿਧੇ ਜਾਨੇ ਵਾਲੇ ਸੁਵਾਲਾਂ, ਬੋਸੀਦਾ ਹੋ ਜਾਨੇ ਵਾਲੀ ਛਡਿਆਂ, ਅਗਾਮੇ ਕਥਾ ਦੀ ਸ਼ਿਦਤਾਂ ਦੇ ਆਗਾਹ ਹੋਨੇ ਦੇ ਬਾਅਦ ਜੁਝੂਦ ਨੇਤਿਆਂ ਕਮਾਨੇ ਦੀ ਜੁਸ਼-ਝੂ ਨਹੀਂ ਕਰਤੇ !

ਗੋ ਪੇਸ਼ੇ ਨਜ਼ਰ ਕਬ ਕਾ ਪੁਰਖੀਲ ਗਠਾ ਹੈ ਅਫਸੋਸ ਮਗਰ ਫਿਰ ਭੀ ਧੇਹ ਗਫ਼ਲਤ ਨਹੀਂ ਜਾਤੀ  
ਏ ਰਹਮਤੇ ਕੌਨੈਨ ! ਕਮੀਨੇ ਪੇ ਕਰਮ ਹੋ ਹਾਏ ! ਨਹੀਂ ਜਾਤੀ ਬੁਰੀ ਖਸ਼ਤ ਨਹੀਂ ਜਾਤੀ

(વસાઈલે બજીશાશ, સ. 135)

صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

## ତଣାଇଁ ହି କାଫି ହେ

ਬਿਲਫਰ्ज ਅਗਰ ਕਥ੍ਰ ਮੌਂ ਕੋਈ ਅਜਾਬ ਨ ਭੀ ਹੋ ਤੋ ਤਾਂਗੇ  
ਤਾਰੀਕ ਕਥ੍ਰ ਮੌਂ ਤਵੀਲ ਅੱਖੇ ਤਕ ਤਨਾ ਰਹਨਾ ਹੀ ਸ਼ਾਦੀਏ ਆਘਮਾਈਂ ਹੈ  
ਝੁੰਕੇ ਹਮਾਰੀ ਨਾਣੂਕ ਮਿਆਛ ਕਾ ਤੋ ਧੇਹ ਆਲਮ ਹੈ ਕੇ ਅਗਰ ਹਮੇਂ  
ਤਮਾਮ ਤਰ ਸਾਡੂਲਿਧਾਤ ਵ ਆਸਾਈਂਸ਼ਾਤ ਸੇ ਆਰਾਸਤਾ ਵ ਪੈਰਾਸਤਾ  
ਆਲੀਸ਼ਾਨ ਬੰਗਲੇ ਯਾ ਕੋਠੀ ਮੌਂ ਕੁਛ ਵਿਨੋਂ ਕੇ ਲਿਧੇ ਤਨਾ ਕੈਂਦ ਕਰ ਦਿਧਾ  
ਆਏ ਤੋ ਧਬਰਾ ਜਾਏ.

کہ رہی ہے شاہوں سے کبھی کی یہ تناہی

તાજો તખ્તા કે માલિક આજ કર્યું અકેલે હોય

## દુન્યા સે જાને વાલો કો યાદ કીજિયે

શૈખે તરીકત અમીરે અહલે સુન્નત હોયાની નહીં કરમાતે હું : “મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! કભી કભી તન્હાઈ મેં દિલ કો હર તરણ કે દુન્યાવી ખયાલાત સે પાક કર કે અપને ઉન દોસ્તોં, રિશ્ટેદારોં કો યાદ કીજિયે જો વફાત પા ચુકે હોય, અપને કુર્બો જવાર મેં રહેને વાલે ફૌત શુદ્ધગાન મેં સે એક એક કો યાદ કીજિયે ઔર તસવ્યુર હી તસવ્યુર મેં ઉન કે ચેહરે સામને લાઈયે ઔર ખયાલ કીજિયે કે વોહ કિસ તરણ દુન્યા મેં અપને અપને મન્સુબ વ કામ મેં મશ્ગૂલ થે, લમ્બી લમ્બી ઉમ્મીદોં બાંધે દુન્યાવી તા'લીમ કે ઝરીએ મુસ્તકિબલ કી બેહતરી કે લિયે કોશાં થે ઔર ઐસે કામોં કી તદબીર મેં લગે થે જો શાયદ સાલહા સાલ તક મુક્ખ્મલ ન હો સકેં, દુન્યાવી કારોબાર કે લિયે વોહ તરણ તરણ કી તકલીફ ઔર મશક્કતે બરદાશ્ત કિયા કરતે થે, વોહ સિઝી ઈસ દુન્યા હી કે લિયે કોણિશોં મેં મસરૂફ થે, ઈસી કી આસાઈશોં ઉન્હેં મહિબૂબ ઔર ઈસી કા આરામ ઉન્હેં મરગૂબ થા. વોહ યું જિન્દગી ગુજાર રહે થે ગોયા ઉન્હેં કભી મરના હી નહીં, ચુનાન્યે વોહ મૌત સે ગાફિલ, ખુશિયોં મેં બદ મસ્ત ઔર ખેલ તમાશોં મેં મગન થે, ઉન કે કફન બાજાર મેં આ ચુકે થે લેકિન વોહ ઈસ સે બે ખબર દુન્યા કી રંગનિયોં મેં ગુમ થે. આહ ! ઈસી બે ખબરી કે આલમ મેં ઉન્હેં યકાયક મૌત ને આ લિયા ઔર વોહ કણ્ણોં મેં પહુંચા દિયે ગયે. ઉન કે માં બાપ ગમ સે નિઢાલ હો ગયે, ઉન કી બેવાંએ બે હાલ હો ગઈ, ઉન કે બચ્ચે બિલક્કતે રહ ગયે, મુસ્તકિબલ કે હસીન ઘ્વાબોં કા આઈના ચકના ચૂર હો ગયા. ઉમ્મીદોં મલિયા મૈટ હો ગઈ, ઉન કે કામ અધૂરે રહ ગયે, દુન્યા કે લિયે ઉન કી સબ મેહનતોં રાએગાં ગઈ. તુ-રસા ઉન કે અભ્વાલ તક્સીમ કર કે મળે સે

ખા રહે હોય ઔર ઉન કો ભૂલ ચુકે હોય.

જબ ઈસ બાળમ સે ઉઠ ગયે દોસત અકસર ઔર ઉઠતે ચલે જા રહે હોય બરાબર

યેહ હર વક્ત પેશો નગર જબ હો મન્ગર યથાં પર તેરા દિલ બહલા હો ક્યૂંકર

જગહ જ લગાને કી દુન્યા નહીં હો

યેહ ઈશ્વત કી જા હો તમાશા નહીં હો

صَلُّوٰعَلَى الْحَبِيبِ ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

(વીરાન મહલ, સ. 17)

## એક દિન મરના હો આખિર મૌત હો

મીઠે મીઠે ઈસ્થામી ભાઈયો ! દિન ઔર રાત ગોયા દો  
સુવારિયાં હોય જિન પર હમ બારી બારી સુવાર હોતે હોય, યેહ સુવારિયાં  
મુસલ્સલ અપના સફર જારી રખે હુએ હોય ઔર હમેં મૌત કી મન્જિલ  
પર પહોંચા કર હી દમ લેંગી, ક્યા કભી આપ ને ગોર ડિયા કે હમ  
દિન કે ગુજરને ઔર રાત કે કટને પર બહુત ખુશ હોતે હોય હાલાંકે  
હમારી જિન્દગી કા એક દિન યા એક રાત કમ હો જતી હો ઔર હમ  
મૌત કે મઝીંડ કરીબ હો જતે હોય, હમારી હૈસિયત તો ઉસ બલ્બ કી  
સી હોય જિસ કી સારી ચકાયોંદ ઔર તુવાનાઈ પ્લાસ્ટિક કે એક બટન  
મેં છુપી હોતી હોય, ઉસ બટન પર પડને વાલા ઊગલી કા હલકા સા  
દબાવ ઉસ કી રોશનિયાં ગુલ કર દેતા હોય, ઈસી તરફ મૌત કા વક્ત  
આને પર હમારા ચાકો ચૌબન્દ જિસ્મ ઈતના બેબસ હો જાતા હોય કે  
હમ અપની મરજી સે હાથ ભી નહીં હિલા સકતે, અગર્યે યેહ તો હોય કે  
એક દિન હમેં ભી મરના હો મગર હમ નહીં જાનતે કે મૌત મેં કિંતના  
વક્ત બાકી હોય ? ક્યા મા'લૂમ કે આજ કા દિન હમારી જિન્દગી કા

આખિરી દિન યા આને વાલી રાત હમારી જિન્દગી કી આખિરી રાત હો ! બલ્કે હમારે પાસ તો ઈસ કી ભી ઝમાનત નહીં કે એક કે બા'દ દૂસરા સાંસ લે સકેંગે યા નહીં ? ક્યુંકે સાંસ ફેફડોં મેં જાતે ઔર બાહર નિકલતે વક્ત ઈન્સાન કે ઈજ્ઞિયાર મેં નહીં હોતા ઔર ન હી ઈસ પર એ'તિબાર કિયા જા સકતા હૈ, ઐન મુખ્યિન હૈ કે જો સાંસ હમ લે રહે હૈં વોહી આખિરી હો દૂસરા સાંસ લેને કી નૌભત હી ન આએ !

عَلَيْهِ السَّلَامُ

હમારી રૂહ કબ્જ ફરમા લેં ! આએ દિન યેહ ખબરે હમેં સુનને કો મિલતી હૈં કે હુલાં ઈસ્લામી ભાઈ અથે ખાસે થે, બ જાહિર ઉન્હેં કોઈ મરઝ ભી ન થા, લેકિન અચાનક હાટફીલ હો જાને કી વજહ સે ચન્દ મિનટ કે અન્દર અન્દર ઉન કા ઈજ્ઞિકાલ હો ગયા, પૂછી કિસી ભી લમ્હે હમેં ઈસ દુન્યા સે રૂખ્સત હોના પડ સકતા હૈ ક્યુંકે જો રાત કબ્જ મેં ગુઝરની હૈ વોહ બાહર નહીં ગુઝર સકતી.

બ વકતે નજ્રાય સલામત રહે મેરા ઈમાં  
મુજે નસીબ હો કલિમા હે ઈલિજા યા રબ

(વસાઈલે બાણિજા, સ. 55)

## મૌત કો યાદ કરને કા ફાઓદા

હજરતે સાધ્યિદુના અનસ બિન માલિક રોજી હૈ કે સાધ્યિદુના અનસ બિન માલિક રોજી હૈ કે સરકારે મર્દીના, રાહતે કલખો સીના, ને ઈશ્શાદ ફરમાયા : “જિસે મૌત કી યાદ ખૌફઝદા કરતી હૈ કબ્જ ઉસ કે લિયે જન્મત કા બાગ બન જાએગી.” (جمع الجواع، الحديث، ج ٢، ص ٣٥١٦)

## અપની મૌત કો યાદ કીજિયે

જરા તસવ્યુર કી નિગાહ સે દેખિયે કે મેરી મૌત કા વક્ત

આન પહોંચા હૈ, મુજ પર ગશી તારી હો ચુકી હૈ, લોગ બે બસી કે આલમ મેં મુજે મૌત કે મુંહ મેં જાતા હુવા દેખ રહે હૈં મગર કુછ કર નહીં સકતે, નજ્રાં કી સંપ્રિયાં ભી શુરૂઆ હો ગઈ મગર મેં અપની તકલીફ કિસી કો બતા નહીં સકતા કયૂંકે હર વકત ચહેકને વાલી જબાન અબ ખામોશ હો ચુકી હૈ, સખ્ત ઘાસ મહસૂસ હો રહી હૈ મગર કિસી સે દો ઘૂંટ પાની નહીં માંગ સકતા, ઈસી દૌરાન કોઈ મુજે તલ્કીન કરને (યા'ની મેરે સામને કલિમાએ પાક પઢને) લગા, ફિર રફતા રફતા સામને કે મનાજિર ધુંદલે હોને લગે, ગલે સે ખર-ખરાહટ કી આવાંએ આના શુરૂઆ હો ગઈ, ઔર બિલ આભિર રૂછ ને જિસ્મ કા સાથ છોડ દિયા યા'ની મેરા ઈન્ટિકાલ હો ગયા. અજીઝો અકારિબ પર ગિર્યા તારી હો ગયા. અહલો અયાલ મ-સલન બીવી બચ્ચોં, બહન ભાઈ, માં બાપ વગેરા કી આંખે શિદતે ગમ સે નમ હૈં. કિસી ને આગે બઢ કર મેરી આંખે બન્દ કર દીં, પાઉં કે દોનોં અંગૂઠે ઔર દોનોં જબડોં કો કપડે કી પણી સે બાંધ કર મુજ પર ચાદર ઉઠા દી ગઈ. મેરી મૌત કે એ'લાનાત હોને લગે, રિશ્ટેદારોં ઔર દોસ્તોં કો ઈન્ટિલાઆત દી જાને લગીં. કુછ લોગ મેરી તકફીન વ તદ્દીન કે ઈન્ટિઝામાત મેં લગ ગયે. ગુસ્લ કા ઈન્ટિઝામ હોને પર મુજે તખ્તાએ ગુસ્લ પર લિટા કર ગુસ્લ દિયા ગયા ઔર કફ્ફન પહુના કર મેરી માયિત આભિરી દીદાર કે લિયે રખ દી ગઈ. મેરે ચાહને વાલોં ને આભિરી મરતબા મુજે દેખા કે યેહ ચેહરા અબ હુન્યા મેં દોબારા હુમેં દિખાઈ ન દેગા, ઘર કી ફરજ સોગ-વાર હૈ ઔર દરો દીવાર પર ઉદાસી છાઈ હુઈ હૈ. ફિર મેરે નાઝ ઉઠાને વાલોં ને મેરા જનાઝ અપને કન્ધોં પર ઉઠા લિયા ઔર જનાઝ ગાહ કી તરફ બઢના શુરૂઆ હો ગયે. વહાં પહોંચ કર મેરી નમાજે જનાઝ અદા કી ગઈ ઔર મેરે જનાજે કા રૂખ ઉસ કબ્રિસ્તાન

કી તરફ કર દિયા ગયા જહાં મુજે અપની જિન્દગી મેં રાત કે વક્તા તન્હા આને કી હિભેત નહીં હોતી થી મગર અબ ન જાને કિતની રાતે ઈસ કબ્રિસ્તાન મેં ગુજારની હોંગી ! યેહ વોહી કબ્રિસ્તાન હૈ જે અપને નાચે મકીનોં કા મુન્તકિર હોતા હૈ, જહાં પર ઈન્સાનોં કે સાથ ઉન કી જ્વાહિશાત ભી દફન હો જતી હૈં. લોગોં ને મેરી લાશ કો ચારપાઈ સે ઉઠા કર ઉસ કબ્રી મેં મુન્તકિલ કર દિયા જિસ કે બારે મેં હટીસે પાક મેં આયા કે જન્મત કા એક બાગ હૈ... યા... દોગુખ કા ગઠા !

**કબ્રી પર મિઠી ડાલ કર**

જબ મેરે સાથ આને વાલે લૌટ કર ચલે તો મૈં ને ઉન કે કદમોં કી ચાપ સુની, ઉન કે જાને કે બા'દ કબ્રી મુજ સે હમ કલામ હુદ્દ ઔર કહને લગી : ઐ આદમી ! ક્યા તૂને મેરે હાલાત ન સુને થે ? ક્યા મેરી તંગી, બદબૂ, હોલનાકી ઔર કીડોં સે તુઝે નહીં ડરાયા ગયા થા ? અગર ઐસા થા તો ફિર તૂને ક્યા તથ્યારી કી ?

કબ્રી મેં મુજ કો લિટા કર ઔર મિઠી ડાલ કર ચલ દિયે સાથી ન પાસ અબ કોઈ રિશ્ટેદાર હૈ ખાબ મેં ભી એસા અન્ધેરા કભી દેખા ન થા જૈસા અન્ધેરા હમારી કબ્રી મેં સરકાર હૈ

(વસાઈલે બજીશાશ, સ. 74)

صَلُّو عَلَى الْحَبِيبِ ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

## હમ પર ક્યા ગુમરેશી ?

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! ઈન્સાન કે દો ઘર હોતે હૈં : એક જમીન કે ઊપર ઔર એક જમીન કે અન્દર (યા'ની કબ્રી), આજ હમ અપને ઘર કો આરામ દેહ વ પુર સુકૂન બનાને કે લિયે કેસે કેસે જતન કરતે હૈં, અંધેરે કો દૂર કરને કે લિય જગહ જગહ બટબ રોશન કરતે હૈં, ગરમી મેં ઠન્ડક કે લિયે એર કન્ડીશનર (Airconditioner) ઔર સર્ટા કે મૌસિમ મેં સર્ટા સે બચને કે લિયે હીટર (Heater) તક લગવાતે

હું, બિજલી ચલી જાએ તો મુંતબાછિલ ઈન્ટિગ્રામ કે તૌર પર જનરેટર ઔર યૂ.પી.એસ (ups) તથાર રખતે હું, મગાર એક દિન સબ કુછ છોડછાડ કર ખાલી હાથ દૂસરે ઘર યા'ની કષ્ટ મેં મુન્તકિલ હો જાઓંગે. સોચિયે તો સહી ઉસ વક્ત હમ પર કયા ગુરુરેગી જબ કષ્ટ કી વફ્ફશતોં, ગહરી તારીકિયોં ઔર અજનબી માહોલ કી ઉદાસિયોં મેં તન્દા હોંગે, કોઈ હમદર્દ ન મદદગાર, કિસી કો બુલા સકેં ન ખુદ કહી જા સકેં, હમ પર કેસી ઘભરાહટ તારી હોગી !

અંધેરા કાટ ખાતા હે અકેલે ખોઝ આતા હે તો તન્દા કષ્ટ મેં કંદૂકર રહ્યુંગા યા રસૂલલ્લાહ  
નીરેન ઈમિલાં લેને કો જબ આઓંગે તુરબત મેં જવાબાત ઉન કો આકા કેસે દુંગા યા રસૂલલ્લાહ  
બરાએ નામ દર્દે સર સહા જાતા નહીં મુજ સે અજાબે કષ્ટ કેસે સહ સહુંગા યા રસૂલલ્લાહ  
ઘણાં ચ્યૂંટી ભી તડપા હે મુજે તો કષ્ટ કે અન્દર શહા બિયથૂ કે ઊક કેસે સહુંગા યા રસૂલલ્લાહ

(વસાઈલે બજ્ઞાશ, સ. 140)

## મુદ્દે કે સદમે

દા'વતે ઈસ્લામી કે ઈશાઅતી ઈદારે મક-ત-બતુલ મદીના કી મતબૂઆ “ઇઝાને સુન્નત” જિલ્દ 2 કે 499 સફ્ફાત પર મુશ્તમિલ બાબ, “ગીબત કી તબાહ કારિયાં” સફ્ફા 67 પર હે : અવ્યાલ તો મૌત કે સદમે કા તસવ્યુર હી જાન કો ધુલાને વાલા હે ઊપર સે ખુદા વ મુસ્તફા  
عَوَّجَلْ وَصَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ કી નારાજી કી સૂરત મેં અજાબ હુવા તો કેસે બરદાશત હો સકેગા ! મુદ્દે કે સદમે કા નકશા ખીચતે હુએ મેરે આકા આ'લા હજરત, ઈમામે અહલે સુન્નત, મૌલાના શાહ ઈમામ અહમદ રજા ખાન ફરમાતે હું : વોહ

## કબી મંને આબે વાલા દોષત

મૌત કા તાજા સદમા ઉઠાએ હુએ રૂહ (કે નિકલતે વકત) જિસ કા અદના ઝટકા સો ઝર્ભે શમશીર (યા'ની તલવાર કે સો વાર) કે બરાબર, જિસ કા સદમા હજાર ઝર્ભે તૈગ (યા'ની તલવાર કે હજાર વાર) સે સપ્ત તર, બલ્કે મ-લકુલ મૌત عَلَيْهِ السَّلَامُ કા દેખના હી હજાર તલવાર કે સદમે સે બઢ કર. વોહ નઈ જગહ, વોહ નિરી તન્હાઈ, વોહ હર તરફ ભયાનક બે કસી છાઈ, ઈસ પર વોહ નકીરેન (યા'ની મુન્કર નકીર) કા અચાનક આના, વોહ સખ્ત હૈબત નાક સૂરતે દિખાના કે આદમી દિન કો હજારોં કે મજબુત મેં દેખે તો હવાસ બજા ન રહેં, કાલા રંગ, નીલી આંખેં દેગોં કે બરાબર બડી, અબરક (ચમકીલી ધાત) કી તરહ શો'લાજન, સાંસ જૈસે આગ કી લપટ, બૈલ કે સીંગોં કી તરહ લમ્બે નોકદાર કીલે (યા'ની અગલે દાંત), જમીન પર વિસટતે સર કે પેચીદા બાલ, કદો કામત જિસમ વ જસામત બલા વ ડિયામત, કે એક શાને (યા'ની કન્ધે) સે દૂસરે (કન્ધે) તક મન્જિલોં (યા'ની બે શુમાર કિલો મીટર્ડ) કા ફાસિલા, હથોં મેં લોહે કા વોહ ગુર્જ (યા'ની હથોડા) કે અગર એક બસ્તી કે લોગ બલ્ક જિન્ન વ ઈન્સ જમ્મ હો કર ઉઠાના ચાહેં ન ઉઠા સકેં, વોહ ગારજ કડક કી હોલનાક આવાજેં, વોહ દાંતોં સે જમીન ચીરતે ઝાહિર હોના, ફિર ઈન આફાત પર આફત યેહ કે સીધી તરહ બાત ન કરના, આતે હી ઝન્જોડ ડાલના, મોહલત ન દેના, કડકતી જિડકતી આવાજોં મેં ઈસ્તિહાન وَحَسْبُنَا اللَّهُ وَنَعْمَ الْوَكِيلُ إِرَحْمٌ ضُعْفَنَا يَا كَرِيمُ يَا جَمِيلُ صَلٍ وَسَلَمٌ દેના. (તરજમા : ઉલી નૈસી રહ્મતે વાલી કુરામ વસાઈ રાની અમીન યા રહ્મત રાહિગુન ઔર અલ્લાહ હ મારે લિયે કાફી હૈ ઔર વોહ સબ સે બડા કારસાજ હૈ. એ કરમ ફરમાને વાલે ! હમારી કમજોરી પર રહમો કરમ ફરમા, એ

## કબ્ર મેં આબે વાલા દોષત

(صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ) રજે જમીલ ! દુરદો સલામ ભેજ નબિયે રહમત રહમત

પર ઔર ઉન કી ઈજૂજત વાતી આલ ઔર બિકિયા તમામ ઉમ્મત પર.

કબૂલ ફરમા, કબૂલ ફરમા, એ સબ સે જિયાદા રહમો કરમ ફરમાને વાલે !)

(ફતાવા ર-જવિયા, જિ. 9, સ. 934 તા 937)

ધૂપ અંધેરા હી ક્યા વધૃશત કા બસેરા હોગા કબ્ર મેં કેસે અકેલા મેં રહ્યુંગા યા રબ !

ગર કફન ફાડ કે સાંપોં ને જમાયા કખજા હાથે બરબાદી ! કહાં જા કે છુપુંગા યા રબ !

દંક મચ્છર કા ભી મુજા સે તો સહા જાતા નહીં કબ્ર મેં બિચ્છૂ કે દંક કેસે સહૂંગા યા રબ !

ગર તુ નારાજ હુવા મેરી હલાકત હોગી હાથે ! મેં નારે જહનમ મેં જલુંગા યા રબ !

અફવ કર ઔર સદા કે લિયે રાતી હો જા

ગર કરમ કર દે તો જહન મેં રહ્યુંગા યા રબ !

**صَلُوٰعَلَى الْحَبِيبِ!** صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

(ગીબત કી તથાઓ કારિયાં, સ. 67)

## કબ્ર વાલે કિસ પર રશક કરતે હોય ?

હજરતે સાચ્છિદુના અબ્દુલ્લાહ બિન ઉમર પાત્ર સે મરવી હૈ : “કોઈ દિન ઐસા નહીં કે જિસ મેં મ-લકુલ મૌત (عَلَيْهِ السَّلَام) કબ્રિસ્તાન મેં યોહ એ'લાન ન કરતે હોય : “એ કબ્ર વાલો ! આજ તુમું કિન લોગોં પર રશક હૈ ?” તો વોહ જવાબ દેતે હુએ કહતે હોય : “હમેં મસ્જિદ વાલોં પર રશક હૈ કે વોહ મસ્જિદોં મેં નમાઝ પઢતે હોય ઔર હમ નમાઝ નહીં પઢ સકતે. વોહ રોજે રખતે હોય ઔર હમ નહીં રખ સકતે. વોહ સ-દકા કરતે હોય ઔર હમ નહીં કર સકતે. વોહ અલ્લાહ કા જિક કરતે હોય ઔર હમ નહીં કર સકતે.” ફીર અહલે કબ્ર

અપને ગુજરાત જમાને પર નાદિમ (યા'ની શર્મસાર) હોતે હું.”

(الروض الفائق، المجلس الثالث في ذكر الموت ..... الخ، ص ٢٧)

વોહ હે એશો ઈશરત કા કોઈ મહલ ભી      જહાં તાક મેં હર ઘડી હો અજલ ભી  
બસ અબ અપને ઈસ જહૂલ સે તૂનિકલ ભી      યેહ જીને કા અનદાજ અપના બદલ ભી  
જગહ જી લગાને કી હુન્યા નહીં હે  
યેહ ઈશ્વર કી જા હે તમાશા નહીં હે

**صَلُّوٰ عَلَى الْحَبِيبِ ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ**

## અભી સે તથ્યારી કર લીજિયે

શૈખે તરીકત અમીરે અહલે સુન્નત આન્કાયિની ડામની હું હુંમે કષ્ટ  
વ હશર કી તથ્યારી કા જેહુન અતા કરતે હુએ ફરમાતે હું : “મીઠે મીઠે  
ઈસ્લામી ભાઈઓ ! વાકેઈ અકલ મન્દ વોહી હે જો મૌત સે કબ્લ મૌત  
કી તથ્યારી કરતે હુએ નેકિયોં કા ઝખીરા ઈકણ્ણા કર લે ઔર સુન્નતોં  
કા મ-દની ચરાગ કષ્ટ મેં સાથ લે જાએ ઔર યું કષ્ટ કી રોશની કા  
ઈન્તિજામ કર લે, વરના કષ્ટ હરગિઝ યેહ લિહાજ ન કરેગી કે મેરે  
અન્દર કોન આયા ? અમીર હો યા ફીર, વજીર હો યા ઉસ કા  
મુશીર, હાકિમ હો યા મહિકુમ, અફસર હો યા ચપરાસી, સેઠ હો યા  
મુલાજિમ, ડોક્ટર હો યા મરીજ, ઠેકેદાર હો યા મઝદૂર. અગાર  
કિસી કે સાથ ભી તોશએ આખિરત મેં કમી રહી, નમાંને કસ્ટન કરા  
કીં, ૨-મજાન શરીર કે રોજે બિલા ઉજ્જરે શર-ઈ ન રખે, ફર્જ હોતે  
હુએ ભી જકાત ન દી, હજ ફર્જ થા મગર અદા ન કિયા, બા વુજૂદે  
કુદરત શર-ઈ પર્દા નાફિઝ ન કિયા, માં બાપ કી ના ફરમાની કી,

જૂટ, ગીબત, ચુગલી કી આદત રહી, ફિલ્મે, ડિરામે દેખતે રહે, ગાને બાજે સુનતે રહે, દાઢી મુંડવાતે યા એક મુહી સે ઘટાતે રહે. અથ ગરજ ખૂબ ગુનાહોં કા બાળાર ગર્મ રખા તો **અલ્લાહ** ઉર્જોજી ઓર ઉસ કે રસૂલ ﷺ ના રાજગી કી સૂરત મેં સિવાએ હસરત વ નદામત કે કુછ હાથ ન આએગા. જિસ ને ફરાઈજ કે સાથ સાથ નવાફિલ કી ભી પાબન્દી કી, ૨-મજાનુલ મુખારક કે ઈલાવા નફલી રોજે ભી રખે, કૂચા કૂચા, ગલી ગલી નેકી કી દા'વત કી ધૂમેં મચાઈ, કુરઆને પાક કી તા'લીમ ન સિર્ફ ખુદ હાસિલ કી બલ્કે દૂસરોં કો ભી દી, ચૌકદર્સ દેને મેં હિચ-કિચાહટ મહસૂસ ન કી, ઘર દર્સ જરી કિયા, સુન્તતોં કી તરબિયત કે મ-દની કાફિલોં મેં બા કાઈ-દગી સે સફર કરને કે સાથ સાથ દીગાર મુસલ્માનોં કો ભી ઈસ કી તરગીબ દિલાઈ, રોજાના મ-દની ઈન્નામાત કા રિસાલા પુર કર ઉર્જોજી ઓર ઉસ કે ખ્યારે રસૂલ ﷺ કે ફિઝલો કરમ સે ઈમાન સલામત લે કર દુન્યા સે રૂખ્સતી હુઈ તો إِنَّ شَاءَ اللَّهُ عَزَّ وَجَلَّ ઉસ કી કબ્ર મેં હશ્ર તક રહેમતોં કા દરિયા મૌજેં મારતા રહેગા ઔર નૂરે મુસફા

માણિ કુ ચશ્મે લહરાતે રહેંગે.

કબ્ર મેં લહરાઓંગે તા હશ્ર ચશ્મે નૂર કે

જલ્વા ફરમા હોગી જબ તલ્યાત રસૂલુલ્હાહ (હદાઈક બાણિશ)

**صَلُوٰعَلِيُّ الْحَبِيبِ ! صَلَوٰةٌ لِلَّهِ تَعَالَى عَلٰى مُحَمَّدٍ**

(બાદશાહોં કી હક્કિયાં, સ. 17)

## જનત કા બાબા યા જનનમ કા એઠો

અહ્લાનું કે મહિદૂબ, દાનાએ ગુયુબ, મુનજુરહુન અનિલ  
ઉયુબ ઉચ્ચાને હિન્દુત નિશાન હૈ : કથ્ર યા તો  
જહનમ કા ગઢા હૈ યા જન્નત કે બાગોં મેં સે એક બાગ.

(الترغيب والترهيب ج ٤ ص ١١٨ دار الفكر بيروت)

ਕਥ ਕੋ ਜਨਨਮ ਕਾ ਗਠਾ ਬਣਾਨੇ ਵਾਲੇ ਆ'ਮਾਲ

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! યું તો હર ગુનાહ અજાબે કબ્ર  
કા સબબ બન સકતા હૈ મગર ચન્દ ઐસી રિવાયાત વ છિકાયાત  
મુલા-હાજા કીજિયે જિન મેં અજાબે કબ્ર મેં મુખ્તલા કરને વાલે ગુનાહોં  
કા ખુસૂસિય્યત કે સાથ ઝિક હૈ :

## (1) ચુગુલ ખોરી

(سنن النسائي ص ١٣ حديث ٣١ صحيح البخاري ج ١ ص ٩٥ حديث ٢١٦)

## કબ્ર મેં આગ ભડક રહી થી

હજરતે સચ્ચિદાનંદ અમૃત બિન દીનાર ઉલ્લેખિતું કહતે  
 હું કે મદીનાએ તથિયાં મેં એક શાખ્સ રહતા થા જિસ કી બહન  
 મદીના કે નવાહ મેં રહતી થી. વોહ બીમાર હુંઈ તો યેહ શાખ્સ ઉસ  
 કી તીમાર દારી મેં લગા રહા મગર વોહ ઉસી મરજ મેં ઈન્ટિકાલ  
 કર ગઈ. ઉસ શાખ્સ ને અપની બહન કી તજહીઝ વ તકફીન કા  
 ઈન્ટિજામ કિયા, જબ દર્શન કર કે વાપસ આયા તો ઉસે યાદ આયા  
 કે વોહ રકમ કી એક થેલી કબ્ર મેં ભૂલ આયા હૈ. ઉસ ને અપને એક  
 દોસ્ત સે મદદ તલબ કી દોનોં ને જા કર ઉસ કી કબ્ર ખોદ કર થેલી  
 નિકાલ લી. તો ઉસ ને દોસ્ત સે કહા : “જરા હટના મૈં દેખ્યું તો સહી  
 મેરી બહન કિસ હાલ મેં હૈ ?” ઉસ ને લહદ મેં ઝાંક કર દેખા તો  
 વહાં આગ ભડક રહી થી, વોહ ચુપચાપ વાપસ ચલા આયા ઔર  
 માં સે પૂછા : “ક્યા મેરી બહન મેં કોઈ ખરાબ આદત થી ?” માં ને  
 કહા : “તેરી બહન કી આદત થી કે વોહ હમસાયોં કે દરવાજોં સે કાન  
 લગા કર ઉન કી બાતે સુનતી થી ઔર ચુગુલ ખોરી કિયા કરતી થી.”

(مكاشفة القلوب، ص ٧١)

મીઠ મીઠ ઈસ્લામી ભાઈયો ! લોગોં મેં ફસાદ કરવાને કે લિયે  
 (શ્રદ્ધા માટે એક દૂસરે તક પહોંચાના ચુગલી હૈ. ٣١، ج ١، ص ١) ચુગુલ ખોર મહિષ્યતોં કા ચોર હૈ, આજ હમારે મુઆ-શરે મેં મહિષ્યતોં  
 કી ફંજા આલૂદા હોને કા એક બડા સબબ ચુગુલ ખોરી ભી હૈ,  
 લોગોં કે દરમિયાન ચુગિલિયાં ખા કર ફસાદ બરપા કર કે અપને  
 કલેજે મેં ઠન્ડક મહસૂસ કરને વાલે કો કલ જહન્નમ કી ભડકતી હુંઈ

આગ મેં જલના પડેગા, અગર કબી જિન્દગી મેં યેહ ગુનાહ હુવા હો  
તો તૌભા કર કે યેહ નિયત કર લીજિયે કે હમ ચુગલી ખાંએગે ન  
સુનેંગે, ان شاء اللہ عز و جل

સુન્નું ન ફોઝશ કલામી ન ગીબતો ચુગલી  
તરી પસંદ કી બાતેં ફકત સુના યા રખ

(વસાઈલે બાણિજાશ, સ. 54)

**صَلَوَاتُ اللَّهِ عَلَى الْحَبِيبِ ! صَلَوَاتُ اللَّهِ تَعَالَى عَلَى مُحَمَّدٍ**

## (2) ગીબત

હજરતે સાધ્યિદુના અભી બકરહ ફરમાતે હૈં કે તુમું કે  
મૈં નબિયે કરીમ, રાખુરહીમ કુટીલી સાથ ચલ રહા  
થા ઔર આપ ને ચલી લાય થામા હુવા થા. એક  
આદમી આપ કુટીલી લાય થા. ઈસી દૌરાન  
હમ ને અપને સામને દો કંઢો પાઈ તો નુભુવ્યત કે આફનાબ, જનાબે  
રિસાલત માઝાબ ને ફરમાયા : “ઇન દોનોં કો  
અઝાબ હો રહા હૈ ઔર કિસી બડે અખ્ર કી વજહ સે નહીં હો રહા,  
તુમ મેં સે કૌન હૈ જો મુજે એક ટહની લા દે.” હમ ને એક દૂસરે સે  
આગે બઢને કી કોણિશ કી તો મૈં સંજ્ઞત લે ગયા ઔર એક ટહની  
(યા'ની શાખ) લે કર હાજિરે બિદમતા હો ગયા. આપ  
ને ઉસ કે દો ટુકડે કર દિયે ઔર દોનોં કંઢો પર  
એક એક ટુકડા રખ દિયા ક્રિએ ઈશારાદ ફરમાયા : “યેહ જબ તક તર  
(યા'ની સંજ્ઞ વ તરો તાજા) રહેંગે ઇન પર અઝાબ મેં કમી રહેણી ઔર  
ઇન દોનોં કો ગીબત ઔર પેશાબ કી વજહ સે અઝાબ હો રહા હૈ.”

## ગીબત કિસે કહતે હોય ?

સદરુશશરીઅહ, બદરતરીકહ હજરતે અલ્લામા મૌલાના મુશ્કી મુહમ્મદ અમજદ અલી આ'જમી عَلَيْهِ رَحْمَةُ اللَّهِ الْقَوِيُّ ને ગીબત કી તા'રીફ ઈસ તરણ બયાન કી હૈ : “કિસી શખ્સ કે પોશીદા ઐબ કો ઉસ કી બુરાઈ કરને કે તૌર પર જિક કરના.”

(બહારે શરીઅત, ડિસ્સા : 16, સ. 175)

## અક્સરિયત ગીબત કી લપેટ મેં હોય

શૈખે તરીકત અમીરે અહલે સુન્નત હજરતે અલ્લામા મૌલાના મુહમ્મદ ઈલ્યાસ અતાર કાદિરી بِرَّ كَانَتْ إِنَّمَا લિખતે હોય : માં બાપ, ભાઈ બહન, મિયાં બીવી, સાસ બહુ, સુસર દામાદ, નન્દ ભાવજ બલ્કે અહલે ખાના વ ખાનદાન નીજ ઉસ્તાદ વ શાર્ગિર્ડ, સેઠ વ નોકર, તાજિર વ ગાહક, અફસર વ મજદૂર, માલદાર વ નાદાર, હાકિમ વ મહુકુમ, દુન્યાદાર વ દીનદાર, બૂઢા હો યા જવાન અલ ગરજ તમામ દીની ઔર દુન્યવી શો'ઓં સે તઅલુક રખને વાલે મુસલ્માનોં કી ભારી અક્સરિયત ઈસ વક્ત ગીબત કી ખૌઝનાક આફત કી લપેટ મેં હોય, અફસોસ ! સદ કરોડ અફસોસ ! બે જા બક બક કી આદત કે સબબ આજ કલ હમારી કોઈ મજલિસ (બેઠક) ઉમૂમન ગીબત સે ખાલી નહીં હોતી.

ગીબતો ચુગલી કી આફત સે બચેં યેહ કરમ યા મુસ્તફા ફરમાઈયે  
 આહિરો બાતિન હમારા એક હો યેહ કરમ યા મુસ્તફા ફરમાઈયે  
 ﷺ اَعْلَى الْحَبِيبِ ! ﷺ تُوبُوا إِلَى اللَّهِ ! اسْتَغْفِرُ اللَّهِ

(ગીબત કી તથાડ કારિયાં, સ. 25)

## ੴ ਕਰਿ ਮੇ ਆਨੌ ਵਾਲਾ ਛੋਤਾ

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! ગીબત કે બારે મેં મજીદ  
મા'લૂમાત ઓર ઈસ સે બચને કા જેહુન બનાને કે લિયે અમીરે  
અહલે સુન્નત ડામ્ટ بِرَكَاتُهُمُ الْأَعْلَىٰ કી કિતાબ “ગીબત કી તબાહ કારિયાં”  
કા ઝડૂર મુતા-લાખા કીજિયે, ગીબત કે બિલાફ એ'લાને જંગ ભી  
કીજિયે કે “ગીબત કરેંગે ન સુનેંગે ”  
إِنْ شَاءَ اللَّهُ عَزَّ وَجَلَّ

### (3) ନମାଙ୍କ ନ ପଣେ।

ਦਾ' ਵਤੇ ਈਸ਼ਵਾਮੀ ਕੇ ਈਸ਼ਾ ਅਤੀ ਈਂਦਾਰੇ “ਮਕ-ਤ-ਬਤੁਲ ਮਹੀਨਾ”  
ਕੀ ਮਤਬੂਆ 853 ਸਫ਼਼ਾਤ ਪਰ ਮੁਸ਼ਤਮਿਲ ਕਿਤਾਬ “ਜ਼ਹਨਮ ਮੌਲ  
ਜਾਨੇ ਵਾਲੇ ਆ'ਮਾਲ” ਜਿਵੇਂ ਅਵਵਲ ਕੇ ਸਫ਼਼ਾ 444 ਪਰ ਹੈ : “ਭੇ  
ਨਮਾਜ਼ੀ ਕੋ ਕਥ੍ਰ ਮੌਲ ਦੀ ਜਾਨੇ ਵਾਲੀ ਸਜ਼ਾਏ ਧੇਹ ਹੈ (1) ਉਸ ਕੀ ਕਥ੍ਰ ਕੋ  
ਈਤਨਾ ਤਾਂਗ ਕਰ ਦਿਯਾ ਜਾਵੇਗਾ ਕੇ ਉਸ ਕੀ ਪਟਿਖਿਆਂ ਏਕ ਫੂਸਰੇ ਮੌਲ ਪੈਵਸਤ  
ਹੋ ਜਾਵੇਗੀ (2) ਉਸ ਕੀ ਕਥ੍ਰ ਮੌਲ ਆਗ ਭਡਕਾ ਦੀ ਜਾਵੇਗੀ ਫਿਰ ਵੋਹ  
ਛਿਨ ਰਾਤ ਅੰਗਾਰੋਂ ਪਰ ਲੋਟਪੋਟ ਹੋਤਾ ਰਹੇਗਾ ਔਰ (3) ਕਥ੍ਰ ਮੌਲ ਉਸ ਪਰ  
ਏਕ ਅੜ੍ਹਦਾ ਮੁਸਲਿਮ ਕਰ ਦਿਯਾ ਜਾਵੇਗਾ ਜਿਸ ਕਾ ਨਾਮ ਅਖ਼ਸ਼ੁਆਉਲ  
ਅਕਰਾਵ ਹੈ, ਉਸ ਕੀ ਆਂਖੋਂ ਆਗ ਕੀ ਹੋਂਗੀ ਜਥੁਕੇ ਨਾਖੁਨ ਲੋਹੇ ਕੇ  
ਹੋਂਗੇ, ਹਰ ਨਾਖੁਨ ਕੀ ਲਮਾਈ ਏਕ ਛਿਨ ਕੀ ਮਸਾਫ਼ਤ ਤਕ ਹੋਣੀ, ਵੋਹ  
ਮਾਧਿਤ ਸੇ ਕਲਾਮ ਕਰਤੇ ਹੁਏ ਕਹੇਗਾ : “ਮੈਂ ਅਖ਼ਸ਼ੁਆਉਲ ਅਕਰਾਵ ਯਾ' ਨੀ  
ਗਨਯਾ ਸਾਂਪ ਹੁੰ.” ਉਸ ਕੀ ਆਵਾਜ਼ ਕਤਕ ਦਾਰ ਬਿਜਲੀ ਕੀ ਸੀ ਹੋਣੀ, ਵੋਹ  
ਕਹੇਗਾ : “ਮੇਰੇ ਰਖ ਮੁੜ ਨੇ ਮੁੜੇ ਛੁਕਮ ਦਿਯਾ ਹੈ ਕੇ ਨਮਾਜ਼ ਫਿਝ  
ਯਾਅੇਅ ਕਰਨੇ ਪਰ ਤੁਲੂਅ ਆਇਤਾਬ ਕੇ ਬਾ'ਦ ਤਕ ਮਾਰਤਾ ਰਹੁੰ ਔਰ  
ਨਮਾਜ਼ ਓਹਰ ਯਾਅੇਅ ਕਰਨੇ ਪਰ ਅੱਚਰ ਤਕ ਮਾਰਤਾ ਰਹੁੰ ਔਰ ਨਮਾਜ਼ ਮਗਾਰਿਬ  
ਯਾਅੇਅ ਕਰਨੇ ਪਰ ਈਸ਼ਾ ਤਕ ਮਾਰਤਾ ਰਹੁੰ ਔਰ ਨਮਾਜ਼ ਈਸ਼ਾ ਯਾਅੇਅ  
ਕਰਨੇ ਪਰ ਫਿਝ ਤਕ ਮਾਰਤਾ ਰਹੁੰ.” ਜਥੁ ਭੀ ਵੋਹ ਉਸੇ ਮਾਰੇਗਾ ਤੋ ਵੋਹ

70 ہاتھ تک جمین میں دنس جائے گا اور وہ کیا ملت تک ہس  
انجام میں مجبولہ رہے گا۔ (الرواہ عن اقتراف الکبائر، ح ۱، ص ۲۹۵)

ایہ فوج کے وقت گفعت کی چادر تان کر گھری نہیں سونے  
والوں ! ہوش میں آؤ، اے جو ہر کے وقت مسٹریٹ کا رعب کرنے کے  
بجائے اپنے کاروبار اور نوکری میں بگان رہنے والوں ! مرنے کے  
باہر تुہماں پاس ہر سات ہی ہر سات ہو گی بگار نہ کیا کرنے کی  
موجعت بتم ہو چکی ہو گی ! اسرو اور بگاری کی نمائی پر  
اپنے کامکاج کو ترکھ دے نے والوں ! ایک دن تुہماں کی  
کی شام ہل جائے گی، ہر والوں اور یار دوستوں کی بیٹک میں دل  
لگا کر ہشہ کی نمائی ڈھو دے نے والوں ! گوناہوں کی تاریخی  
تھماں کو مذکور تاریک کر دے گی، اے ہنیا کا ہر کام  
پابندی سے کرنے بگار سالہ سال سے نمائیوں سے مुکت ہوئے  
اپنی آبیرت کی کنک کرو، ہس سے پہلو کے مौت تھم سے کیا  
ہیں لے، جلدی کرو جیتنی نمائیں کرنا ہوئی ہے، توبہ بھی کرو  
اور ہن کا ہیسا بھاول گا کر آدا کر لے۔

### شیعہ حنفی نعمانی بیکھڑو

مکمل ہے، چھنٹا میں ایک والی ہے جس کا نام ”لملکم“  
ہے، اس میں ٹیک کی گردان کی ترکھ موتھ موتھ سانپ ہے، ہر سانپ کی  
لماہی ایک ماہ کی بساںت کے برابر ہے۔ یہ سانپ بے  
نمائی کو ڈسے گا تو اس کا جھر اس کے جسم میں ساتھ سال تک  
جو شہادت رہے گا اور چھنٹا میں ایک والی ہے جس کا نام  
”چھبھل ہو گردن“ ہے ہس میں کالے بخیار کی مانیں بیکھڑو ہے۔ اس کے

ساتر ڈکھ ہے اور ہر ڈکھ میں جھوک کی بولی ہے۔ وہ بیرونی جب بے نمائی کو ڈکھ مارتا ہے تو اس کا جھوک اس کے سارے جیسے میں سرایت کر جاتا ہے اور اس جھوک کی گرمی اپک ہمار سال تک رہتی ہے۔ اس کے باہم اس کی ہدیوں سے گوشہ جاتا ہے اور اس کی شرمگاہ سے پیپ بھنے لگاتی ہے اور تمام چھنپی اس پر لامنات بے جاتے ہے۔

(قرۃ العینون معه الروض الفائق ص ۳۸۵، کوئٹہ)

بے نمائی تری شامن آنے گی	کبھی کی دیوار بس میل جائے گی
تاؤ دے گی کبھی تری پسیلیاں	دو نوں <sup>۲</sup> ہاتھیں کی میلے جوں ہجیلیاں
تم میں ڈھنی ہے گر کوئی نمائی	جلد آدھا کر لے تُ آ گذلات سے بآج

(واسطہ بخشش، ص 377)

صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ  
[www.qawateislami.net](http://www.qawateislami.net)  
 نمائی کے تفسیلی مسائیل آنے کے لیے مکتوبات  
 مٹی نما کی مطبوعا 499 سفرت نے میل کتاب ”نمائی کے  
 اہکام“ کا ممتاز لسان کیجیے۔

#### (4) والیدن کی نا فرمانی

ہنگوں نبیو پاک، ساہیو لولائک، سچھاہے اکلائک  
 کو فرمانے ہبھت نیشاں ہے：“جس نے والیدن  
 کی نا فرمانی کی اس نے **اعلیاً** اور اس کے رسالے  
 کی نا فرمانی کی، اور والیدن کے نا فرمان  
 کو جب میں دفن کر دیا جائے گا تو کبھی اس ترک  
 دبائے گی کے اس کی پسیلیاں ٹوٹ کوٹ کر اپک دوسرا میں پیوست ہو  
 جائے گی۔”

(حاشیہ اعلاء الطالبین، فصل فی الشهادات، ج ۴، ۶۴)

## رُکنے والा گدھا

ہزارتے ساییدہ نما ایسا بیان ہے کہ رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ فَرَبُّ الْمَاءِ  
ہے اسکے مراتب میں اسکے کبھی لیے میں گیا، وہی پر اسکے ترکیب کوچھ کبھی  
نہیں، اس سر کے بآ'د اس کا بخششانہ کی اسکے کبھی فکر نہیں اور اس سے  
اسکے شاخوں نے نعمودار ہوتا جیس کا سر گدھے اور جیسم انسان کی  
ترکیب ہوتا ہے وہ تین بار گدھے کی سی آواز نیکال کر فریاد  
کبھی میں گاہی بھی ہوتا ہے۔ میں نے اس بارے میں لوگوں سے دیریاں فراہم کیا  
تو انہوں نے بتایا کہ یہ شرارب کا آہی ہے، جب یہ شرارب  
پیتا تو اس کی مان کھاتی کہ “بے! اَللَّاهُ أَكْبَرُ سے ۝ ۲۷۲!“ تو  
وہ شرارب دیتا: “تُو گدھے کی ترکیب رُکنَتی رکنی ہے۔“ فریاد اس سر کے  
بآ'د وہ مراتب گیا، اب ہر روز اس سر کے بآ'د نیکلتا ہے اور  
تین مراتب رُکناتا ہے اور فریاد گاہی بھی ہوتا ہے۔

(شرح الصدور بشرح حال الموتى والقبور، باب عذاب القبر، ص ۱۷۲)

اپنے والی دین کی شکنندی، محدثین میں اور ایمانیت میں بخوبی  
کر این کے سامنے جان دیا جائی بلکہ دست دیا جائی کی جو رحمت کرنے  
والے اس ریوایت سے ایجاد پکڑنے اور کبھی وہ ہشر اور ہونیا کی  
پریشانیوں سے بچنے کے لیے جیتنی جلدی ہو سکے اپنے والی دین  
سے بخوبی مانگوں، ہاتھ چوڑ کر پاٹ پکڑ کر رہ رہ کر این کو مانا  
لے اور اگر مان بآپ دوں یا این میں سے کوئی اسکے فیض ہو چکا  
ہو تو ہر جو معاشر کو این کی کبھی پر ہاتھی دینے کی کوشش کرے،  
سرکار نامدار، دو آنکھ کے مالکوں معاشر، شہنشاہ اور  
دوں یا اسکے کبھی پر ہر جو معاشر کے دین کی خیرات کو ہاتھی

## ਕਿਸੇ ਮੌਜੂਦੇ ਵਾਲਾ ਧੀਰਾ

હો, અલ્હામ ઉસ કે ગુનાહ બખ્શ હે ઔર માં બાપ કે સાથ અચ્છા બરતાવ કરને વાલા લિખા જાઓ.

(نوا در الاصول للترمذی، ص ٢٤ دار صادر بيروت)

## ਕਿਨ ਬਾਤਾਂ ਮੋ ਧਰਾਅਤ ਕੀ ਜਾਏਗੀ ?

યાદ રહે કે ઈતાઅત સિર્જ જાઈજ બાતોં મેં કી જાએગી જેસા કે આ'લા હજરત ઈમામ અહમદ રજા ખાન ઉલ્લિયે رَحْمَةُ الرَّحْمٰن ફરમાતે હું : જાઈજ બાતોં મેં વાલિદૈન કી ઈતાઅત ફર્જ હૈ ઔર અગર વોહ કિસી ના જાઈજ બાત કા હુકમ દેં તો ઈસ મેં ઉન કી ઈતાઅત જાઈજ નહીં. (ફત્વાવા ૨-અવિષ્યા, જિ. 12, સ. 751) મ-સલાન અગર વાલિદૈન નમાઝ ન પછને, ફર્જ રોજા બિલા ઉજૂરે શર-ઈ તર્ક કરને યા દાઢી મુંડાને કા હુકમ દેં તો અથ ઉન કી બાત ન માનને વાલે કો ના ફરમાન નહીં કહા જાએગા બલ્કે ઐસી બાતે માનને વાલા શરીઅત કા ના ફરમાન કરાર પાએગા.

ਚੁਨਾਈਂ ਦੇ ਮੁੜ ਕੇ ਬਚਾ ਯਾ ਈਲਾਹੀ ਭੁਰੀ ਆਦਤੋਂ ਲੀ ਛੁਡਾ ਯਾ ਈਲਾਹੀ  
ਮੁਤੀਅ ਅਪਨੇ ਮਾਂ ਬਾਪ ਕਾ ਕਰ ਮੈਂ ਉਨ ਕਾ ਹਰ ਈਕ ਛੁਕਸ ਲਾਗਿ ਬਚਾ ਯਾ ਈਲਾਹੀ

(વસાઈલે બિનિશાં 47, 48)

صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

## **(5) અકાત ન દેને કા વખાલ**

عَلَيْهِ رَحْمَةُ اللَّهِ الْأَنَّهَدِيِّ  
ਹਜਰਤੇ ਸਾਧੀਦੁਨਾ ਮੁਹਮਦ ਬਿਨ ਯੂਸੂਫ ਫਰਾਯਾਬੀ  
کہتے ہیں : “ਹਮ ਹਜਰਤੇ ਸਾਧੀਦੁਨਾ ਅਭੀ ਸਿਨਾਨ ਕੇ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْہُ  
ਸਾਥ ਉਨ ਕੇ ਹਮਸਾਏ ਕੀ ਤਾ'ਜ਼ਿਇਤ ਕੇ ਲਿਖੇ ਗਏ ਤੋਂ ਫੇਖਾ ਕੇ ਉਸ ਕਾ  
ਭਾਈ ਬਹੁਤ ਆਂਹੇ ਬੁਕਾ ਕਰ ਰਹਾ ਥਾ, ਹਮ ਨੇ ਉਥੇ ਕਾਫ਼ੀ ਤਸਲਿਖਾਂ

دیں، سبھ کی تلکین کی مگر اُس کی گیری و جاری براہر جاری رہی۔” ہم نے کہا : “کیا تुमھے ماؤں نہیں کے ہر شاپس کو آبیز مر جانا ہے ؟” وہ کہنے لگا : “یہ سہیہ ہے مگر میں اپنے بائی کے انجام پر روتا ہوں۔” ہم نے پوچھا : “کیا اعلیٰ تआوا نے تुمھے گےب سے تुمحارے بائی کے انجام کی وجہ پر دی ہے ؟” کہنے لگا : “نہیں، بلکہ ہوا یوں کے جب سب لوگ میرے بائی کو دفن کر کے یہاں دیتے تو میں وہیں بیٹھا رہا، میں نے اُس کی کش سے آوازا سُنی وہ کہ رہا�ا “آاہ ! وہ مُوچے تناہی ڈیڈ گاے اور میں انجام میں مُوبتاہ ہوں، میری نماج اور روتے کہاں گاے ؟” مُوچ سے برداشت نہ ہو سکا، میں نے اُس کی کش بُوڈنا شُرُع ا کر دی تاکہ دےبُون کے میرا بائی کیس لالا میں ہے ؟ جنہی کش بُولی، میں نے دےبَا اُس کی کش میں آگ دھک رہی ہے اور اُس کی گردان میں آگ کا تُک پڑا ہوا ہے، میں مُحابیت میں دیوانا وار آگے بڑا اور اُس تُک کی عطا رنا یاہا مگر ناکام رہا اور میرا یہہ ہا� ٹیکیوں سمتے جل گیا ہے۔” راوی کا کہنا ہے کہ ہم نے دےبَا واقعہ اُس کا ہا� بیکھل سیاہ ہو چکا ہا۔ اُس نے سیکھیلے کلام جاری رکھتے ہوئے کہا : میں نے اُس کی کش پر بھی ڈالی اور وَپس لُوٹ آیا، اب اگر میں ن روتا تو اور کُون روتے گا ؟ ہم نے پوچھا : “تیرے بائی کا کوئی اسے کام بھی ہا جیس کے بائیس اُسے یہہ سمجھ بھی ؟” اُس نے کہا : شاید اس لیے کہ وہ اپنے مال کی اکات نہیں دلتا ہا۔

(مکافحة القلوب، ص ۷۳ بتصرف)

میٹے میٹے ہُسخا می بائی یو ! یکات ہُسخا م کے پانچ ارکان

## કબ્ર મે આને વાલા દોસા

ਮੈਂ ਸੇ ਏਕ ਹੈ, ਝਕਾਤ ਕੀ ਅਦਾਏਗੀ ਮੈਂ ਮਾਲ ਕੀ ਛਿਫ਼ਾਜ਼ਤ, ਨਜ਼ਤੇ  
ਆਖਿਰਤ ਔਰ ਰਿਝੁਕ ਮੈਂ ਬ-2-ਕਤ ਜੈਂਸੇ ਫਵਾਈਦ ਭੀ ਪੋਸ਼ੀਦਾ ਹੈਂ,  
ਮਹਾਰ ਕੁਛ ਲੋਗ ਐਸੇ ਭੀ ਹੋਤੇ ਹੈਂ ਜੋ ਹਰ ਵਕਤ ਮਾਲ, ਮਾਲ ਔਰ ਮਾਲ  
ਕੀ ਰਟ ਲਗਾਨੇ ਵਾਲੇ ਫਰਜ਼ ਹੋਨੇ ਕੇ ਬਾ ਵੁਜੂਦ ਝਕਾਤ ਅਦਾ ਨਹੀਂ ਕਰਤੇ,  
ਐਸੋਂ ਕੋ ਖੂਬ ਸਮਝ ਲੇਨਾ ਚਾਹਿੇ ਕੇ ਕਲ ਬਰੋਜ਼ ਕਿਧਾਮਤ ਧੇਡੀ ਮਾਲ  
ਉਨ ਕੇ ਲਿਧੇ ਵਾਲੇ ਜਾਨ ਬਨ ਜਾਏਗਾ, ਚੁਨਾਨ੍ਹੇ

ગેજા સાંપ ગાલે મેં ડાલ દિયા જાઓશા

**اَللّٰهُمَّ كَمْ مَلَحِبُوبٌ، دَانَا بِهِ غُرْوَجَلٌ** اُنِيلِ  
**غُرْوَجَلٌ** کے مال بُوب، دانا اے گوپوپ، مون جڑا ہون انیل  
 یوپوپ کا فرمائے ہبھات نیشان ہے : جس کو  
 صَلَّى اللّٰهُ تَعَالٰى عَلٰيْهِ وَآلِہِ وَسَلَّمَ  
 اکھلاں نے مال دیا اور وہ اس کی جگات آدا ن کرے  
 تو کیامت کے دین وہ مال گنجے سانپ کی سوت میں کر دیا  
 جائے گا جس کے سر پر دو چیزیاں ہوں گی (یا' نی دو نیشان ہوں گے)،  
 وہ سانپ اس کے گاوے میں تاؤک بنا کر ڈال دیا جائے گا۔ فیر اس  
 (یا' نی جگات ن دنے والے) کی بآہنے پکھے گا اور کھے گا : “میں تے را  
 مال ہوں، میں تے را بخانہ ہوں۔”

(صحیح البخاری، کتاب الزکوٰۃ، باب ائمٍ مانع الزکوٰۃ، الحدیث ۳۰۱، ج ۱، ص ۴۷۴)

## આગામાત કા દર્શનાક નકારા

આ'લા હજરત, ઈમામે અહલે સુન્નત, મૌલાના શાહ ઈમામ  
અહમદ રજા ખાન કુરાનો હટીસ મેં બયાન કર્દા  
અગાબાત કા નકશા ખીંચતે હુએ ફરમાતે હૈ : “ખુલાસા યેહ હૈ કે  
જિસ સોને ચાંદી કી ઝકાત ન દી જાએ, રોજે કિયામત જહન્નમ કી  
આગ મેં તપા કર ઉસ સે ઉન કી પેશાનિયાં, કરવટે, પીઠે દાંગી  
જાઓંગી. ઉન કે સર, પિસ્તાન પર જહન્નમ કા ગર્મ પથ્થર રખેંગે કે  
છાતી તોડ કર શાને સે નિકલ જાએગા ઔર શાને કી હડી પર રખેંગે

કે હડિયાં તોડતા સીને સે નિકલ આએગા, પીઠ તોડ કર કરવટ સે નિકલેગા, ગુદ્ધી તોડ કર પેશાની સે ઉભરેગા. જિસ માલ કી ઝકાત ન દી જાએગી રોજે કિયામત પુરાના ખબીસ ખૂંખાર અગ્રદણ બન કર ઉસ કે પીછે ઢૈઠેગા, યેહ હાથ સે રોકેગા, વોહ હાથ ચબા લેગા, ફિર ગાલે મેં તૌક બન કર પડેગા, ઉસ કા મુંહ અપને મુંહ મેં લે કર ચબાએગા કે મેં હૂં તેરા માલ, મેં હૂં તેરા ખજાના. ફિર ઉસ કા સારા બદન ચબા ડાલેગા.” (ફિતાવા ૨-જવિયા તખરીજ શુદા, જી. 10, સ. 153) મેરે આકા આ’લા હજરત ઝકાત ન દેને વાલે કો કિયામત કે અગાબ સે ડરા કર સમજાતે હુએ ફરમાતે હું : ઐ અગ્રીજ ! કયા ખુદા વ રસૂલ ﷺ ઉર્ગુજીલ ઓચીલી ઉલ્લાસી ઉલ્લાસી એક આધ રૂપિયા (છોટા સા સિક્કા) પચાસ હજાર બરસ કી મુદ્દત મેં યેહ જાનકાહ મુસીબતેં જેલની સહ્લ જાનતા હૈ, ઝરા યહીં કી આગ મેં એક આધ રૂપિયા (છોટા સા સિક્કા) ગર્મ કર કે બદન પર રખ કર દેખ, ફિર કહાં યેહ ખરીફ (હલકી સી) ગરમી, કહાં વોહ કદર આગ, કહાં યેહ એક હી રૂપિયા કહાં વોહ સારી ઉમ્ર કા જોડા હુવા માલ, કહાં યેહ મિનટ ભર કી દેર કહાં વોહ હજાર દિન બરસ કી આફિત, કહાં યેહ હલકા સા ચહકા (યા’ની મા’મૂલી સા દાગ) કહાં વોહ હડિયાં તોડ કર પાર હોને વાલા ગાજબ. અલ્લાહ તાઓલા મુસલ્માન કો હિદાયત બખ્શે. (ઐજન, સ. 175)

એક ઔર મકામ પર આ’લા હજરત લિખતે હું : ગરજ ઝકાત ન દેને કી જાનકાહ (યા’ની ઈન્તિહાઈ તકલીફ દેહ) આફિતેં વોહ નહીં જિન કી તાબ આ સકે (યા’ની તાકત રખી જા સકે), ન દેને વાલે કો હજાર સાલ ઈન સખત અગાબોં મેં ગરિફતારી કી ઉમ્મીદ રખના ચાહિયે કે ઝર્ફુલ બુન્ધાન (યા’ની બહુત કમાઓર)

ઈન્સાન કી ક્યા જાન, અગર પહાડોં પર ડાલી જાએં સુરમા હો કર  
ખાક મેં ભિલ જાએં.

(ફતાવા ૨-જવિયા, જિ. 10, સ. 871)

નમાજો રોજા વ હજાજો ઝકાત કી તૌફીક

અતા હો ઉભ્મતે મહબૂબ કો સદા યા રબ

(વસાઈલે બજીશાશ, સ. 55)

## ઝકાત કિસ પર ફરજ હે ?

ઝકાત દેના હર ઉસ આકિલ, બાલિગ ઔર આજાદ મુસલ્માન  
પર ફરજ હૈ જિસ મેં યેહ શરાઈત પાઈ જાએં : (1) નિસાબ કા માલિક  
હો. (2) યેહ નિસાબ નામી હો. (3) નિસાબ ઉસ કે કબજે મેં હો. (4)  
નિસાબ ઉસ કી હાજરે અસ્થિયા (યા'ની ઝરુરિયાતે જિન્દગી) સે ઝાઈદ  
હો. (5) નિસાબ દૈન સે ફારિગ હો (યા'ની ઉસ પર ઐસા કર્જ ન હો  
જિસ કા મુતા-લબા બન્દોં કી જાનિબ સે હો, કે અગર વોહ કર્જ અદા કરે તો  
ઉસ કા નિસાબ બાકી ન રહે.) (6) ઉસ નિસાબ પર એક સાલ ગુજર  
જાએ. (મુલઘ્યસન, બહારે શરીઅત, જિ. 1, હિસ્સા : 5, સ. 875 તા 876)

ઈન શરાઈત કી તફસીલ ઔર ઝકાત કે બારે મેં મજીદ મા'લૂમાત  
કે લિયે દા'વતે ઈસ્લામી કે ઈશાઅતી ઈદારે મક-ત-બતુલ મદીના  
કી 149 સફણત પર મુશ્તમિલ કિતાબ “ફેઝાને ઝકાત” કા ઝરુર  
મુતા-લઆ કીજિયે.

## લૂટ કે માલ સે હજ કરને વાલે કા અન્નામ

એક કાફિલા હજ કો જા રહા થા કે રાસ્તે મેં એક મુસાફિર  
ચલ બસા. કાફિલે વાલોં ને કિસી સે એક ફાવડા ઉધાર લિયા ઔર  
ઉસ સે કબ્ર ખોટ કર ઉસે વહીં દફ્ફન કર દિયા. જબ કબ્ર બન્દ કર ચુકે

તો ઉન્હેં યાદ આયા કે ફાવડા ભી કષ્ટ હી મેં રહે ગયા. ઉન્હોંને તુસે નિકાલને કે લિયે કષ્ટ ખોઈ. અબ જો અન્દર દેખા તો તુસ શાખસ કે હાથ પૈર ફાવડે કે હલ્કે મેં જકડે હુએ હોયાં. યેહ ખૌફનાક મન્જર દેખ કર કષ્ટ ફૌરન બન્ધ કર દી ઔર ફાવડે વાલે કો કુછ પૈસે દે કર જાન છુડાઈ. હજ સે વાપસી પર તુસ કી બીવી સે તુસ કે આ'માલ કે બારે મેં સુવાલ કિયા તો તુસ ને બતાયા કે “એક મરતબા ઈસ કે હમરાહ એક માલદાર શાખસ ને સફર કિયા. રાસ્તે મેં ઈસ ને તુસ કો માર ડાલા, અબ તક યેહ હજ ઔર જિહાદ સબ કુછ તુસી કે માલ સે કરતા રહા હૈ.”

(શ્રદ્ધાચલ, ચં. ૧૭૪)

મિયા દે સારી ખતાઓ મરી મિયા યા રબ બના દે નેક બના નેક દે બના યા રબ  
અંધેરી કષ્ટ કા દિલ સે નહીં નિકલતા ડર કરુંગા કયા જો તુ નારાજ હો ગયા યા રબ  
ગુનાહગાર હું મેં લાઈક જહનમ હું કરમ સે બધ્ય દે મુજ કો ન દે સાઝા યા રબ

(વસાઈલે બાળિશાશ, સ. 54)

صَلَوَاتُ اللَّهِ تَعَالَى عَلَى مُحَمَّدٍ  
صَلَوَاتُ اللَّهِ تَعَالَى عَلَى الْحَبِيبِ !

## (6 ટા 10) શારાબ, જિના, ગીબત, ગૂટી કશમેં ખાના ઔર રોગા ન રહના।

દા'વતે ઈસ્લામી કે ઈશાઅતી ઈદારે મક-ત-બતુલ મદીના કે મતબૂઆ 32 સફહાત પર મુશ્તમિલ રિસાલે “કફન ચોરોં કે ઈન્કિશાફાત” મેં હૈ : એક બાર ખલીફા અખ્દુલ મલિક કે પાસ એક શાખસ ઘબરાયા હુવા હાજિર હુવા ઔર કહને લગા : આલીજાહ ! મૈં બેહદ ગુનાહગાર હું ઔર જાનના ચાહતા હું કે મેરે લિયે મુઆફી ભી હૈ યા નહીં ? ખલીફા ને કહા : કયા તેરા ગુનાહ જમીન વ આસ્માન સે ભી બડા હૈ ? તુસ ને કહા : બડા હૈ. ખલીફા ને પૂછા : કયા તેરા

## کتاب میں آگئے والیا ڈوٹ

ગुનાહ લौણો કલમ સે ભી બડા હૈ ? જવાબ દિયા : બડા હૈ. પૂછા : ક્યા તેરા ગુનાહ અર્શ વ કુર્સી સે ભી બડા હૈ ? જવાબ દિયા : બડા હૈ. ખલીફા ને કહા : ભાઈ યકીનન તેરા ગુનાહ **આલ્હાનું જગ્હા** કી રહમત સે તો બડા નહીં હો સકતા. યેહ સુન કર ઉસ કે સીને મેં થમા હુવા તૂઝાન આંખોં કે જરીએ ઉમંડ આયા ઔર વોહ દહારે માર માર કર રોને લગા. ખલીફા ને કહા : ભઈ આભિર મુજે પતા ભી તો ચલે કે તુમ્હારા ગુનાહ ક્યા હૈ ? ઈસ પર ઉસ ને કહા : હુઝૂર ! મુજે આપ કો બતાતે હુએ બેહદ નદામત હો રહી હૈ તાહમ અર્જ કિયે દેતા હું, શાયદ મેરી તૌબા કી કોઈ સૂરત નિકલ આએ. યેહ કહ કર ઉસ ને અપની દાસ્તાને દહ્યશત નિશાન સુનાની શુરૂઆ કી. કહને લગા : આલીજાહ ! મૈં એક કફન ચોર હું. આજ રાત મૈં ને પાંચ કબ્ધોં સે ઈબ્રિત હાસિલ કી ઔર તૌબા પર આમાદા હુવા.

## શરાબી કા અન્જામ

કફન ચુરાને કી ગરજ સે મૈં ને જબ પહેલી કબ્ધ ખોટી તો મુદ્દે કા મુંહ કિંબે સે ફિરા હુવા થા. મૈં ખૌફિઝદા હો કર જૂં હી પલટા કે એક ગૈબી આવાજ ને મુજે ચૌકા દિયા. કોઈ કહ રહા થા : “ઈસ મુદ્દે સે અગ્રાબ કા સબબ તો દરયાફત કર લે.” મૈં ને ઘબરા કર કહા : મુજ મૈં હિંમત નહીં, તુમ હી બતાઓ ! આવાજ આઈ : યેહ શાખ્સ શરાબી ઔર જાની થા.

## બિન્જીર નુમા મુર્દા

દૂસરી કબ્ધ ખોટી તો એક દિલ હિલા દેને વાલા મન્જર મેરી આંખોં કે સામને થા. ક્યા દેખતા હું કે મુદ્દે કા મુંહ બિન્જીર જૈસા હો ચુકા હૈ ઔર તૌક વ ઝન્જર મેં જકડા હુવા હૈ. ગૈબ સે આવાજ આઈ : યેહ જૂટી કસમેં ખાતા ઔર હરામ રોજી કમાતા થા.

## આગ કી કીલો

તીસરી કબ્ર ખોદી તો ઉસ મેં ભી એક ભયાનક મન્જર થા. મુર્દા ગુદી કી તરફ જબાન નિકાલે હુએ થા ઔર ઉસ કે જિસમ મેં આગ કી કીલોં હુકી હુઈ થી. જૈબી આવાજ ને બતાયા : યેહ ગીબત કરતા, ચુગલી ખાતા ઔર લોગોં કો આપસ મેં લડવાતા થા.

## આગ કી લપેટ મેં

ચૌથી કબ્ર ખોદી તો મેરી નિગાહોં કે સામને એક બેહદ સન્સની ખૈજ મન્જર થા ! મુર્દા આગ મેં ઉલટ પલટ હો રહા થા ઔર ફિરિશે ઉસ કો આગ કે ગુર્જો (યા'ની આ-તશી હથોડો) સે માર રહે થે. મુજ પર એક દમ દહ્યશત તારી હો ગઈ ઔર મેં ભાગ ખડા હુવા મગર મેરે કાનોં મેં એક જૈબી આવાજ ગૂજ રહી થી કે યેહ બદ નસીબ નમાજ ઔર રોજએ ર-મજાન મેં સુસ્તી કિયા કરતા થા.

## જવાની મેં તૌબા કા ઈન્દ્રામ

પાંચવીં કબ્ર જબ ખોદી તો ઉસ કી હાલત ગુજરતા ચારોં કબ્રોં સે બિલ્કુલ બર અક્સ થી. કબ્ર હદે નજર તક વસીઅ થી, અન્દર એક તખ્ત પર ખૂબરુ નૌ જવાન બૈઠા હુવા થા. જૈબી આવાજ ને બતાયા : ઈસ ને જવાની મેં તૌબા કર લી થી ઔર નમાજ વ રોજા કા સખ્તી સે પાબન્દ થા. (કફ્ફન ચોરોં કે ઈન્કિશાફત, સ. 23)

صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

## (11) پےشاں سے ن بھاننا

ہزارتے سالیہ دنیا ابھو ہو رہا رہا سے ریواخت ہے کہ  
نبی یہ مُعَذَّب، رسوئے مُؤْمِن رہا نے صَلَّی اللہُ تَعَالَیٰ عَلَیْہِ وَسَلَّمَ ہر شاہد  
فرمایا : “آجھے کوئی ٹمُمُن پےشاں سے (ن بھانے کی وجہ سے)  
ہوتا ہے۔” (ابن ماجہ، کتاب الطهارت، باب التشدید فی البول، الحدیث ۳۴۸، ج ۱، ص ۲۱۹)

## (12) میلاد و تکریں کی سماں

رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُمَا سَلَّمَ اپنے احتجاج سے  
کی بھروسہ میں اک شاپس ہائلر ہوا اور ارج کی : “ہم گھر ! ہم  
بھروسہ سے لوگ ہج کرنے آئے ہیں۔ سفرا و مرحوم کی ساری کے ہمارا ن  
ہمارے اک دوست کا ہنگامہ ہو گیا۔ گھر و تکڑیں و گھر کے  
باہر اسے کوئی سٹاں لے جایا گیا۔ جب اس کے لیے کوئی بھروسہ تو  
ہم یہاں دب کر ہمارا ن رہ گئے کہ اک بھروسہ بڑا احتجاج کوئی میں  
ماؤچڑا ہے۔ ہم نے اسے ڈکھ کر دوسری کوئی بھروسہ۔ وہاں بھی وہی  
احتجاج باؤچڑا ہا۔ فیر تیسرا کوئی بھروسہ تو اس میں بھی وہی  
باؤچنکا سانپ کونڈلی مارے ہے۔ ہم میں بھی پرےشاپی لائیک ہوئی۔  
ابھ میں اس بھیت کو وہی ڈکھ کر آپ کی بارگاہ میں بس اپنے  
دریافت کرنے آیا ہو کے اس باؤچنکا سوچتے ہاں میں کیا کرے ؟ ”  
ہزارتے سالیہ دنیا اپنے احتجاج سے فرمایا : “وہ  
احتجاج اس کا بھروسہ املا ہے جو وہ ہونیا میں کیا کرتا ہا،  
تum جاؤ اور ان تین کوئی میں سے کسی اک میں اسے دفن کر دو،  
اگر تum اس شاپس کے لیے ساری یہ میں بھی بھروسہ اکلو تھا بھی  
وہاں اس احتجاج کو جڑ ر پا او گے۔ ” وہ شاپس وابس چلنا گیا

ઔર ઉસ ફૈત શુદ્ધ શાખસ કો ઉન ખોદી હુઈ કથ્યો મેં સે એક કથ્ય મેં દફ્ફન કર દિયા ગયા ઔર અજૂદહા બ દસ્તૂર ઉસ કથ્ય મેં મૌજૂદ થા. ફિર જબ હમારા કાફિલા હજ કે બા'દ અપને અલાકે મેં પહોંચા તો લોગોંને ઉસ શાખસ કી જોજા સે પૂછા : “તુમ્હારા શોહર ઐસા કૌન સા ગુનાહ કરતા થા જિસ કી વજહ સે ઉસ કો ઐસી દર્દનાક સર્જા મિલી ?” ઉસ ઔરત ને અફસોસ કરતે હુએ કહા : “મેરા શોહર ગલ્લે કા તાજિર થા ઔર વોહ ગલ્લે મેં મિલાવટ કિયા કરતા થા. રોજાના ઘર વાલોં કી ઝરૂરત કે મુતાબિક ગન્ધુમ નિકાલ લેતા ઔર ઈતની મિકદાર મેં જવ કા ભૂસા ગન્ધુમ મેં મિલા દેતા, યેહ ઉસ કા રોજ કા મા'મૂલ થા, લગતા હૈ ઉસે ઈસી (યા'ની મિલાવટ કે) ગુનાહ કી સર્જા દી ગઈ હૈ.”

(عيون الحكایات:الحكایة الرابعة عشرة بعد المائة، ص ١٣٢)

## મિલાવટ કા શર-ઈ હુકમ

મિલાવટ વાલા માલ બેચને કી જાઈજ સૂરતેં ભી હોં ઔર ના જાઈજ ભી, ચુનાન્યે આ'લા હજરત, ઈમામે અહલે સુન્નત, મૌલાના શાહ ઈમામ અહમદ રજા ખાન ઉલ્લેખારૂ حَمْدَهُ الرَّحْمَنِ سે મિલાવટ વાલે ધી કી ખરીદ વ ફરોખ્ત કે બારે મેં સુવાલ હુવા તો ફિતાવા ૨-ઝવિયા જિલ્દ 17 સફ્ફા 150 પર ફરમાયા : “અગર યેહ મસ્નૂઅ જા'લી (યા'ની નકલી) ધી વહાં આમ તૌર પર બિકતા હૈ કે હર શાખસ ઉસ કે જા'લ (યા'ની નકલી) હોને પર મુતલાઅ હૈ ઔર બા વુજૂદે ઈત્તિલાઅ ખરીદતા હૈ તો બશર્તે કે ખરીદાર ઉસી બલદ (યા'ની બસ્તી) કા હો, ન ગરીબુલ વતન તાજા વારિદ ના વાકિફ (યા'ની મુસાફિર, નયા આને વાલા ઔર અનજાન ન હો) ઔર ધી મેં ઈસ કદર મૈલ (યા'ની

મિલાવટ) સે જિતના વહાં આમ તૌર પર લોગોં કે જેડુન મેં હૈ અપની તરફ સે ઔર ઝાઈએ ન કિયા જાએ ન કિસી તરફ ઉસ કા જા'લી (યા'ની નકલી) હોના છુપાયા જાએ. ખુલાસા યેહ કે જબ ખરીદારોં પર ઉસ કી હાલત મકશૂફ (યા'ની આહિર) હો ઔર ફરેબ વ મુગા-લતા રાહ ન પાએ (યા'ની ધોકા દેને કી કોઈ સૂરત ન પાઈ જાએ) તો ઉસ (યા'ની મિલાવટ વાલે ધી) કી તિજારત જાઈજ હૈ, ધી બેચના ભી જાઈજ ઔર જો ચીજ ઉસ મેં મિલાઈ ગઈ ઉસ કા બેચના ભી, જૈસે બાજારી દૂધ, કે સબ જાનતે હું કે ઈસ મેં પાની હૈ ઔર બા વસ્કે ઈલ્બ (યા'ની જાનને કે બા વુજૂદ) ખરીદતે હું, યેહ (યા'ની ના જાઈજ હોના તો) ઉસ સૂરત મેં હૈ જબકે બાએએ (યા'ની બેચને વાલા) વકતે બૈએ (યા'ની બેચતે વકત) અસ્થી હાલત ખરીદાર પર આહિર ન કર દે ઔર અગર ખુદ બતા દે તો ઝાહેરિંવાયહ<sup>1</sup> વ મજાહબે ઈમામે આ'જમ મંعદુમ મેં મુત્લકન જાઈજ હૈ ઘ્વાહ (ધી મેં) કિતના હી મૈલ (યા'ની મિલાવટ) હો, અગર્યે ખરીદાર ગરીબુલ વતન (યા'ની પરદેસી) હો કે બા'દે બયાન ફરેબ (યા'ની ધોકા) ન રહા. બિલ જુમ્લા મદારે કાર ઝુંધૂરે અન્ન (યા'ની હર ચીજ કા દારો મદાર આહિર) પર હૈ ઘ્વાહ ખુદ ઝાહેર હો જૈસે ગેણું મેં જવ (નગર આ રહે છોં), યા બ જેણું તે ઉર્ફ વ ઈશિતિહાર (યા'ની ઉર્ફ વ શોહરત કે એ'તિબાર સે) મુશ્તરી (યા'ની ખરીદાર) પર વાળેહ હો જૈસે (કુ) દૂધ કા મા'મૂલી પાની, ઘ્વાહ યેહ (બેચને વાલા) ખુદ હાલતે વાકેઈ (યા'ની હકીકતે હાલ) તમામ વ કમાલ (યા'ની અસ્થી તરફ) બયાન કરે.” (ફિતાવા ર-જવિયા, જિ. 17, સ. 150)

1 : ફિક્કે હ-નજી મેં ઝાહેરિંવાયહ ઉન મસાઈલ કો કહા જાતા હૈ જો હારતે સાચ્યાના ઈમામ મુહમ્મદ બિન હસન શૈબાની قَدِيسٌ سَلَّمَ وَآلَهُ وَسَلَّمَ કી છ કિતાબોં (1) જામેએ સગીર (2) જામેએ કબીર (3) સિયર કબીર (4) સિયર સગીર (5) જિયાદાત (6) મબ્સૂત મેં મજાહૂર હોં.

## (13) ગુરુલે જનાબત મેં તાખીર

હજરતે સાચિદુના અભાન બિન અબ્ડુલ્લાહ બજલી ફરમાતે હું : હમારા એક પડોસી મર ગયા તો હમ કફન વ દફન મેં શરીક હુંએ. જબ કબ્ર ખોટી ગઈ તો ઉસ મેં બિલ્લે કી મિસ્લ એક જાનવર થા, હમ ને ઉસ કો મારા મગર વોહ ન હટા. ચુનાન્યે દૂસરી કબ્ર ખોટી ગઈ તો ઉસ મેં ભી વોહી બિલ્લા મૌજૂદ થા ! ઉસ કે સાથ ભી વોહી કિયા ગયા જો પહલે કે સાથ કિયા ગયા થા લેકિન વોહ અપની જગા સે ન હિલા.. ઈસ કે બા'દ તીસરી કબ્ર ખોટી ગઈ તો ઉસ મેં ભી યેહી મુઆ-મલા હુવા, આખિર લોગોંને મશવરા દિયા કે અબ ઈસ કો ઈસી કબ્ર મેં દફન કર દો, જબ ઉસ કો દફન કર દિયા ગયા તો કબ્ર મેં સે એક ખૌફનાક આવાજ સુની ગઈ ! તો હમ ઉસ શાખા કી બેવા કે પાસ ગણે ઔર ઉસ સે મરને વાલે કે બારે મેં દરયાફત કિયા કે ઉસ કા અમલ કર્યા થા ? બેવા ને બતાયા : “વોહ ગુરુલે જનાબત (યા'ની ફર્જ ગુરુલ) નહીં કરતા થા.”

(شرح الصدور بشرح حال الموتى والقبور، ص ١٧٩)

## ગુરુલે જનાબત મેં તાખીર કબુ હરામ હૈ

શૈખે તરીકત અમીરે અહલે સુન્નત અપની કિતાબ “ઈસ્લામી બહનોં કી નમાજ” કે સફ્લા 48 પર ઈસ રિવાયત કો નકલ કરને કે બા'દ લિખતે હું : દેખા આપ ને ! વોહ બદ નસીબ ગુરુલે જનાબત કરતા હી નહીં થા. ગુરુલે જનાબત મેં દેર કર દેના ગુનાહ નહીં અલબત્તા ઈતની તાખીર હરામ હૈ કે નમાજ કા વક્ત નિકલ જાએ. ચુનાન્યે બહારે શરીઅત મેં હૈ : “જિસ પર ગુરુલ વાજીબ હૈ વોહ અગર ઈતની દેર કર ચુકા કે નમાજ કા આખિર

## ਕਿਸੇ ਮੌਜੂਦੇ ਵਾਲਾ ਬੀਬੇ

વક્ત આ ગયા તો અબ ફૈરન નહાના ફર્જ હૈ, અબ તાખીર કરેગા ગુનહુંગાર હોગા.” (ભારે શરીઅત, જિ. 1, હિસ્સા : 2, સ. 521)

## જનાભાત કી હાલત મેં સોને કે અહંકાર

શારેહે બુખારી હજરત અલ્લામા મુફ્તી મુહુમ્મદ શરીરુલ  
હક અમજૂદી عَلَيْهِ رَحْمَةُ اللَّهِ الْقَوِيِّ મગ્કૂરા અહાદીસે મુખા-રકા કે તણ્ઠત  
કરમાતે હૈને : જુનુબી હોને (યા'ની ગુસ્લ ફર્જ હોને) કે બા'દ અગર  
સોના ચાહે તો મુસ્તહબ હૈ કે વુગ્ઝ કરે, ફૌરન ગુસ્લ કરના વાજિબ  
નહીં અલબત્તા ઈતની તાખીર ન કરે કે નમાઝ કા વક્ત નિકલ જાએ.  
યેહી ઈસ હદીસ કા મુહુમ્મદ (યા'ની મા'ના) હૈ. હજરતે અલી  
સે અભૂ દાવૂદ વ નસાઈ વગૈરા મેં મરવી હૈ કે  
કરમાયા : ઉસ ઘર મેં ફિરિશે નહીં જાતે જિસ મેં તસ્વીર યા કૃતા યા  
જુનુબી (યા'ની બે ગુસ્લા) હો. (૧૦૯ ص ૨૨૭ حદિથ)  
ઈસ હદીસ સે મુરાદ યેહી હૈ કે ઈતની દેર તક ગુસ્લ ન કરે કે નમાઝ  
કા વક્ત નિકલ જાએ ઔર વોહ જુનુબી (યા'ની બે ગુસ્લા) રહને કા

ઔર યેહી મતલબ બુગ્રોં કે ઈસ ઈશ્વરીની હૃતી કે હાલતે જનાભત મેં ખાને પીને સે રિઝ્ક મેં તંગી હોતી હૈ. (નુઝૃતુલ કારી, જિ. 1, સ. 770, 771)

## (14) સૂદખોર કા અજામ

હજરતે અલ્લામા ઈબને હજર મક્કી રખી ફરમાતે  
હેં કે જબ મૈં છોટા થા તો પાબન્ધી સે અપને વાલિદ માજિદ રખી  
કી કબ્ર પર હાજિરી દેતા ઔર કુરઆને પાક કી તિલાવત કિયા કરતા  
થા. એક મરતબા 2-મજાનુલ મુખારક મેં નમાજે ફજ કે ફૌરન બા'દ  
કબ્રિસ્તાન ગયા. ઉસ વક્ત કબ્રિસ્તાન મેં મેરે ઈલાવા કોઈ ન થા. મૈં  
ને અપને વાલિદ સાહિબ રખી કી કબ્ર કે કરીબ બૈઠ કર  
કુરઆને પાક કી તિલાવત શુરૂ કર દી, કુછ હી દેર ગુજરી થી કે  
અચાનક મુજે કિસી કે ઝોર ઝોર સે રોને કી આવાજ સુનાઈ દી. યેહ  
આવાજ એક કબ્ર સે આ રહી થી. મૈં ઘબરા ગયા ઔર તિલાવત છોડ  
કર કબ્ર કી તરફ દેખને લગા, ઐસા લગતા થા જૈસે કબ્ર કે અન્દર  
કિસી કો અજાબ દિયા જા રહા હો, કબ્ર મેં દફન મુર્દુ કી આહો જારી  
સુન કર મુજે ખૌફ મહસૂસ હોને લગા. જબ દિન ખૂબ ચઢ ગયા તો  
વોહ આવાજ સુનાઈ હેના બન્દ હો ગઈ. એક શખ્સ મેરે કરીબ સે  
ગુજરા તો મૈં ને ઉસ સે કબ્ર કે બારે મેં પૂછા, ઉસ ને મુજે બતાયા કે  
યેહ કુલાં કી કબ્ર હૈ. મૈં ઉસ શખ્સ કો પહ્યાન ગયા, યેહ બડા પક્કા  
નમાજી થા ઔર બે જા ગુફત-ગૂસે પરહેઝ કિયા કરતા થા. ઐસે નેક  
શખ્સ કી કબ્ર સે રોને પીટને કી આવાજેં સુન કર મૈં બડા હેરાન થા. મૈં  
ને મા'લૂમાત કી તો પતા ચલા કે વોહ સૂદખોર થા, શાયદ ઈસી  
વજહ સે ઉસે કબ્ર મેં અજાબ હો રહા થા.

(الزوج عن اقرار الكبار، ج ١: ص ١٣، ٢٣)

ઈસ હિકાયત સે ચન્દ સિક્કોં કી ખાતિર અપને આપ કો જુહનામ કે શો'લોં કી નજીર કરને કી જિસારત કરને વાલે સૂદખોરોં કો ઈબ્રત પકડની ચાહિયે કે કહીં મરને કે બા'દ ઉન કા ભી યેહી અન્જામ ન હો !

## મુર્દા ઉઠ બેઠા

જૌહરાબાદ (ટન્ડો આદમ) કે એક કપડે કે તાજિર કી લર્ડ ઐઝ દાસ્તાન સુનિયે ઔર કાંપિયે : અખારી ઈત્તિલાઅ કે મુતાબિક કથ્રિસ્તાન મેં એક જનાગા લાયા ગયા. ઈમામ સાહિબ ને જું છી નમાજે જનાગા કી નિયત બાંધી મુર્દા ઉઠ કર બૈઠ ગયા ! લોગોં મેં ભગદડ મચ ગઈ. ઈમામ સાહિબ ને ભી નિયત તોડ દી ઔર કુછ લોગોં કી મદદ સે ઉસ કો ફિર લિયા દિયા. તીન મરતબા મુર્દા ઉઠ કર બેઠા. ઈમામ સાહિબ ને મહૂર્મ કે રિશ્ટેદારોં સે પૂછા : ક્યા મરને વાલા સૂદખોર થા ? ઉન્હોંને ઈસ્થાત (યા'ની તસ્ટીકન હાં) મેં જવાબ દિયા. ઈસ પર ઈમામ સાહિબ ને નમાજે જનાગા પઢાને સે ઈન્કાર કર દિયા ! લોગોં ને જબ લાશ કબ્ર મેં રખી તો કબ્ર જમીન કે અન્દર ધંસ ગઈ. ઈસ પર લોગોં ને લાશ કો મિઠી વગેરા સે દબા કર બિજેર ફાતિહા હી ઘર કી રાહ લી. હમ કહ્દરે કહ્દહાર ઔર ગ-ઝબે જબ્બાર સે ઉસી કી પનાહ કે તલબ ગાર હૈં.

સૂદો રિશ્વત મેં તુલ્લસત હે બડી

ઔર દોઝખ મેં સર્જા હોગી કરી

(પુર અસરાર ભિકારી, સ. 21)

## માં સે જિના કરને વાલા

નાભિયે અકરમ, નૂરે મુજસ્સમ, શાહે બની આદમ  
ફરમાતે હૈન : સૂદ તહતર ગુનાહોં કા મજમૂઆ હૈ,  
ઈન મેં સબ સે હલકા યેહ હૈ કે આદમી અપની માં સે જિના કરે.

(سنن ابن ماجه ج ٣ ص ٢٧ حديث ٤٧٢٢، ٥٧٢٢ مُسْتَقْطَأً مِنَ الْحَدِيْثِيْنَ)

## પેટ મેં સાંપ

સરકારે નામદાર, મદીને કે તાજદાર, જનાબે અહમદે મુખ્તાર  
ને ફરમાયા : મે'રાજ કી રાત મેરા ગુજર કુછ  
એસે લોગોં પર હુવા, જિન કે પેટ મકાનોં કી તરહ થે, ઉન મેં સાંપ  
થે, જો પેટોં કે બાહર સે ભી નજર આતે થે. મૈં ને પૂછા કે એ  
જિબ્રિલ (عليه السلام) ! યેહ કૌન લોગ હૈન ? ઉન્હોંને અર્જ કી : “સૂદ  
ખાને વાલે.”

(سنن ابن ماجه ج ٣ ص ٧٣، ٧٤ حديث ٧٢، ٧١)

મુફ્સિસરે શહીર હકીમુલ ઉભ્મત હજરતે મુફ્તી અહમદ યાર  
ખાન ઇસ હદીસે પાક કે તહ્થત ફરમાતે હૈન : આજ અગર  
એક મા'મૂલી કીડા પેટ મેં પૈંચ હો જાએ, તો તન્દુરુસ્તી બિગડ જતી  
હૈ, આદમી બે કરાર હો જતા હૈ, તો સમજ લો ! કે જબ ઉસ કા પેટ  
સાંપોં બિશ્વૂઓં સે ભર જાએ, તો ઉસ કી તકલીફ વ બે કરારી કા  
ક્યા હાલ હોગા, રબ (غَرَوْجَلْ) કી પનાહ.

(મિરાતુલ મનાજી,

જિ. 4, સ. 952, જિયાઉલ કુરાન પદ્ધતિકેશનજ મર્કુલ ઔલિયા લાહોર)

## (15) મસ્જિદ મેં હંસના

હજરતે સચ્ચિદુના અનસ સે رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ સે રિવાયત હૈ કે  
ખા-તમુન્નબિય્યીન, સાહિબે કુરાને મુખીન صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَسَلَّمَ ને  
ફરમાયા : મસ્જિદ મેં હંસના કષ્ટ મેં તારીકી કા બાઈસ હૈ.

(مسند الفردوس، الحديث ٣٧٠٦، ج ٢، ص ٤)

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! મસ્જિદ મેં સન્ચાદા રહેને કે  
લિયે મસ્જિદ સે બાહુર ભી બે જા હંસી મજાક ઔર કુઝુલ ગોઈ કી  
આદત તર્ક કર દીજિયે.

મસ્જિદોં કા કુછ અદબ હાએ ! ન મુજ સે હો જકા

દર ગુજર ફરમા ઈલાહી બહરે શાહે બધ્રો બર

[www.dawateislam.com](http://www.dawateislam.com) (વસાઈલે બજિશા, સ. 743)

## લગ્નુંત પર નહીં હલાકત પર નગર રહિયે

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! આજ ગુનાહોં મેં લગ્નુંત જરૂર  
મહસૂસ હોતી હૈ મગર ઈન કી હલાકત ઐજિયાં હુમેં ઉસ જહાન મેં  
ભુગતની હોંગી જહાં સે વાપસી કી કોઈ સૂરત નહીં હૈ ! ઈન ગુનાહોં  
કો છોડના કડવી ગોલી કી મિસ્લ સહી મગર સિહુહત કા ઘ્યાહિશ  
મન્દ દવા કી કડવાહટ કી પરવાહ નહીં કરતા બલ્કે શિફા કો અપના  
મકસૂદ જાનતા હૈ. ઈસ બાત કો ઈસ હિકાયત સે સમજને કી કોશિશ  
કીજિયે, ચુનાન્યે

એક શાખ્સ જિસે દાલ બડી પસન્દ થી ઔર વોહ કિસી દૂસરે  
ખાને હતા કે ગોશત કો ભી ખાતિર મેં ન લાતા થા. ઉસ કા દોસ્ત ઉસે

મુગ્ગી ખાને કી દા'વત દેતા લેડિન વોહ યેહ કહ કર ઉસ દા'વત કો હુકરા દેતા કે ઈસ દાલ મેં જો લજ્જાત હૈ કિસી ઔર ખાને મેં કહાં ? આભિર કાર એક દિન જબ ઉસ કે દોસ્ત ને ઉસે મુગ્ગી ખાને કી દા'વત દી તો ઉસ ને સોચા કે આજ મુગ્ગી ભી ખા કર દેખ લેતે હોં કે ઈસ કા જાઓકા કેસા હૈ ઔર મુગ્ગી ખાને લગા. જબ ઉસ ને પહ્લા લુકમા મુંહ મેં રખા તો ઉસે ઈતની લજ્જાત મહસૂસ હુઈ કે અપની મન પસન્દ દાલ કો ભૂલ ગયા ઔર કહને લગા : “હટાઓ ઈસ દાલ કો, અબ મૈં મુગ્ગી હી ખાયા કરુંગા.” બિલા તશ્બીષ જબ તક કોઈ શખ્સ મહ્ઝ ગુનાહોં કી લજ્જાત મેં મુખ્તલા ઔર નેકિયોં કે સુકૂન સે ના આશાના હોતા હૈ, ઉસે યેહ ગુનાહોં હી રૌનકે જિન્દગી મહસૂસ હોતે હોં લેડિન જબ ઉસે નેકિયોં કા નૂર હાસિલ હો જાતા હૈ તો વોહ ગુનાહોં કી લજ્જાત કો ભૂલ જાતા હૈ ઔર નેકિયોં કે જરીએ સુકૂને કલ્બ કા મુતલાશી હો જાતા હૈ.

નેકિયોં મેં યા રસૂલલ્લાહ દિલ લગ જાએ કાશ ! ઔર ગુનાહોં સે મુજે હો જાએ નફરત યા રસૂલ લમ્છા લમ્છા બઢ રહી હોં હાએ ! ના ફરમાનિયાં ઔર ગુનાહોં કી નહીં જતી હૈ આદત યા રસૂલ

(વસાઈલે બાણિશ, સ. 77)

توبو إلٰي اللّٰهِ (યા'ની અલ્લાહ કી બારગાહ મેં તૌબા કરો.)

أَسْتَغْفِرُ اللّٰهَ (મેં અલ્લાહ કી બારગાહ મેં તૌબા કરતા હું.)

صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللّٰهُ تَعَالٰى عَلَى مُحَمَّدٍ

## કથ્ય કો જન્નત કા બાગ બનાને વાલે આ'માલ

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! યેહ દુન્યા દારુલ અમલ (યા'ની અમલ કરને કી જગહ) ઔર આખિરત દારુલ જરૂના (યા'ની બદલા મિલને કી જગહ) હૈ, જો હમ યદાં બોઅંગે વોહી આખિરત મેં કાટેંગે, ગન્ધુમ બો કર ચાવલ કી ફસ્લ હાસિલ કરને કી ચાહત કો દીવાને કા ખ્વાબ હી કહા જા સકતા હૈ. ઈસ લિયે સમજદારી કા તકાજા યેહી હૈ કે જો આપ કાટના ચાહતે હોય ઉસી કા બીજ બોઈયે. લિહજા જન્નત મેં જાને કે લિયે જન્નત મેં લે જાને વાલે આ'માલ કરને હોંગે, વોહ જન્નત જહાં એક ઈન્નિહાઈ ખૂબ સૂરત જહાન આબાદ હૈ, જિસ મેં મૌત કા આજાર નહીં, બીમારિયાં ઔર કર્જ દારિયાં નહીં, જિસ મેં બુદાપે કી કમજોરી નહીં, ગરીબી, નાદારી, મા'જૂરી ઔર મજબૂરી નહીં બલ્કે યેહ વોહ મકામ હૈ જહાં કિન્દળી કી સારી રા'નાઈયાં જમ્મા કર દી ગઈ હોય. હસીન હૂરે, મઝેદાર ખાને ઔર ફલ ઐસે કે લોગ તસવ્યુર નહીં કર સકતે, બિસ્તર ઔર લિબાસ ઐસે ઉમદા કે આજ બાદશાહોં કો નર્સીબ નહીં, કમરે ઔર મહલ ઐસે શાનદાર કે દુન્યા કે બડે બડે મહલ્યાત ઉન કે સામને છોટે દિખાઈ હોય. ફિર યેહ સબ કુછ હમેશા કે લિયે મિલેગા, ઈસ મેં કમી કા અન્દેશા હૈ ન છિન જાને કા ખટકા, લેકિન નેકિયાં કમાને કે લિયે કુછ તો મેહનત કરની પડેગી, ઈન્સાન રોજગાર મેં ભી તો મશકૃત ઉઠાતા હૈ કે ઈસ કે નતીજે મેં રોજી મિલતી હૈ. આજ હમ માલ કો બહુત અહિમ સમજતે હોય મગર યાદ રખિયે કે બિલફર્જ હમારી કબ્ર સોને સે ભર દી જાએ, હમારા સારા સરમાયા ઉસ મેં મુન્તકિલ કર દિયા જાએ તો ભી હમેં રાહત કા એક લમ્છા નહીં દિલવા સકતા, યેહ જમીન યેહ પ્લોટ ભી હમારે કિસી કામ ન આયેંગે, હમ સમજતે હોય કે યેહ જમીન હમારી

હૈ ? નહીં ! બલ્કે હમ ઈસ કે હૈસ કે એક દિન ઈસી મેં સમા જાઓંગે. ઔલાદ વ અહબાબ ઔર રિશ્તેદાર સિફ્ફ ખાક મેં લિટાના જાનતે હૈં, ફિર સિફ્ફ આ'માલ હી હમારે રફીકે કબ્ર હોંગે. હુન્યા વાલોં કી અશ્ક બારિયાં ઔર ઉદાસિયાં બરજખ મેં હમારે ક્યા કામ આસેંગી, સોગ-વારોં કી કસરત ક્યા ફાઅદા દેંગી ! કભી આપ ને સોચા ? ઐ કાશ ! ફિકે આખિરત હમ પર એસી ગાલિબ હો જાએ કે જબ તારીકી દેખેં તો કબ્ર કા અંધેરા યાદ આ જાએ, કોઈ તકલીફ પહોંચે તો કબ્ર વ હશર કી પરેશાનિયાં સામને આ જાએં, સોને લગેં તો મૌત ઔર કબ્ર મેં લૈટના યાદ આ જાએ, ઐ કાશ ! હમારા દિલ નેકિયોં મેં એસા લગ જાએ કે ગુનાહ કે ખયાલ સે ભી દૂર ભાગેં ! આઈયે ! કબ્ર કો રૌનક બખશને ઔર ઈસે આરામ દેહ બનાને વાલે ચન્દ આ'માલ કે બારે મેં જાનતે હૈં : ચુનાન્યે

## (1 ટા 5) નમાઝ, રોજા, હજ ઔર અકાત વગેરા

હજરતે સાથ્યદુના કા'બ રચ્છિ الل્હ تَعَالٰى عَنْهُ رَضِيَّ عَنْهُ سે મરવી હૈ કે જબ નેક આદમી કો કબ્ર મેં રખા જતા હૈ તો ઉસ કે આ'માલે સાલિહા, નમાઝ, રોજા, હજ, જિહાદ ઔર સ-દકા વગેરા ઉસ કે પાસ જમ્મા હો જતે હૈં, જબ અજાબ કે ફિરિશ્તે ઉસ કે પૈરોં કી તરફ સે આતે હૈં તો નમાઝ કહતી હૈ : ઈસ સે દૂર હો, તુમ્હારા યહાં કોઈ કામ નહીં, યેહ ઈન પૈરોં પર ખડા હો કર અલ્હાન ગુરૂજલ કી ઈબાદત કિયા કરતા થા. ફિર વોહ ફિરિશ્તે સર કી તરફ સે આતે હૈં તો રોજા કહતા હૈ : તુમ્હારે લિયે ઈસ તરફ કોઈ રાહ નહીં હૈ ક્યૂંકે હુન્યા મેં અલ્હાન તઆલા કી ખુશનૂદી કે લિયે ઈસ ને બહુત રોજે રખે ઔર તવીલ

ભૂક ઘાસ બરદાશત કી, ફિરિશે ઉસ કે જિસ્મ કે દૂસરે હિસ્સોં કી તરફ સે આતે હૈં તો હજ ઔર જિહાદ કહેતે હૈં કે હટ જાઓ, ઈસ ને અપને જિસ્મ કો તકલીફ મેં ડાલ કર અલ્લાહ તાલાલા કી રિઝા કે લિયે હજ ઔર જિહાદ કિયા થા લિહાજા તુમ્હારે લિયે યહાં કોઈ જગાહ નહીં હૈ. ફિર વોહ હાથોં કી તરફ સે આતે હૈં તો સ-દકા કહતા હૈ : મેરે દોસ્ત સે હટ જાઓ, ઈન હાથોં સે કિતને સ-દકાત નિકલે હૈં જો મહૂજ અલ્લાહ ગુરૂજ કી રિઝા કે લિયે દિયે ગએ ઔર ઈન હાથોં સે નિકલ કર વોહ બારગાહે ઈલાહી મેં મકબૂલિયત કે દ-રજે પર ફાઈજ હુએ લિહાજા યહાં તુમ્હારા કોઈ કામ નહીં હૈ. ફિર ઉસ મધ્યિત કો કણ જાતા હૈ કે તેરી જિન્દગી ઔર મૌત દોનોં બેહતરીન હૈં ઔર રહમત કે ફિરિશે ઉસ કી કબ્ર મેં જન્મત કા ફર્શ બિછાતે હૈં, ઉસ કે લિયે જન્મતી લિબાસ લાતે હૈં, હદે નિગાહ તક ઉસ કી કબ્ર કો ફરાખ કર દિયા જાતા હૈ ઔર જન્મત કી એક કિન્દીલ ઉસ કી કબ્ર મેં રોશન કર દી જાતી હૈ જિસ સે વોહ કિયામત કે દિન તક રોશની હાસિલ કરતા રહેગા.

(مكاشفة القلوب، باب في بيان القبر وسؤله، ص ١٧١)

## મુઝે નમાજ પઠને દો

હદીસે મુખા-રકા મેં હૈ કે જબ મધ્યિત કબ્ર મેં દાખિલ કી જાતી હૈ તો ઉસે (યા'ની મધ્યિત કો) સૂરજ દૂબતા (યા'ની ગુરુબ હોતા) હુવા મા'લૂમ હોતા હૈ તો વોહ આંખેં મલતા હુવા બૈઠતા હૈ ઔર કહતા હૈ : મુઝે છોડો મૈં ન નમાજ પઠ લું. (سنن ابن ماجة، كتاب الرهد، الحديث ٤٢٧٢، ج ٤، ص ٥٠٣)

હજરતે મુલ્લા અલી કારી عليه رحمة الله الباري લિખતે હૈં : “ગોયા વોહ ઉસ વક્ત અપને આપ કો હુન્યા હી મેં તસવ્યુર કરતા હૈ કે સુવાલ વ જવાબ રહેને દો મુઝે ફર્જ અદા કરને દો, વક્ત ખત્મ હુવા

## કથ મેં આબે વાલા દોષત

જો રહા હૈ, મેરી નમાજ જાતી રહેગી.” ફિર લિખતે હૈને : “યેહ બાત વોહી કહેગા જો દુન્યા મેં નમાજ કા પાબંદ થા ઔર ઉસ કો હર વક્ત નમાજ કા બયાલ લગા રહતા થા.”

(مرقة السنائيّ، تحت الحديث: ١٣٨، ج ١، ص ٣٦١)

## કથ મેં નમાજ પઠને વાલે બુગુર્ફ

હજરતે સાધ્યિદુના સાબિત બુનાની ને એક મરતબા હુઆ માંગી : “એ અલ્હાન ! અગર તૂ કિસી કો કષ્ટ મેં નમાજ પઠને કી ઈજાઝત દે તો મુજે ઝરૂર દેના.” જ્યા ઉન કા ઈન્તિકાલ હુવા તો કષ્ટ મેં ઉતારને વાલોં કા બયાન હૈ કે જ્યા હમ ઈંટ રખ ચુકે તો અચાનક એક ઈંટ ગિર પડી, હમ ને દેખા કે હજરત સાબિત બુનાની ઉલ્લેખિત અપની કષ્ટ મેં નમાજ પઠ રહે થે. હજરતે સાધ્યિદુના ઈશ્રાહીમ બિન સમ્મા ફરમાતે હૈને કે મુજે આપ કે મજાર કે કરીબ સે ગુજરને વાલે કઈ લોગોંને બતાયા કે જ્યા હમ હજરતે સાબિત બુનાની કી ઉલ્લેખિત કષ્ટ કે પાસ સે ગુજરતે હૈને તો કુરાન પઠને કી આવાજ સુનાઈ દેતી હૈ.

(شرح الصدور، ص ١٨٨)

## દો અંધેરે દૂર નોંધો

શૈખે તરીકત અમીરે અહલે સુન્નત કે “ડામથ બેસાન્ફેન્મ અલાલીય ફેઝાને સુન્નત” જિલ્દ 1 કે સફ્ફા 872 પર લિખતે હૈને : મન્કૂલ હૈ કે અલ્હાન સે ઉલ્લેખિત પાંચ મૂસા કલીમુલ્લાઘ ફરમાયા કે મેં ને ઉમ્મતે મુહમ્માદિયહ દો નૂર અતા કિયે હૈને તાકે વોહ દો અંધેરોં કે ઝરર (યા'ની નુકસાન) સે મહિદૂજ

રહેં. સાથીદુના મૂસા કલીમુલ્લાહ અર્જ કી :  
 યા અલ્લાહ ! વોહ દો નૂર કૌન કૌન સે હોય ? ઈશાદ હુવા :  
 “નૂરે ૨-મજાન ઔર નૂરે કુરાખાન.” અર્જ કી : દો અંધેરે કૌન કૌન સે  
 હોય ? ફરમાયા, “એક કબ્ર કા ઔર દૂસરા કિયામત કા.”

(دُرَةُ النَّاصِحِينَ ص ٩)

## ਪੁਣਬ੍ਰਾਂਦਾਰ ਕਲਾ

ਹੋਰਤੇ ਸਾਚਿਦੁਨਾ ਅਖੂਲਾਈ ਬਿਨ ਗਾਲਿਬ ਹਦਾਨੀ  
 ਮਹਕ ਆਨੇ ਲਗੀ। ਏਕ ਮਰਤਬਾ ਕਿਸੀ ਨੇ ਉਨ ਕੋ ਘਾਬ ਮੌਦੂ ਦੇਖਾ ਤੋ  
 ਪ੍ਰਦਾ : “ਆਪ ਕੀ ਕਥਾ ਸੇ ਖੁਸ਼੍ਬੂ ਕੈਂਸੀ ਆਤੀ ਹੈ ?” ਫਰਮਾਯਾ :  
 “ਤੀਨ ਰਾਹੀਂ ਤਿਲਾਵਤ ਔਰ ਰੋਜੇ ਕੀ ਬ-ਰ-ਕਤ ਹੈ।”

٢٦٦ ص (الحادي عشر، ج ٦، ٨٥٣)، حلية الأولياء، www.dawatulislam.net

નમાજો રોજા વ હજજો ઝકત કી તૌફીક

ਅਤਾ ਹੋ ਉਮਰੇ ਮਹਿਬੂਬ ਕੋ ਸਦਾ ਧਾਰਾ

صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

**કબુ મેં તિલાવત કરને વાલે બુગ્ઝેરી**

عَلَيْهِ رَحْمَةُ اللَّهِ الْقَوِيِّ ہمارے اخلاقی اسلام کا جلال دنیا میں سے ہے۔ اس کا سب سے بڑا مسئلہ یہ ہے کہ یہ کسی نے کہا تھا کہ کسی نے ہمارے ساتھ میں کوئی خوبی کیا ہے اور کسی نے کہا تھا کہ کسی کو کوئی بدھی کیا ہے۔ اس کا جواب اسی طبقے کے علماء میں پیدا ہے۔

(شرح الصدور، ص ٩١)

## (6) ساح کے انوار

اेक تవیل ہدیسے پاک میں یہ بھی ہے کہ جب مرنے والے کو کبھی میں ر�ا جاتا ہے تو نماجِ عس کی داری ترکھ آتا ہے اور روچے باری ترکھ اور کوران و لیکو انجکار عس کے سارے پاس اور عس کا نمازوں کی ترکھ یعنی کاموں کی ترکھ اور سبھ کبھی کے اےک گوشے میں آتا ہے۔ فیر **اعلیٰ حَمْرَوْجُّ** انجابِ بےjetata ہے تو نماج کھتی ہے: “پیछے ہٹ کے یہ تمامِ لیندگی تکالیف برداشت کرتا رہا، اب آرام سے لے گیا ہے۔” فیر انجابِ باری ترکھ سے آتا ہے تو روچے یہی جواب دتے ہیں، سارے کی جانب سے آتا ہے تو یہی جوابِ میلتا ہے۔ پس انجابِ کسی جانب سے بھی عس کے پاس نہیں پہنچتا۔ جس راہ سے جانا چاہتا ہے عسی ترکھ سے **اعلیٰ حَمْرَوْجُّ** کے دوست کو مہکوچ پاتا ہے لیکن جو وہ وہاں سے یعنی جاتا ہے۔ عسِ وکت سبھ تمام آمالم سے کھتتا ہے کہ میں ہس لیے ن بولتا کے اگر تुم سبھ آجیز ہو جاتے تو میں بولتا، لیکن میں اب پول سیراٹ اور بیجان پر کام آؤں گا۔

(الموسوعة لابن أبي الدنيا، الحديث، ج ۲۵، ص ۴۷۲)

## بادِ اکی-دھنی سے توبہ

بھیڑ بھیڑ ہسلاभی بائیو! کامیلِ موسیٰ باننے، جیبنت کرنے سوننے کی آداتِ نیکالنے، نمازوں اور سونناتوں کی آداتِ ڈالنے کے لیے دا'ватے ہسلاभی کے م-دھنی مائول سے ہر دم وابستا رہیے، سونناتوں کی تربیت کے لیے م-دھنی کاٹھیلوں میں آشیکانے رکھوں کے ساتھ سونناتوں برا سفر کیجیے اور کامیابِ لیندگی گوچا رکھوں اور آبیت سانوارنے کے لیے م-دھنی ہنچا مات کے موتاپیک امداد کر کے روکنا کہ مہینا کے ۱۲ ریاضی ریسا لایا پور کیجیے اور

હર મ-દની માહ કી 10 તારીખ કે અન્દર અન્દર અપને જિમ્મેદાર કો જમ્મા કરવાઈયે ઔર હજ્ઞતાવાર સુન્નતોં ભરે ઈજિતિમાાં મેં અવ્યલ તા આભિર શિર્કત કીજિયે. આપ કી તરળીબ કે લિયે ઈમાન અફરોજ મ-દની બહાર પેશ કી જતી હૈ ચુનાન્યે લતીફાબાદ હૈદરાબાદ (બાબુલ ઈસ્લામ સિન્ધ) કે એક ઈસ્લામી ભાઈ ને કુછ ઈસ તરણ બતાયા : બા'જ લોગોં કી સોહબત મેં બૈઠને કી બિના પર મેરા ઝેઠું ખરાબ હો ગયા ઔર મૈં તીન સાલ તક નિયાઝ શરીફ ઔર મીલાદ શરીફ વગેરા પર ઘર મેં એ'તિરાજ કરતા રહા મુજ્જે પહુલે દુર્દુદ શરીફ સે બહુત શગફ થા (યા'ની બેહદ દિલચસ્પી વ રગ્બત થી) મગર ગલત સોહબત કે સબબ દુર્દુદે પાક પઢને કા જગ્જબા હી દમ તોડ ગયા. ઈતિફાક સે એક બાર મૈં ને દુર્દુદ શરીફ કી ફિઝીલત પઢી તો વોહ જગ્જબા દોબારા જાગા ઔર મૈં ને કસરત કે સાથ દુર્દુદે પાક પઢને કા મા'મૂલ બના લિયા. એક રાત જબ દુર્દુદ શરીફ પઢતે પઢતે સો ગયા તો الصَّلُوةُ وَالسَّلَامُ عَلَيْكُمْ يَا رَسُولَ اللَّهِ મુજ્જે જ્વાબ મેં સબજ ગુમ્બદ કા દીદાર હો ગયા ઔર બે સાખ્તા મેરી જબાન સે દા'વતે ઈસ્લામી વાલે આશિકાને રસૂલ કા સુન્નતોં કી તરબિયત કા મ-દની કાફિલા હમારે ઘર કી કરીબી મસ્તિષ્ટ મેં આયા તો કિસી ને મુજ્જે મ-દની કાફિલે મેં સફર કી દા'વત દી, મૈં ચૂંકે મુ-ત-ઝબજિબ (Confuse) થા ઈસ લિયે તલાશે હક કે જગ્જબે કે તહૃત મ-દની કાફિલે કા મુસાફિર બન ગયા. મૈં ને સફેદ ઈમામા બાંધા થા મગર સબજ ઈમામે વાલે મ-દની કાફિલે વાલોં ને સફર કે દૌરાન મુજ પર ન કિસી કિસ્મ કી તનકીદ કી ન હી તન્જ કિયા બલ્કે અજનબિયત હી મહસૂસ ન હોને દી. અમીરે કાફિલા ને મ-દની ઈન્યામાત કા તાયારુફ કરવાયા

ઔર ઉસ કે મુતાબિક મા'મૂલ રખને કા મશવરા હિયા. મૈં ને મ-દની ઈન્નામાત કા બગૌર મુતા-લાયા કિયા તો ચૌક ઉઠા ક્યૂંકે હતને અબર દસ્ત તરબિય્યતી મ-દની ફૂલ જિન્દગી મેં પહલી હી બાર પઢે થે. આશિકાને રસૂલ કી સોહબત ઔર મ-દની ઈન્નામાત કી બ-ર-કત સે મુજ પર રબ્બે લમ યગ્નિ ગુરૂજાં કા ફળુલ હો ગયા. મૈં ને મ-દની કાફિલે કે તમામ મુસાફિરોં કો જમ્મ કર કે એ'લાન કિયા કે કલ તક મૈં બદ અકીદા થા આપ સબ ગવાહ હો જાઈયે કે આજ સે તૌબા કરતા હું ઔર દા'વતે ઈસ્લામી કે મ-દની માહોલ સે વાબસ્તા રહુને કી નિય્યત કરતા હું. ઈસ્લામી ભાઈયોં ને ઈસ પર ફરહત વ મુસરત કા ઈજહાર કિયા. દૂસરે દિન 30 રૂપૈ કી નુક્તી (બેસન કી મિઠાઈ જો મોતી કે દાનોં કી તરહ બની હોતી હૈ) મંગવા કર મૈં ને સરકારે બગદાદ હુઝુરે ગોસે આ'જમ શૈખ અખૂલ કાદિર જીલાની કી નિયાજ દિલવાઈ ઔર અપને હાથોં સે તકસીમ કી. મૈં 35 સાલ સે સાંસ કે મરજ મેં મુખ્યલા થા, કોઈ રાત બિગેર તકલીફ કે ન ગુજરતી થી, નીજ મેરી સીધી દાઢ મેં તકલીફ થી જિસ કે બાઈસ સહીએ તરણ ખા ભી નહીં સકતા થા. **الْحَمْدُ لِلّٰهِ عَزَّوَجَلَّ !** મ-દની કાફિલે કી બ-ર-કત સે દૌરાને સફર મુજે સાંસ કી કોઈ તકલીફ ન હુઈ ઔર **الْحَمْدُ لِلّٰهِ عَزَّوَجَلَّ !** મૈં સીધી દાઢ સે બિગેર કિસી તકલીફ કે ખાના ભી ખા રહા હું. મેરા દિલ ગવાહી દેતા હે કે અકાઈદે અહલે સુન્તત હક હેં ઔર મેરા હુસ્ને ઝન હે કે દા'વતે ઈસ્લામી કા મ-દની માહોલ અલ્લાહ ઔર (ઉસ કે ઘારે રસૂલ કી પારાં હો મેં મકબૂલ હૈ).

છાયે ગર શૈતનત, તો કરેં દેર મત કાફિલે મેં ચલેં, કાફિલે મેં ચલો

સોહબતે બદ મેં પડ, કર અકીદા બિગડ ગર ગયા હો ચલેં, કાફિલે મેં ચલો

**صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللّٰهُ تَعَالٰى عَلٰى مُحَمَّدٍ**

(ગીબત કી તબાહ કારિયાં, સ. 60)

## (7) مسٹریج ہوشان کرنے کی ب-۲-کتاب

ہمارتے سایدھونا عمر رَحْمَةُ اللَّهِ تَعَالَى عَنْهُ نے مارکٹ ان ریوایت کی کہ ”جس نے اعلان گز و جل کی مسٹریج کو روشن کیا اعلان گز و جل عس کی کش کو روشن فرمائے گا اور جس نے اس میں بخشبو اپنے رپھی تو اعلان گز و جل ۷ ناٹ میں عس کے لیے بخشبو مुہل ہے کرے گا۔“

شرح الصدور بشرح حال الموتى والقبور، ص ۱۵۹

امیر احمد سو ناٹ دامت برکاتہم انعامہ سے ریوایت کو نکلنے کرنے کے بادل لیختے ہیں : ماں لبم ہووا مسٹریج دن بنانا اور اس نہیں ٹوٹ، لبماں اور اگر بھتی وجوہا سے بخشبو دار رہنا کا رے سو اب ہے۔ مگر مسٹریج میں دیبا سلائی (یا نی مایس کی تیلی) ن جلا ہے کہ اس سے بارہ کی بخشبو نیکلتی ہے اور مسٹریج کو بخشبو سے بچانا واجب ہے۔ بارہ کا بخشبو دار ہوں اور ن آنے پا اے ہتھی دوڑ بآہر سے لبماں یا اگر بھتی وجوہا سوچنا کر مسٹریج میں لایا۔ اگر بھتیوں کو کسی بڑے تشریف وجوہا میں رہنا جوڑی ہے تاکہ اس کی رابط مسٹریج کے فرش وجوہا پر ن گیرے۔ اگر بھتی کے پیکٹ پر اگر جاندار کی تسلیم بھی ہو تو اس کو بخشبو دالیا۔ مسٹریج (نیڑے ہر اور کاروں وجوہا) میں ”اے رکھنر“ (AIR FRESHNER) سے بخشبو کا چیڈکاپ مٹ کیجیا کہ اس کے کیمیا وی مادے فراہم میں فلیں جاتے اور سانس کے جریا ایکٹوں میں پھونچ کر نوکسیان پھونچاتے ہیں۔ ایک تیجی تھکیک کے موتا بیک اے رکھنر کے ہلکی مال سے جیل کا سر تاں یا نی (SKIN CANCER) ہے سکتا ہے۔

(مسٹریج بخشبو دار رجیا، ص 2، 3)

ੴ ਕਾ ਮੈਂ ਆਨ੍ਹੇ ਵਾਲਾ ਧੋਖਾ

મજીએ મા'લુમાત કે લિયે મક-ત-બતુલ મદીના કે મત્બુઆ રિસાલે “મસ્ઝિદેં ખુશભૂદાર રખિયે” કા મુતા-લાયા કીજિયે.

صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

## ੴ ਮਾਰੀਅ ਕੀ ਧਿਆਨਾ

<sup>١٥٩</sup> (شرح الصدور بشرح حال الموتى والقبور، ص)

## દ્વારા કે મની કુલ

ਦਾ'ਵਤੇ ਈਖਲਾਮੀ ਕੇ ਈਸ਼ਾਅਤੀ ਈਧਾਰੇ ਮਕ-ਤ-ਬਤੁਲ ਮਦੀਨਾ  
 ਕੀ ਮਤਬੂਆ 310 ਸਫ਼ਲਾਤ ਪਰ ਮੁਸ਼ਤਮਿਲ ਕਿਤਾਬ “ਬਾਹਾਰੇ ਸ਼ਾਰੀਅਤ”  
 ਕੇ ਛਿੱਸਾ 16 ਸਫ਼ਲਾ 148 ਪਰ ਸਦਲੁਖਸ਼ਾਰੀਅਹ, ਬਾਦਲੁਤਾਰੀਕਹ ਹਜ਼ਰਤੇ  
 ਅਲਖਾਮਾ ਮੌਲਾਨਾ ਮੁਝਤੀ ਮੁਹੱਮਦ ਅਮਝਦ ਅਲੀ ਆਉਮੀ علیہ رحمۃ اللہ الکریم  
 ਫਰਮਾਤੇ ਹੋਣੇ : \* ਮਰੀਜ ਕੀ ਈਧਾਦਤ ਕਰਨਾ ਸੁਨਾਤ ਹੈ \* ਅਗਰ ਮਾਲੂਮ  
 ਹੈ ਕੇ ਈਧਾਦਤ ਕੋ ਜਾਏਗਾ ਤਾਂ ਉਸ ਬੀਮਾਰ ਪਰ ਜਿਵਾਂ ਗੁਜ਼ਰੇਗਾ ਐਸੀ  
 ਹਾਲਤ ਮੌਜੂਦਾ ਈਧਾਦਤ ਨ ਕਰੋ \* ਈਧਾਦਤ ਕੋ ਜਾਏ ਔਰ ਮਰੀਜ ਕੀ ਸਖ਼ਤੀ  
 ਫੇਰੇ ਤੋ ਮਰੀਜ ਕੇ ਸਾਮਨੇ ਯੇਹ ਜਾਹਿਰ ਨ ਕਰੋ ਕੇ ਤੁਮਾਰੀ ਹਾਲਤ ਖਰਾਬ  
 ਹੈ ਔਰ ਨ ਸਰ ਛਿਲਾਏ ਜਿਸ ਸੇ ਹਾਲਤ ਕਾ ਖਰਾਬ ਹੋਨਾ ਸਮਝਾ ਜਾਤਾ  
 ਹੈ \* ਉਸ ਕੇ ਸਾਮਨੇ ਐਸੀ ਭਾਤੋਂ ਕਰਨੀ ਚਾਹਿੰਦੇ ਜੋ ਉਸ ਕੇ ਫਿਲ ਕੋ

ભવી મા'લૂમ હોં \* ઉસ કી મિજાજ પુર્સી કરે \* ઉસ કે સર પર હાથ  
ન રખે મગર જબકે વોહ ઈસ કી ખ્વાહિશ કરે. \* ફાસિક કી ઈયાદત  
ભી જાઈજ હે કયૂંકે ઈયાદત હુકૂકે ઈસ્લામ સે હે ઔર ફાસિક ભી  
મુસ્લિમ હૈ.

(બહારે શરીઅત, હિસ્સા : 16, સ. 148)

## મરીજ કે લિયે ઓક દુઆ

હજરતે સાચ્છિદુના ઈજને અભાસ હેઠળ સે રિવાયત  
હે કે નૂર કે પૈકર, તમામ નબિયોં કે સરવર, દો જહાં કે તાજવર, સુલ્તાને  
બહૂરો બર ને ફરમાયા કે “જિસ ને કિસી ઐસે  
મરીજ કી ઈયાદત કી જિસ કી મૌત કા વકત કરીબ ન આયા હો ઔર  
સાત મરતબા યેહ અદ્ભુત કહે તો **અલ્લાહ** (عَزَّوَجَلَّ) ઉસ મરાજ સે  
શિફા અતા ફરમાએ : **أَسْتَأْنِ اللَّهُ الْعَظِيمَ رَبِّ الْعَرْشِ الْعَظِيمِ أَنْ يَشْفِيكَ**  
યા'ની મેં અ-જમત વાલે, અર્શે અગ્રીમ કે માલિક યા'ની અલ્લાહ ઉદ્દેશ્ય  
તેરે લિયે શિફા કા સુવાલ કરતા હું.

(سنن أبي داؤد، كتاب الجنائز، باب الدعاء للمربيض عند العيادة، الحديث ٦٠١٣، ج ٣، ص ١٥٢)

## મ-દની ઈન્યામાત ઔર ઈયાદત

અભીરે અહલે સુન્નત ને ઈસ પુર ફિતન દૌર  
મેં આસાની સે નેડિયાં કરને ઔર ગુનાહોં સે બચને કે તરીકાએ કાર  
પર મુશ્તમિલ શરીઅત વ તરીકત કા જામેઅ મજમૂઆ બનામ  
“મ-દની ઈન્યામાત” બ સૂરતે સુવાલાત મુરતબ કિયા હૈ. ઈસ્લામી  
ભાઈયોં કે લિયે 72, ઈસ્લામી બહનોં કે લિયે 63, ત-લ-બાએ ઈલ્મે  
દીન કે લિયે 92, દીની તાલિબાત કે લિયે 83, મ-દની મુન્નોં ઔર  
મ-દની મુન્નિયોં કે લિયે 40 જબકે ખુસૂસી ઈસ્લામી ભાઈયોં (યા'ની

ગુંગે બહરોં) કે લિયે 27 મ-દની ઈન્નામાત હું. બે શુમાર ઈસ્લામી ભાઈ, ઈસ્લામી બહને ઔર ત-લબા મ-દની ઈન્નામાત કે મુતાબિક અમલ કર કે રોજાના સોને સે કખલ “ફિકે મદીના કરતે હુએ” યા’ની અપને આ’માલ કા જાણેજા લે કર મ-દની ઈન્નામાત કે જેબી સાઈઝ રિસાલે મેં દિયે ગાએ ખાને પુર કરતે હું. ઈન મ-દની ઈન્નામાત કો ઈખ્લાસ કે સાથ અપના લેને કે બા’દ નેક બનને ઔર ગુનાહોં સે બચને કી રાહ મેં હાઈલ રૂકાવટે અલ્લાહ તાલા કે ફિજલો કરમ સે અક્સર દૂર હો જાતી હું ઔર ઈસ કી બ-ર-કત સે الحمد لله عزوجل પાબન્ધ સુન્નત બનને, ગુનાહોં સે નફરત કરને ઔર ઈમાન કી ઇફાજત કે લિયે કુઢને કા ઝેઠુન ભી બનતા હૈ. ઈન મ-દની ઈન્નામાત મેં સે એક મ-દની ઈન્નામ મરીજ કી ઈયાદત ભી હૈ, ચુનાન્યે દા’વતે ઈસ્લામી કે ઈશાઅતી ઈદારે મક-ત-બતુલ મદીના કે મત્બૂઆ 23 સફાત પર મુશ્તમિલ રિસાલે “મ-દની ઈન્નામાત” કે સફાત 17 પર મ-દની ઈન્નામ નમ્બર 53 હૈ : ક્યા આપ ને ઈસ હફતે કમ અંગ કમ એક મરીજ યા દુખી કી ઘર યા અસ્પતાલ જા કર સુન્નત કે મુતાબિક ગમ ખ્વારી કી ઔર ઉસ કો તોહફા (ખ્વાહ મક-ત-બતુલ મદીના કા શાઅએ કર્દા રિસાલા યા પેમ્ફલેટ) પેશ કરને કે સાથ સાથ તા’વીજાતે અતારિયા કે ઈસ્તિ’માલ કા મશવરા દિયા ?

ઉતાર દે મેરી નસ નસ મેં “મ-દની ઈન્નામાત”

નસીબ હોતા રહે “મ-દની કાફિલા” યા રબ

صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

## (૭) સૂરાએ મુલ્ક પઠને કા ઈન્યામ

હજરતે સચ્ચિદાનાના અખ્ટુલ્લાહ બિન મસ્તિદ رَحْمَةُ اللَّهِ تَعَالَى عَنْهُ સે રિવાયત હૈ કે “જબ બન્દા કબ્ર મેં જાએગા તો અજાબ ઉસ કે કદમોં કી જાનિબ સે આએગા તો ઉસ કે કદમ કહેંગે : “તેરે લિયે મેરી તરફ સે કોઈ રાસ્તા નહીં, ક્યૂંકે યેહ રાત મેં સૂરાએ મુલ્ક પઢા કરતા થા.” ફિર અજાબ ઉસ કે સીને યા પેટ કી તરફ સે આએગા તો વોહ કહેગા કે “તુમ્હારે લિયે મેરી જાનિબ સે કોઈ રાસ્તા નહીં, ક્યૂંકે યેહ રાત મેં સૂરાએ મુલ્ક પઢા કરતા થા.” ફિર વોહ ઉસ કે સર કી તરફ સે આએગા તો સર કહેગા કે “તુમ્હારે લિયે મેરી તરફ સે કોઈ રાસ્તા નહીં, ક્યૂંકે યેહ રાત મેં સૂરાએ મુલ્ક પઢા કરતા થા.” તો યેહ સૂરત રોકને વાલી હૈ, અજાબે કબ્ર સે રોકતી હૈ, તૌરાત મેં ઈસ કા નામ સૂરાએ મુલ્ક હૈ. જો ઈસે રાત મેં પછતા હૈ બહુત જિયાદા ઓર અચ્છા અમલ કરતા હૈ.

(المستدرك ،كتاب التفسير ، باب المانعة من عذاب القبر ، الحديث رقم ٣٨٩٢، ج ٣، ص ٣٢٢)

## કબ મેં સૂરાએ મુલ્ક પઠી જા રહી થી

ખતીબે સામરા હજરતે સચ્ચિદાના અખુલ હસન સામરી બહુત પરહેજ ગાર બુગુર્થે, ઉન્હોંને લોગોં કો સામરા કે લોગોં કો કબ્રિસ્તાન મેં એક કબ્ર દિખાઈ કે મુજે યહાં સે મુસલ્લાલ સૂરાએ મુલ્ક પઠને કી આવાજ સુનાઈ દી થી. (شرح الصدور، ص ١٩٠)

મીઠ મીઠ ઈસ્લામી ભાઈયો ! સૂરાએ મુલ્ક કી તિલાવત કરના એક મ-દની ઈન્યામ ભી હૈ ચુનાન્યે મ-દની ઈન્યામ નમ્બર ૩ હૈ : કયા આજ આપ ને નમાજે પંજગાના કે બા'દ નીજ સોતે વકત કમ અઝ કમ એક એક બાર આ-યતુલ કુર્સી, સૂ-રતુલ ઈલ્હાસ ઓર તસ્બીહે

ફાતિમા પઢી ? નીઝ રોજાના રાત મેં સૂરતુલ મુલ્ક  
પઢ યા સુન લી ?

صَلَوَاتُ اللَّهِ تَعَالَى عَلَى مُحَمَّدٍ صَلَوَاتُ اللَّهِ تَعَالَى عَلَى الْحَبِيبِ!

**કબ્ મેં ફિરિશ્તા કુરાઓન પઠાયેગા।**

<sup>٣٧٢</sup> كنز العمال، الحديث ٦٤٤٢، ج ١، ص

«10» સૂરાએ યારનિન શારીક કી. બ-૨-કત

ਮੁਲਕੇ ਧਰਮਨ ਮੌਜੂਦ ਹੋ ਦਿੱਤਾ ਕਰ ਕੇ ਵਾਪਸ ਆਉਣ ਵਾਲੇ ਹੋਣ ਲਈ ਤੋਂ ਉਨ੍ਹਾਂ ਨੇ ਕਥਾ ਮੌਜੂਦ ਕਰ ਕੇ ਪੀਟਾ ਸੁਣੀ। ਫਿਰ ਅਚਾਨਕ ਕਥਾ ਸੋ ਏਕ ਕਾਲਾ ਕੁਤਾ ਨੁਮੂਦਾਰ ਹੁਵਾ। ਏਕ ਸ਼ਾਬਦ ਨੇ ਪ੍ਰਭਾ : “ਤੂ ਕੌਨ ਹੈ ?” ਉਸ ਨੇ ਜਵਾਬ ਦਿਯਾ : “ਮੈਂ ਮਾਧਿਤ ਕਾ ਬੁਰਾ ਅਮਲ ਹੁੰ।” ਪ੍ਰਭਾ : “ਪਿਟਾਈ ਤੁਮਹਾਰੀ ਹੋ ਰਹੀ ਥੀ ਧਾ ਇਸ ਮੁਦੂਰੀ ਕੀ ?” ਉਸ ਨੇ ਕਹਾ : “ਮੇਰੀ ਹੀ ਹੋ ਰਹੀ ਥੀ, ਸੂਰਾਏ ਧਾਰੀਨ ਔਰ ਦੂਜੀ ਸੂਰਤੋਂ ਇਸ ਕੇ ਪਾਸ ਥੀ, ਵੋਹ ਮੇਰੇ ਔਰ ਇਸ ਕੇ ਦਰਮਿਆਨ ਹਾਈਲ ਹੋ ਗਈ ਔਰ ਮੁੜ ਕੇ ਮਾਰ ਭਗਾਯਾ।”

(١٨٦) شرح الصدورص

## ﴿11﴾ શૂરાથે સજદન શક્તાથત કરેથી

હજરતે ખાલિદ બિન મા'દાન તાબે રَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ

રિવાયત હૈ કે સૂરાએ સજ્જદહ કબ્ર મેં અપને પઢને વાલે કે બારે મેં ઝગડા કરેગી ઔર અર્જ કરેગી : “યા અલ્હાન ! અગર મૈં તેરી કિતાબ મેં સે હું તો ઈસ કે બારે મેં મેરી સિફારિશ કબૂલ ફરમા લે ઔર અગર મૈં તેરી કિતાબ મેં સે નહીં હું તો મુજે અપની કિતાબ સે મિટા દે.” સૂરાએ સજ્જદહ પરિન્દ કી માનિન્દ હોએ ઔર અપને પરોં કો પઢને વાલે પર ફેલા દેગી, ઉસ કે હક મેં શફાઅત કરેગી ઔર ઉસે કબ્ર કે અઝાબ સે બચાએગી.

(درمشور ح ٦ ص ٥٣٥)

## «12» સૂરાએ જિલજાલ પઠને કી બ-ર-કતો

હજરતે સાથ્યિહુના ઈજને અખ્ભાસ સે રિવાયત હૈ : જિસ ને જુમુઆ કે દિન મગારિબ કે બા'દ દો રફ્કઅત નમાઝ પઢી ઔર હર રફ્કઅત મેં સૂરાએ ફાતિહા કે બા'દ “إِنَّا رُزْلَكْ” (યા'ની સૂરાએ જિલજાલ) પન્દરહ મરતબા પઢી તો અલ્હાન તાઓલા ઉસ પર સકરાતે મૌત કી સખ્તી નર્મ કર દેગા, ઉસે અઝાબે કબ્ર સે મહફૂજ ફરમા દેગા ઔર પુલ સિરાત પર સાબિત ક-દમી અતા ફરમાએગા.

(شرح الصدور ص ١٨٦)

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! જબ મધ્યિત કબ્ર મેં દફન કી જતી હૈ તો કબ્ર ઉસે દબાતી હૈ, કબ્ર કે દબાને સે ન મોમિન બચતા હૈ ન કાફિર, ન નેક ન બદ, બચ્યા ન જવાન, ફર્ક સિર્ફ યેહ હૈ કે કાફિર સખ્ત દબાવ મેં પકડા જાતા હૈ ઉસ કી પસ્લિયાં ઈધર ઉધર હો જાતી હૈનું ઔર મોમિન કે લિયે દબાવ ઐસા હોતા હૈ જિસ તરફ માં અપને બચ્યે કો ઘાર સે દબાતી હૈ, બિલ્લી અપને બચ્યે કો ભી મુંહ મેં દબાતી હૈ ઔર ચૂંઠે કો ભી મગાર દોનોં મેં ફર્ક હૈ.

(માખૂજ અજ મિરઆતુલ મનાજીહ, જિ. 1, સ. 141 વ જિ. 2, સ. 456, 457)

### 《13》 સૂરથે ઈખલાસ પદને કા ફાઅદા

હુજૂરે અકરમ, નૂરે મુજસ્સમ ને એશાં ચીની લિંગ ફરમાયા : જિસ ને મ-રજુલ મૌત મેં સૂ-રતુલ ઈખલાસ પઢી તો વોહ કબ્ર કે ફિતને ઓર ઉસ કે દબાને સે મહિન્દું રહેણા.

(السّعْم الْأَوْسَط ج ٤ ص ٢٢٢ حديث ٥٧٨٥)

### 《14》 શાબે જુમુઆ કા દુર્દાન

બુજુગાને દીન ને ઉલ્લિયામની રહેણી કે જો શાખસ હર શાબે જુમુઆ (જુમુઆ ઓર જુમા'રાત કી દરમિયાની રાત) ઈસ દુર્દાન શરીફ કો પાબન્દી સે કમ અણ કમ એક મરતબા પછેણા :

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ وَبَارِكْ عَلَى سَيِّدِنَا مُحَمَّدِ وَآلِهِ وَصَحْبِهِ وَسَلِّمْ  
الْعَالِي الْقَدِيرُ الْعَظِيمُ الْجَاهُ وَعَلَى إِلَهٖ وَصَاحِبِهِ وَسَلِّمْ

વોહ મૌત કે વક્ત સરકારે મદ્દીના પિયારત કરેણા ઓર કબ્ર મેં દાખિલ હોતે વક્ત ભી, યહાં તક કે વોહ દેખેણા કે સરકારે મદ્દીના ઉસે કબ્ર મેં આપને રહુમત ભરે હાથોં સે ઉતાર રહે હું.

(أَفْضَلُ الصَّلَواتُ عَلَى سَيِّدِ السَّادَاتِ ص ١٥١ ملخصاً)

صَلُوٰعَكَ الْحَبِيبُ ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

### 《15》 કબ્ર કી ગમ ગુસાર

ઉલ્લિયા સાથી હિંદુ બિન અદહમ ફરમાતે હું કે મૈં ને એક જનાઝે કો કન્યા દેને કે બા'દ કહા કે આલોઠ મેરે લિયે મૌત મેં બ-ર-કત દે. તો એક ગૈલી આવાજ સુનાઈ દી : “ઓર મૌત કે બા'દ ભી.” યેહ સુન કર મુજ પર બહુત ખૌફ

تاری ہووا۔ جب لوگ اسے دشمن کر چکے تو میں کتب کے پاس بیٹھ کر احمد والے آجیکر ت پر گئے وہی کرنے لگا۔ ایسا نک کتب سے اسکے ہسینوں جمیل شجاع بادھ ر نیکلا، اس نے ساہن سوچ رے کپڑے پہن رکھے ہے جس سے بخشبو بھاک رہی تھی۔ اس نے بھوک سے کہا کہ：“اوے ہبھائیم！” میں نے کہا：“لابھےک۔” وہ میں نے اس سے پڑھا：“بھوکا آپ پر رحم فرمائے، آپ کون ہے؟” اس نے جواب دیا: تپت پر سے “ماؤت کے بآد بھی” کہنے والے میں ہی ہے۔ میں نے کہا کہ آجیکر آپ کا نام کیا ہے؟ تو اس نے کہا کہ میرا نام سعید ہے میں ہونیا میں ہنسان کی ہمداد ہوتی ہے اور کتب میں نور و مونس و گم گوسار اور کیامات میں یعنی کیامات کی ترک رکنوما اور کاہد بنتی ہے۔ (شرح الصدور، ص ۲۰۴)

## www.tahajjudkaanwar.net

تاجدارے ہر بم، سرایا جوڑو کر بم صلی اللہ تعالیٰ علیہ وآلہ وسلم نے اسکے مراتبہ ہجرتے ابتو ہر گیاشاری سے فرمایا: “جب تم کھنیں سفر پر روانا ہوتے ہو تو کیتنی تھماری کرتے ہو! کیامات کی تھماری کا آلاتم کیا ہوگا! اے ابتو ہر کیا میں تم کو اسی شے کی بابر نہ ہے جو تمہن کیامات کے دین نکلے ہے؟” ہجرتے سایہ دننا ابتو ہر گیاشاری صلی اللہ تعالیٰ علیہ وآلہ وسلم نے ارج کیا: میرے مان بآپ آپ صلی اللہ تعالیٰ علیہ وآلہ وسلم پر کرمان جزرے ہشاد فرمائیے تو آپ صلی اللہ تعالیٰ علیہ وآلہ وسلم نے ایشاد فرمایا: “سپت گرمی کے ماؤسیم میں ہشاد کے لیے روڑا رخو اور رات کی تاریکی میں دو رکعات پڑھو تاکہ کتب میں روشنی ہو۔” (موسوعہ ابن ابی الدنيا، کتاب التهجد و قیام اللیل، الحدیث ۱۰، ج ۱، ص ۲۴۷)

હજરતે સાચ્છિદુના શફીક બલખી ઉલ્લોભારી ફરમાતે હૈનું, હમ ને પાંચ ચીજોં કો પાંચ મેં પાયા (1) ગુનાહોં કે ઈલાજ કો નમાજે ચાશત મેં (2) કષ્ટોં કી રોશની કો તહજ્જુદ મેં (3) મુન્કર નકીર કે જવાબાત કો તિલાવતે કુરાન મેં (4) પુલ સિરાત પર સે સલામત ગુજરને કો રોજા ઔર સ-દકા વ ઘેરાત મેં (5) હશ્ર મેં સાયએ અર્શ પાને કો ગોશા નશીની મેં.

(مُلْحَصًا مِنْ شَرْحِ الصُّدُورِ، ص ١٤٦)

નમાજે તહજ્જુદ અદા કરના એક મ-દની ઈન્નામ ભી હૈ ચુનાન્યે મ-દની ઈન્નામ નમ્બર 19 હૈ :  
ક્યા આજ આપ ને નમાજે તહજ્જુદ, ઈશરાક વ ચાશત ઔર અવ્યાખીન અદા ફરમાએ ?

[www.dawateislami.net](http://www.dawateislami.net)

صَلَوَاتُ اللَّهِ تَعَالَى عَلَى مُحَمَّدٍ

## «17» એક હજાર અન્વાર

સાચ્છિદુલ મુખલિબીન, રહ્મતુલિલ આ-લમીન  
તીન સો મરતબા પઢા ઔર ફૌત હો જાને વાલે  
મુસલ્માનોં કી રૂહોં કો ઈસ કા સવાબ હંદિયા કિયા તો હર મુસલ્માન  
કી કષ્ટ મેં એક હજાર અન્વાર દાખિલ હોતે હૈનું ઔર જબ વોહ મરેગા।  
અહ્લાન ઉસ કી કષ્ટ મેં એક હજાર અન્વાર દાખિલ ફરમાએગા।”

(مكاشفة القلوب، ص ٣٠٨)

صَلَوَاتُ اللَّهِ تَعَالَى عَلَى مُحَمَّدٍ

ੴ ੧੮ ਨੋਕੀ ਕੀ ਦਾ'ਵਾ

અહ્લાન તથા-૨-ક વ તથાલા ને હજરતે સચ્ચિદુના મૂસા  
કલીમુલ્લાહ કી તરફ વહ્દ્ય ફરમાઈ : “ભલાઈ  
કી બાતેં ખુદ ભી સીખો ઔર દૂસરોં કો ભી સિખાઓ, મૈં ભલાઈ સીખને  
ઔર સિખાને વાલોં કી કથ્યો કો રોશન ફરમાઉંગા તાકે ઉન કો કિસી  
કિર્મ કી વહ્દુશત ન હો.” (حلીة الولياء ج ૬، ص ૫، رقم ૭૬૨૨)

(حلية الاولياء ج ٦، ص ٥، رقم ٧٦٢٢)

## મુખલિએન કી કર્યે إِنْ شَاءَ اللَّهُ عَزَّ وَجَلَّ જો - માચાંએની

અમીરે અહલે સુન્નત દામ્ત બ્રાહ્મણાન્યાં ઈસ રિવાયત કો નકલ  
કરને કે બા'દ લિખતે હું : ઈસ રિવાયત સે નેકી કી બાત સીખને  
સિખાને કા અજરો સવાબ મા'લૂમ હુવા. સુન્નતોં ભરા બયાન કરને  
યા દર્સ દેને ઔર સુનને વાલોં કે તો વારે હી ન્યારે હો જાઓગે,  
ઓર ઉન્હેં કિસી કિસ્મ કા ખોઝ મહસૂસ નહીં હોગા॥ ઈન્દ્રિયાદી  
કોશિશ કરતે હુએ નેકી કી દા'વત દેને વાલોં, મ-દની કાફિલે મેં સફર  
ઓર ફિકે મદ્દીના કર કે મ-દની ઈન્દ્રામાત કા રિસાલા રોજાના પુર  
કરને કી તરળીબ હિલાને વાલોં ઔર સુન્નતોં ભરે ઈજતિમાઅ કી  
દા'વત પેશ કરને વાલોં નીજ મુખાલિયતીન કી નેકી કી દા'વત કો  
સુન્નને વાલોં કી કુબૂર ભી હુઝૂર મુફીજુન્નૂર  
કે નૂર કે સદ્કે નૂરન અલા નૂર હોંગી.

અતા હો “નેકી કી દાવત” કા ખૂબ જરૂર્યા કે

ਹੁੰ ਧੂਮ ਸੂਜਾਤੇ ਮਹਿਬੂਬ ਕੀ ਮਚਾ ਯਾ ਰਵੇ

صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

## ﴿19﴾ દુન્યા મેં મુસીબત ઉઠાના

કિસી બુગુર્જાની ને હજરતે સાચ્છિદુના હસન બિન ગુકવાન કો (ઉન કી વફાત કે એક સાલ બા'દ ખ્વાબ મેં દેખા તો ઈસ્તિક્ષાર કિયા : કૌન સી કથ્રેં જિયાદા રોશન હૈને ? ફરમાયા, દુન્યા મેં મુસીબતેં ઉઠાને વાલોં કી.)

(تَبَيَّنَ الْمُغْرِبُينَ، الْبَابُ الْثَالِثُ، ص ١٦)

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! દેખા આપ ને ! વોહ ધુપ અંધેરી કથ્ર જિસે દુન્યા કા કોઈ બર્કી બલભ રોશન નહીં કર સકતા ઇન شَاءَ اللَّهُ عَزَّ وَجَلَّ أَنْ يَعْلَمَ عَلَيْهِ وَإِلَهُ وَسَلَّمَ

વોહ મીઠે મીઠે આકા ચલી લેણી નૂર કે સદકે પરેશાન હાલોં કે લિયે નૂર નૂર હો કર જગમગા ઉઠેંથી.

ખ્વાબ મેં ભી એસા અન્ધેરા કબી દેખા ન થા જૈસા અન્ધેરા હમારી કથ્ર મેં સરકાર હૈ યા રસૂલલ્હાહ આ કર કથ્ર રોશન કીજિયે જાત બેશક આપ કી તો મમબાઓ અન્વાર હૈ

صَلَوَاتُ اللَّهِ تَعَالَى عَلَى مُحَمَّدٍ وَآلِهِ وَسَلَّمَ

## ﴿20﴾ લોગોં કો તકલીફ ન પહોંચાને કા ઈન્યામ

હજરતે સાચ્છિદુના અબૂ કાહિલ રચી લેણે સે મરવી હૈ કે જો લોગોં કો તકલીફ પહોંચાને સે બાજ રહા, અલ્લાહ (ઉસે કથ્ર કી તકલીફ સે બચાએંથાં). (المجمع الكبير، الحديث، ج ١٨، ص ٩٢٨)

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! કિસી મુસલ્માન કી બિલા વજહે શર-ઈ દિલ આજારી કબીરા ગુનાહ, હરામ ઔર જહન્નમ મેં લે જાને વાલા કામ હૈ. સુલ્તાને દો જહાન કા ફરમાને

ایک بخش نیشاں ہے : ”مَنْ أذَى مُسْلِمًا فَقَدْ أذَى نِفَرًا وَمَنْ أذَى نِفَرًا فَقَدْ أذَى اللَّهَ“ کس نے (بیلہ وکھے شارع) کسی مسٹریان کو ہیجرا دی تو اس نے مسٹری ہیجرا دی اور جس نے مسٹری ہیجرا دی تو اس نے اعلیٰ حجہ کو ہیجرا دی۔“

(المعجم الاوسط، ج ۲ ص ۳۸۶ الحدیث ۷۶۰)

## ﴿21﴾ ہیساںے سواب

شافعی علیہ مسٹریان، جنابے رہب مرتلیل آلامین  
کی ترک ہوتی ہے کہ میں بآپ بآئی یا دوست کی دعاؤ اے فریادی  
کی مونتھیز ۲۷ تھی ہے، فیر جب اسے دعاؤ پھونچ جاتی ہے تو یہ  
اویز دعاؤ کی تماں نے متوں سے لیا دعا پیاری ہوتی ہے اور اعلیٰ حجہ  
اویز دعاؤ کا مودودی کے لیے دعاؤ اے مجیدیت کرننا ہن کے  
لیے تو ہڈھا ہے۔

(شعب الایمان، باب فی بر الوالدین، الحدیث ۵۰۹، ج ۶، ص ۲۰۳)

## میڈنے کا توهین

ہجرتے ساتھی دننا ان سے فرماتے ہیں کہ میں نے  
سرکارے مددیانا، سوتلانے بھا کریانا سے سونا کے  
”جب کوئی مسیحیت کو ہیساںے سواب کرتا ہے تو جیساں (علیہ السلام)  
اسے اک نو رانی تباک میں رکھ کر کبھی کے کنارے بھے ہو جاتے ہیں اور  
کہتے ہیں : ”اے گھری کبھی کے سا�ی ! یہ تو ہڈھا تے رے گھر والوں نے  
بے جا ہے، ہر سے کبھی لکھ کر لے۔“ فیر جب ووہ سواب اس کی کبھی میں  
دایبیل ہوتا ہے تو ووہ مودودی اس سے بے ہدایت بھیشی مہسوس کرتا ہے

## કૃત્ત મેં આનો વાલા દોષત

और उस के बोहं पड़ोसी गमगीन हो जाते हैं जिन की तरफ कोई शै  
हटिया नहीं की गई होती।”

(المعجم الأوسط للطبراني، باب من اسمه محمد، الحديث ٦٥٠٤، ج ٥، ص ٣٧)

**“ਛੇਮ” ਕੇ ਤੀਨ ਹੁਣਕ ਕੀ ਨਿਰਧਤ ਸੇ  
ਈਸਾਲੇ ਸਵਾਬ ਕੀ 3 ਹਿਕਾਇਆਤ**

## (1) બાગ સ-દકા કર દિયા

رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُمَا أَبْدَلَهُمَا حِلَالًا وَبَيْنَ أَبْدَلَهُمَا وَبَيْنَ الْمُبَدَّلَيْنَ  
 سے ریواخت ہے کہ اک سہابی نے ارج کی : ”�ا رَسُولَ اللَّهِ إِنَّمَا  
 مَنْ يَعْمَلَ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يُرَأَى وَشَرًّا يُرَأَى“ ! میری مان فیت ہو چکی ہے اگر میں اس کی ترک  
 سے س-دکا دُون تو کیا ہو ؟ اسے نکھل پھونچا دے گا ؟“ رہماتے دارین،  
 تا جدائے ہ-رہمن نے صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ  
 عَنْهُمْ نے ارج کی : ”مَنْ يَرْجُوا لِيْلَةَ الْمَرْيَامَ  
 يَرْجُوَ اللَّهَ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ“ میرے پاس اک بآگ ہے، آپ  
 گواہ رکھیے میں نے یہ بآگ اس کی ترک سے س-دکا کر دیا۔“

(الترمذى، كتاب الزكوة، باب ماجاء فى الصدقة، الحديث ٦٦٩ ج ٢، ص ١٤٨)

## (2) ਇਸਾਈ ਕੀ ਮਹਿਕਰਤ

ہمارتے سا یہ دننا اب جو لکھا ہے بین سالے ہے رَحْمَةُ اللّٰہِ تَعَالٰی عَلٰیہِ  
 فرماتے ہیں کہ میں نے ابتو نواس کو (उस کے مرنے کے باہم) جواب میں  
 دھرا کے ووہ بڑی نے 'متوں میں ہے۔ میں نے اس سے کہا کہ "احلماں  
 عَزٰزٌ وَجْهٌ نے ترے سا� کیا مुआ-ملہ کیا؟" اس نے جواب دیا کہ  
 "احلماں تआوا نے میری بخشش فرمانے کے سا� ساٹ یہ  
 نے 'متوں بھی اتنا فرمائی ہے۔' میں نے دریافت کیا کہ "تیری مانگریت  
 کا سبب کیا چیز بنی ہلاؤ کے تू تو اسادی थا؟" اس نے کہا کہ

“દર અસ્લ એક નેક શાખસ રાત કો કબ્રિસ્તાન મેં આયા ઔર અપની ચાદર બિધા કર ઉસ પર દો રક્ખાત નમાજ પઢી ઔર ઉન દોનોં રક્ખાતોં મેં દો હજાર મરતબા સૂરએ ઈલાસ યા’ની **قُلْ هُوَ اللّٰهُ أَحَدٌ** પઠ કર ઉસ કા સવાબ તમામ કબ્રિસ્તાન વાલોં કો બખ્શ હિયા. ચુનાન્યે ઈસ કી બ-ર-કત સે **આલ્હાન** ને તમામ કબ્રિસ્તાન વાલોં કી મહિફરત ફરમા દી ઔર ચૂંકે મૈં ભી ઈન તમામ મેં શામિલ થા લિહાજા મુજે ભી બખ્શ હિયા.”

(شرح الصدور، ص ٢٩٢)

### (3) રોગાના એક કુરાને પાક ઈસાલે સવાબ કરને વાતા નો જવાન

એક બુજુર્ગ ઈશ્રાદ ફરમાતે હેં કે કિસી શાખસ ને ખ્વાબ મેં દેખા કે કબ્રિસ્તાન કી તમામ કબ્રેં ફટ ગઈ હેં ઔર મુર્દું ઉન સે બાહર નિકલ કર જલ્દી જલ્દી જમીન સે કોઈ ચીજ સમેટ રહે હેં, લેકિન મુર્દો મેં સે એક શાખસ ફારિગ બેટા હુવા હૈ, વોહ કુછ નહીં ચુનતા. ઈસ શાખસ ને ઉસે જા કર સલામ કિયા ઔર પૂછા : “યેહ લોગ ક્યા ચુન રહે હેં?” ઉસ ને જવાબ હિયા : “જિન્દા લોગ જો કુછ સ-દકા, હુઆ યા દુરુદ વગૈરા ઈસ કબ્રિસ્તાન વાલોં કો ભેજતે હેં, ઉસ કી બ-રકાત સમેટ રહે હેં.” ઈસ ને કહા : “તુમ ક્યું નહીં ચુનતે?” જવાબ હિયા : “મુજે ઈસ વજહ સે ફરાગત હૈ કે મેરા એક બેટા હાફિઝ કુરાન હૈ જો કુલાં બાજાર મેં હલ્વા બેચતા હૈ, વોહ રોગાના એક કુરાને પાક પઠ કર મુજે બખ્શતા (યા’ની ઈસાલે સવાબ કરતા) હૈ.” યેહ શાખસ સુખ્ષે (ઉસી બાજાર મેં ગયા, દેખા કે એક નૌ જવાન હલ્વા બેચ રહા હૈ ઔર ઉસ કે હોંટ હિલ રહે હેં). ઉસ શાખસ ને જબ નૌ જવાન સે પૂછા “તુમ ક્યા પઠ રહે હો?” તો ઉસ ને જવાબ

## કૃત્ત મેં આનો વાલા દોષત

ਇਥਾ ਕੇ ਮੈਂ ਰੋਝਾਨਾ ਏਕ ਕੁਰਾਨੇ ਪਾਕ ਪਛ ਕਰ ਅਪਨੇ ਵਾਲਿਹੈਨ ਕੋ ਬਖ਼ਸ਼ਤਾ (ਯਾਨੀ ਈਸਾਲੇ ਸਵਾਬ ਕਰਤਾ) ਹੁੰਦਾ ਹੈ, ਈਸੀ ਕੀ ਤਿਲਾਵਤ ਕਰ ਰਹਾ ਹੈ। ਕੁਝ ਅਰੰਗ ਬਾਂਦ ਉਸ ਨੇ ਘਾਵ ਮੌਜੂਦ ਵਿਖੇ ਦੀਆਂ ਉਸੀ ਕਥਿਤਤਾਨ ਦੇ ਮੁਦੰਦੀਆਂ ਕੋ ਕੁਝ ਚੁਨਤੇ ਹੁੰਦੇ ਹੋਣਾ, ਈਸ ਮਰਤਬਾ ਵੀਡ ਸ਼ਾਬਦ ਭੀ ਚੁਨਨੇ ਮੌਜੂਦ ਹੈ। ਜਿਸ ਕਾ ਬੇਟਾ ਉਸੇ ਕੁਰਾਨੇ ਪਾਕ ਪਛ ਕਰ ਬਾਖ਼ਸ਼ਾ (ਯਾਨੀ ਈਸਾਲੇ ਸਵਾਬ) ਕਰਤਾ ਹੈ, ਉਸੇ ਚੁਨਤੇ ਫੇਖ ਕਰ ਈਸੇ ਬਹੁਤ ਤਅਜ਼ਜੁਬ ਹੁਵਾ, ਇਹ ਤਨੇ ਮੌਜੂਦ ਉਸ ਕੀ ਆਂਖ ਖੁਲ ਗਈ। ਸੁਖ ਉਠ ਕਰ ਉਸੀ ਬਾਜ਼ਾਰ ਮੌਜੂਦ ਹੈ। ਔਰ ਤਹਕੀਕ ਕੀ ਤੋ ਮਾਲੂਮ ਹੁਵਾ ਕੇ ਛਲਵਾ ਬੇਚਨੇ ਵਾਲੇ ਨੌਜਵਾਨ ਕਾ ਭੀ ਇਨ੍ਹਿਂ ਕਾਲ ਹੋ ਚੁਕਾ ਹੈ। (روض الریاحین، الحکایۃ السالعة والخمسون بعد المائة، ص ۱۷۷)

صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

﴿22﴾ ਰਾ-ਦਕਾ ਏਨੇ ਸੇ ਕਥਾ ਕੀ ਗਰਮੀ ਛੂ ਹੋਤੀ ਹੈ

ہجرتے سالیل دن اُنکا عَنْ رَبِّهِ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ مَوْلَانَا مُحَمَّدُ صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ سالیل آپ کے نام سے گرامی کے نام سے فرمایا : “بے شک کسی شخص کا س-دکا عس کی کبھی سے گرامی کو دوڑ کر دلتا ہے اور کیا بھت کے دین پومن اپنے س-دکے سا اے میں ہو گا۔” (المعجم الكبير، الحديث ۷۸۸، ج ۱۷، ص ۲۸۶)

## રાહે ખુદા મેં ખર્ચ કીજિયે

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! દેખા આપ ને ! રાહે ખુદા ગુરૂ રૂજું જાણી શકતા હોય એ  
મેં ખર્ચ કરને મેં ફાઅદા હી ફાઅદા હૈ, આખિરત મેં અજરો સવાબ  
કી હક્કદારી તો હૈ હી, બા'જ અવકાત હુન્યા મેં ભી ઈઝાફે કે સાથ  
હાથોં હાથ ઉસ કા ને'મલ બદલ અતા કિયા જાતા હૈ ઔર યેહ યકીની  
બાત હૈ કે રાહે ખુદા ગુરૂ રૂજું જાણી શકતા હોય એ

હજરતે સાયિદુના અબૂ હુરૈરા ફરમાતે હૈને : દો આલમ  
કે માલિકો મુપ્તાર, મક્કી મ-દની સરકાર ચલી લેલી હૈ શાદ  
ફરમાયા : સ-દકા માલ મેં કમી નહીં કરતા ઔર અલ્લાહ  
મુઆફ કરને કી વજહ સે બન્દે કી ઈજૂત હી બળતા હૈ ઔર જો અલ્લાહ  
તાલા કી રિજા કી ખાતિર ઈન્કિસારી કરતા હૈ તો અલ્લાહ  
ઉર્ગુજી ઉસે બુલન્દી અતા ફરમાતા હૈ. (صحیح مسلم ص ١٣٩٧ حدیث ١٢٨٨)

## અપને સ-દકાત દા'વતે ઈસ્લામી કો દીજિયે

تَبَلِّغُوا إِلَيْهِمْ أَنَّ الْحَمْدَ لِلّٰهِ عَزَّ وَجَلَّ  
તહરીક દા'વતે ઈસ્લામી 41 સે જિયાદા શો'ભાજત મેં મ-દની કામ  
કર રહી હૈ. બરાએ કરમ ! અપની ઝકાત વ ઉશર ઔર સ-દકાત વ  
ઘેરાત દા'વતે ઈસ્લામી કો દેને કે સાથ સાથ અપને રિશ્તેદારોં,  
પડોસિયોં ઓર દોસ્તોં પર ભી ઈન્ફિરાહી કોશિશ ફરમા કર હીન કે  
જીકાત વ ઉશર ઔર દીગર અતિયાત દા'વતે ઈસ્લામી કે મ-દની  
મર્ક્ઝ પર પહોંચા કર યા કિસી જિમ્માદાર ઈસ્લામી ભાઈ કો દે કર  
યા મ-દની મર્ક્ઝ પર ફોન કર કે કિસી ઈસ્લામી ભાઈ કો તલબ  
ફરમા કર ઉન્હેં ઈનાયત ફરમા દીજિયે. **અલ્લાહ આપ કા**  
**સીના મદીના બનાએ.** **امين بجاہِ اللہیِ الامین صَلَّى اللہُ تَعَالٰی عَلَيْهِ وَسَلَّمَ**

મ-દની મર્ક્ઝ દા'વતે ઈસ્લામી ફેઝાને મદીના  
પેટ્રોલ પંપ કે પાસ, ત્રી કોનિયા બગીયે કે સામને,  
મિરજા પૂર, અહમદાબાદ, ગુજરાત.

ફોન : 09327126325

[www.dawateislami.net](http://www.dawateislami.net)

صَلُّوا عَلَى الْحَكِيبِ ! صَلَّى اللّٰهُ تَعَالٰى عَلٰى مُحَمَّدٍ

«23 તા 29» ખત્મ ન હોણે વાલે 7 આ'માલ

ہجرتے سیمیڈھنا آبھو ہلئے رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ سے رِیْوَاٰتِ ہے  
 کہ ہلے جو پاک، ساہیبے لاؤلائک، سچھاہے افسھلائک وَ إِلَهٌ وَسَلَّمَ صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَإِلَهٌ وَسَلَّمَ نے فرمایا : “مُوبِینِ کے ہنچیکاں کے بآ’د ہیس کے املاں اور  
 نکیوں میں سے جو کوچھ ہیسے بھیلتا رہے گا، ووہ یہ ہے : (1) ہیس کا  
 ووہ ہلب جسے ہیس نے سیخایا اور ہلایا اور (2) نک بہٹا  
 جسے ہیس نے چوڑا، یا (3) ووہ کوڑا نے پاک جسے ویرسے میں چوڑا،  
 یا (4) ووہ مسٹریڈ جسے ہیس نے بنایا، یا (5) بھوساہنیر بھانیا  
 بنایا، یا (6) کسی نہدر کو جاری کیا، یا (7) ووہ س-د-کے  
 جاریا جسے ہیس نے ہاتھ سیڑھت اور کینڈھی میں اپنے مال  
 سے دیا، ہن کا سوا بھی ہیسے موت کے بآ’د بھی بھیلتا رہے گا۔”

(ابن ماجه، كتاب السنّة، باب ثواب معلم الناس الحِيْر، الحديث ٢٤٢، ج ١، ص ١٥٨)

ਈਲਮ ਕਥਾ ਮੌਜੂਦਾ ਸਾਥ ਰਹੇਗਾ।

سخیہ دھل مُور-سالین، جنابے رَحْمَةُ اللّٰہِ تَعَالٰی عَلَيْهِ وَالْوَسْلَمُ نے فرمایا کہ جب آلبم ٹھیک ہوتا ہے تو اُس کا یہ لکھ کر اپنے تک کش میں اُس کو مانوس کرنے کے لیے مُوتشر کر دے کر (یا نئی شکل یعنی رکھ کر) رکھتا ہے اور جمیں کے کیدوں کو دور کرتا ہے۔

(شرح الصدور للسيوطى، باب احاديث الرسول ﷺ في عدة أمور، ص ۱۵۸)

(شرح الصدور للسيوطى، باب احاديث الرسول ﷺ فى عددة امور، ص ١٥٨)

## ઓલાદ કો ઈલ્મે દીન સિખાને કી બ-ર-કત

હૈરાન હુએ ઔર અલ્લાહ કી બારગાહ મેં અર્જ કી : યા  
અલ્લાહ ! મુઝે ઈસ કા રાજ બતા દે કે પહોલે ઈસ પર અજાબ  
કર્યું હો રહા થા ઔર અબ ઈસે જન્મત કી ને'મતે કેસે મિલ ગઈ ?  
અલ્લાહ ને ઈશ્વરીફ ફરમાયા : “એ ઈસા ! યેહ સખ્ત ગુનહગાર  
ઔર બદકાર થા, ઈસ વજહ સે અજાબ મેં ગરિફતાર થા, મરને કે  
બા'દ ઈસ કે ઘર લડકા પૈદા હુવા ઔર આજ ઈસ કો મદરસે ભેજા  
ગયા, ઉસ્તાજ ને ઉસે બિસ્મિલ્હાઅ પઢાઈ, મુઝે હયા આઈ કે મૈં  
જમીન કે અન્દર ઉસ શાખસ કો અજાબ દું જિસ કા બચ્ચા જમીન પર  
મેરા નામ લે રહા હૈ.”

(التفسير الكبير، الباب الحادى عشر، ج ١، ص ١٥٥)

ઈલમે દીન સિખાને કા એક જરીઆ દા'વતે  
ઈસ્લામી કે મદારિસુલ મદીના ઔર જામિઆતુલ મદીના ભી હૈં  
જહાં પર હજારહા ત-લબા વ તાલિબાત અલગ અલગ ઈલમે દીન  
હાસિલ કરતે હૈં.

મરી આને વાલી નસ્લેં તેરે ઈશ્ક હી મેં મચ્યલેં

ઉન્હેં નેક તૂ બનાના મ-દની મદીને વાલે

صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

### (30) મુશલ્માન કે દિલ મેં ખુશી દાખિલ કરને કા શવાબ

નાભિયે રહમત, શરૂઆતે ઉમ્મત, કાસિમે ને'મતા  
ને ઈશ્વરીફ ફરમાયા : “જો શાખસ કિસી મોભિન કે  
દિલ મેં ખુશી દાખિલ કરતા હૈ અલ્લાહ ઉસ ખુશી સે એક  
ફિરિશ્તા પૈદા ફરમાતા હૈ જો અલ્લાહ કી ઈબાદત ઔર જિક  
મેં મસરૂફ રહતા હૈ. જે વોહ બન્ધા અપની કષ્ટ મેં ચલા જતા હૈ  
તો વોહ ફિરિશ્તા ઉસ કે પાસ આ કર પૂછતા હૈ : “કયા તૂ મુઝે નહીં

પહ્યાનતા ?” વોહ કહતા હૈ કે “તુ કૌન હૈ ?” તો વોહ ફિરિશ્તા કહતા હૈ કે “મૈં વોહ ખુશી હું જિસે તૂને ફુલાં કે દિલ મેં દાખિલ કિયા થા, આજ મેં તેરી વહ્દશત મેં તુઝે ઉન્સ પહોંચાઉંગા ઔર સુવાલાત કે જવાબાત મેં સાબિત કદમ રખુંગા ઔર તુઝે રોજે કિયામત કે મનાક્રિક દિખાઉંગા ઔર તેરે લિયે તેરે રબ ગુરૂજલ કી બારગાહ મેં સિફારિશ કરુંગા ઔર તુઝે જન્ત મેં તેરા ઠિકાના દિખાઉંગા.”

(الترغيب والترهيب، كتاب البر والصلة، باب الترغيب في قضاء حوائج المسلمين، الحديث، ٢٣، ج ٣، ص ٢٦٦)

**سُبْحَنَ اللَّهِ عَزَّ وَجَلَّ** ! કિસી કે દિલ મેં ખુશી દાખિલ કરના કિતના આસાન મગાર ઈસ કા ઈન્દ્રામ કિતના શાનદાર હૈ, મગાર યેહ ફરીલત ઉસી વકત હાસિલ હો સકેગી જબ વોહ ખુશી ઐન શરીઅત કે મુતાબિક હો ચુનાન્યે અગર ઔરત ને શોહર કો ખુશ કરને કે લિયે બે પર્દી કી યા બેટે ને બાપ કો ખુશ કરને કે લિયે દાઢી મુંડા દી યા એક મુઢી સે ઘટા દી તો વોહ ઈસ ફરીલત કા હરગિઝ હકદાર નહીં હોગા બલ્કે મુખ્યલાયે અજાબે નાર હોગા. હમ અહ્લાન્ કે ગાંબ સે પનાહ માંગતે હોં ઔર ઉસ સે રહમત કા સુવાલ કરતે હોં.

## કિસી કે દિલ મેં ખુશી દાખિલ કરને કે ચન્દ કામ

- ✿ કિસી ઘાસે કો પાની પિલા દેના ✿ કિસી ભૂકે કો ખાના જિલા દેના ✿ કોઈ દુઆ કે લિયે કહે તો ફૌરન ઉસ કે લિયે દુઆ કર દેના ✿ ઝરૂરત મન્દ કી મદદ કરના ✿ હાજત મન્દ કો કર્જ દેના ✿ તંગદસ્ત મકરૂજ કો કર્જ અદા કરને મેં મોહલત દેના ✿ ગરીબ મરીઝ કી ઈયાદત કો જાના ✿ મુસ્કરા કર બાત કરના ✿ કોઈ

ગ-લતી કર બેઠે તો ઉસ સે દર ગુરુર કરના \* પસન્દીદા ચીજ બિલાના

\* અહમ મવાકેએ પર તોહર્ફા દેના \* વાલિદૈન કી બિદમત કરના

\* મજલૂમ કી મદદ કરના \* દૌરાને સફર બૈઠને કે લિયે જગહ દે દેના.

રહેં ભલાઈ કી રાહોં મેં ગામજન હર દમ

કરેં ન રખ મેરે પાઉં ગુનાહ કા યા રખ

صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

અગાબે કબી થે મહફૂજ રહ્ને વાલે ખુશા ગશીબ

## (1) શાહીદ અગાબે કબ સે મહફૂજ રહતા હૈ

رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ بَعْدَ-بَعْدَ

સે રિવાયત હૈ કે “શહનશાહે ખુશ બિસાલ, પૈકરે હુસ્નો જમાલ  
[www.dawateislami.net](http://www.dawateislami.net)  
 سَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَاللَّهُ وَسَلَّمَ  
 શરીફ અલ્લાહ શરીફ જીવાન કો  
 ઈ ઈન્નામ અતા ફરમાતા હૈ : (1) ઉસ કે ખૂન કા પહલા કતરા  
 ગિરતે હી ઉસ કી મળિફરત ફરમા દેતા હૈ ઔર જન્મત મેં ઉસે ઉસ કા  
 ઠિકાના દિખા દેતા હૈ (2) ઉસે અગાબે કબ્રા સે મહફૂજ ફરમાતા હૈ  
 (3) કિયામત કે દિન ઉસે બડી ઘબરાહટ સે અમ્ન અતા ફરમાએગા  
 (4) ઉસ કે સર પર વકાર કા તાજ રખેગા જિસ કા યાકૂત હુન્યા ઔર  
 ઈસ કી હર ચીજ સે બેહતર હોગા (5) ઉસ કા હૂરોં મેં સે 72 હૂરોં કે  
 સાથ નિકાહ કરાએગા (6) ઉસ કી સતત રિશ્ટેદારોં કે હક મેં શક્ષાયત  
 કબૂલ ફરમાએગા.”

(ابن ماجه، كتاب الجهاد، باب فضل الشهادة في سبيل الله، الحديث ٢٧٩٩، ج ٣، ص ٣٦٠)

## (2) પેટ કે મરજ મેં મરને વાલા

صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَاللهُوَأَكْبَرُ سَلَّمَ نَهَا  
ફરમાયા કે જિસે ઉસ કે પેટ ને મારા (યા'ની જિસે પેટ કી તકલીફ કી  
વજહ સે મૌત આઈ) તો (ઉસે અગાબે કબ્ર ન હોગા).

(جامع الترمذى، كتاب الجنائز، باب ماجاء في الشهداء من هم، الحديث ١٠٦٦، ج ٢، ص ٣٣٤)

મુફસ્સિસરે શહીર હકીમુલ ઉભ્મત હજરતે મુફતી અહમદ યાર  
ખાન ફરમાતે હૈને : પેટ કી બીમારી સે મરને વાલા અગાબે  
કબ્ર સે મહફૂજ હૈ ક્યૂંકે ઈસે દુન્યા મેં ઈસ મરજ કી વજહ સે બહુત  
તકલીફ પહોંચ ચુકી હૈ, યેહ તકલીફ કબ્ર કા દફૂદાયા બન ગઈ.

(મિરાતુલ મનાજીહ, જિ. 2, સ. 425, 426)

## (3) જુમુઆ કે દિન ઝોત હોને વાલા

صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَاللهُوَأَكْبَرُ سَلَّمَ  
ને ફરમાયા : “જો મુસલ્માન જુમુઆ કે દિન યા જુમુઆ કી રાત ઝોત  
હો જાએ તો અલ્લાહ ઉંગ રખતા હૈ.”

(جامع الترمذى، كتاب الجنائز، باب فيمن مات يوم الجمعة، الحديث ١٠٧٦، ج ٢، ص ٣٣٩)

મુફસ્સિસરે શહીર હકીમુલ ઉભ્મત હજરતે મુફતી અહમદ યાર  
ખાન ફરમાતે હૈને : યા'ની જુમુઆ કી શબ યા જુમુઆ કે  
દિન મરને વાલે મોમિન સે ન હિસાબે કબ્ર હો ન અગાબે કબ્ર ક્યૂંકે  
ઈસ દિન કી મૌત શહાદત કી મૌત હૈ ઔર શહીદ હિસાબ વ અગાબે  
સે મહફૂજ હૈ જૈસા કે દીગર રિવાયાત મેં હૈ હમ પહોંચે બતા ચુકે હૈને કે

## ਕਿਸੇ ਮੌਜੂਦਾ ਵਾਲਾ ਬੀਬੀ

આઠ શાખ્સોં સે હિસાબે કષ્ટ નહીં હોતા જિન મેં સે એક યેહ ભી હૈ.

(મિરઆતુલ મનાજીહ, જિ. 2, સ. 328, 329)

صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

#### (4) કથા મેં વન્દશત ન હોયાની

صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ شَفَاعَةً لِلْمُؤْمِنِينَ، أَنْ يُسْعِلَهُمْ بِغَارِبِيَّتِهِنَّ  
نے فرمایا : جیس نے دین میں سو بھرتبا ”لَا إِلَهَ إِلَّا اللَّهُ الْحَمْدُ لِلَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ“  
پਥਾ ਤੋ ਵੋਹ ਫਕਰ ਸੇ ਮਹਿਸੂਸ ਰਹੇਗਾ, ਉਸੇ ਕਥ੍ਰ ਮੈਂ ਵਖ਼ੁਸ਼ਤ ਨ ਹੋਣੀ  
ਔਰ ਜਨਤ ਕੇ ਦਰਵਾਜ਼ੇ ਉਸ ਕੇ ਲਿਧੇ ਖੁਲ ਜਾਓਂਗੇ.

(كتنز العمال، الحديث ٣٨٩٣، ج ٢، ص ١٠٣)

صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

ਤਕ ਮੌਜੂਦਾ ਅਗਰੀ ਪਾਣੇ ਵਾਲੋਂ ਕੀ ਹਿਤਾਖਾਡਾ

(1) કલિમાંથે શાહાદત કી તરફીક કરુને વાલે કી બાણિજા હો ગઈ

એક બસરી બુજુર્ગ રَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ مَسْكُونٌ مُّحَمَّدٌ أَرْسَلُ اللَّهُ مાટે કા ભતીજા ગલત સોહબત મેં પડ ગયા ઔર તવાઈફોં કે પાસ આને જાને લગા. વોહ જબ ભી અપને ભતીજે કો નસીહત કરતે વોહ સુની અનસુની કર દેતા. બા'દે ઈન્નિકાલ જબ ઉસ લડકે કો કષ્ટ મેં ઉતાર દિયા ગયા તો લોગોં કો કુછ શુખા હુવા, ચુનાન્યે એક ઈટ હટા કર અન્દર દેખા ગયા તો મા'લુમ હુવા કે ઉસ કી કષ્ટ બસરા કે ધુર્ઢોડ કે મૈદાન સે ભી વસીએ હૈ ઔર વોહ દરમિયાન મેં ખડા હૈ. ઈટ કો ઉસી જગહ વાપસ લગા દિયા ગયા ઔર ઘર આ કર જબ ઉસ કી બીવી સે ઉસ કે આ'માલ કે બારે મેં દરયાફત કિયા ગયા તો ઉસ ને કહા કે યેહ જબ મુઅઞ્જીન કો યેહ કહ્યે કહ્યે સુનતા : “شَهِدْ أَنَّ لِلَّهِ أَكْلَهُ وَشَهِدَ أَنَّ مُحَمَّدًا رَسُولُ اللَّهِ”

(يَا'نِي مैं गवाही देता हूँ के अल्लाह के सिवा कोई मा'बूद नहीं, और मैं गवाही देता हूँ के मुहम्मद (صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ) अल्लाह की रसूल हूँ) तो कहा करता : “ يَا'نِي جिस की तू गवाही देता है उसी की गवाही मैं भी देता हूँ.” और दूसरों से भी कहता था के ये ही कहो۔ (الموسوعة لابن أبي الدنيا، الحديث ٣١٩، ج ٥، ص ٥٠٠)

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! જિસ તરહ હર બુરાઈ સે બચના  
જરૂરી હૈ ઈસી તરહ છોટી સે છોટી નેકી છોડની નહીં ચાહિયે કયા  
મા'લૂમ કે વોહ નેકી જો બ જાહિર બહુત આસાન નજર આતી હૈ  
હમારી બખ્શિશ કા વસીલા બન જાએ. ઈસ હિકાયત સે કિસી કો  
યેહ ગલત ફહી ન હો જાએ કે معاذَاللَهُ عَزَّوَجَلَّ ખૂબ જ ભર કે ગુનાહ  
કરતે રહેંગે, થોડી બહુત નેકિયાં કર લિયા કરેંગે કોઈ ન કોઈ નેકી  
બખ્શિશ કા સબબ બન હી જાએગી, ઐસા સોચના નાદાની હૈ ક્યુંકે  
**આલ્હાન** તાઓ બે નિયાઝ હૈ વોહ ચાહે તો નેકિયોં કે પહાડ ખેડે  
કરને વાલે કો સિફી એક ગુનાહ કી વજહ સે જહન્નમ મેં ભેજ દે ઔર  
અગર ચાહે તો ગુનાહોં કે દફ્તર ભરે હોને કે બા વુજૂદ કિસી કો  
મહૂઝ એક નેકી કી વજહ સે બખ્શ દે, બહર હાલ યેહ સબ ઉસ કી  
મરજી પર મૌકૂફ હૈ, હુમેં ખૂબ ખૂબ નેકિયાં કરને ઔર ગુનાહોં સે  
બચને કી સાર્ય કરની ચાહિયે. નીજ ઈસ હિકાયત સે જિમ્બન  
અજાન કા જવાબ દેને કા ફાયેદા ભી મા'લૂમ હુવા, જવાબે અજાન  
કી અહાદીસે મુખા-રકા મેં બડી ફરજીલત આઈ હૈ ચુનાન્યે દા'વતે  
ઈસ્લામી કે ઈશાઅતી ઈદારે મક-ત-બતુલ મદીના કે મત્બૂઆ રિસાલે  
“કેઝાને અજાન” મેં હૈ :

## ਅਮਾਨ ਕੇ ਜਵਾਬ ਕੀ ਫੁਰਿਲਤ

મદ્દિને કે તાજદાર ને ચુંણી લોહીએ હોય અને એક બાર ફરમાયા :  
એ ઔરતો ! જબ તુમ બિલાલ કો અગ્રાન વ ઈકામત કહતે સુનો તો  
જિસ તરણ વોહ કહતા હૈ તુમ ભી કહો કે અલ્લાહ તુમ્હારે  
લિયે હર કલિમે કે બદલે એક લાખ નેકિયાં લિખેગા ઔર એક હજાર  
દ-રજાત બુલન્દ ફરમાઓગા ઔર એક હજાર ગુનાહ મિટાઓગા.  
ખવાતીન ને યેહ સુન કર અર્જ કી, યેહ તો ઔરતોં કે લિયે હૈ મર્દોં કે  
લિયે ક્યા હૈ ? ફરમાયા : મર્દોં કે લિયે દુગના.

(تاریخ دمشق لابن عساکر ج ۵۵ ص ۷۵)

3 કરોડ 24 લાખ નેક્ટિયાં કમાઈયે

મીઠે મીઠે ઈસ્લામી ભાઈયો ! અલ્લાહ હું ગુરૂજી કી રહેત પર  
કુરબાન ! ઉસ ને હમારે લિયે નેકિયાં કમાના, અપને દ-રજાત બઠવાના  
ઔર ગુનાહ બખ્શવાના કિસ કદર આસાન ફરમા દિયા હૈ મગર  
અફસોસ ! ઈતની આસાનિયોं કે બા વુજૂદ ભી હમ ગર્ભિત કા  
શિકાર રહેતે હું. પેશ કર્દા હદ્દીસે મુખારક મેં જવાબે અજાન કી જો  
ફીલિત બધાન હુંદ્ય હૈ ઉસ કી તફસીલ મુલા-હજ્ઞા ફરમાઈયે :

”اللهُ أَكْبَرَ“ یہہ دو کلیمات ہنے ہیس ترہ پوری  
اجان میں 15 کلیمات ہنے۔ اگر کوئی ہس्तاً بھن اک اجان  
کا جواب دے یا’ نی معاڑیجن جو کھتا جائے ہسْتاً بھن بھی  
دوہرائی جائے تو اس کو 15 لाख نکلیں گی۔ 15 ہزار ۶-۲ جات  
بُولنڈ ہوں گے اور 15 ہزار گوناہ معاڑ ہوں گے۔ اور ہسْتاً بھن  
بھائیوں کے لیے یہہ سب ہو گانا ہے۔ فوج کی اجان میں دو مرتبا

الصَّلُوةُ خَيْرٌ مِّنَ النَّوْمِ

है तो फैज की अज्ञान में 17 कलिमात हो गए और यूं फैज की अज्ञान के जवाब में 17 लाख नेकियां, 17 हजार ८-रजात की बुलन्दी और 17 हजार गुनाहों की मुआझी भिली और ईस्लामी भाईयों के लिये हुगना. ईकामत में दो भरतबा **قدْ قَامَتِ الصَّلُوةُ** भी है यूं ईकामत में भी 17 कलिमात हुए तो ईकामत के जवाब का सवाब भी फैज की अज्ञान के जवाब जितना हुवा. अल छासिल अगर कोई ईस्लामी बहन ऐहतिमाम के साथ रोजाना पांचों नमाजों की अज्ञानों और पांचों ईकामतों का जवाब देने में काम्याब हो जाए तो उसे रोजाना एक करोड़ बासठ लाख नेकियां भिलेंगी, एक लाख बासठ हजार ८-रजात बुलन्द होंगे और एक लाख बासठ हजार गुनाह मुआझ होंगे और ईस्लामी भाई को हुगना या'नी ३ करोड़ २४ लाख नेकियां भिलेंगी, ३ लाख २४ हजार ८-रजात बुलन्द होंगे और ३ लाख २४ हजार गुनाह मुआझ होंगे.

## अज्ञान व ईकामत के जवाब का तरीका

મુઅজ્રિઝન સાહિબ કો ચાહિયે કે અજ्ञान કે કલિમાત ઠહર ઠહર કર કર્યેં. આંદ્રી કુરીલીલી દોનોં ભિલ કર (બિગેર સકતા કિયે એક સાથ પઢને કે એંતિબાર સે) એક કલિમા हैं દોનોં કે બા'દ સકતા કરે (યા'ની ચુપ હो जाए) ઔर સકતે કી મિકદાર યેહ હै કે જવाब દेनે વાલા જવાબ દે લે, સકતે કા તર્ક મકરૂહ હૈ ઔર ઐસી અજ्ञान કા ઈઆદા મુસ્તહબ હૈ. (ذِيْمَخْتَار وَرَدَالْحَتَار ج ٢ ص ٦٦)

જવાબ દેને વાલે કો ચાહિયે કે જબ મુઅজ્રિઝન સાહિબ આંદ્રી કુરીલીલી કહ કર સકતા કરેં યા'ની

ଶ୍ରୀ ମାତ୍ରାନ୍ତିକ ପାଦାନ୍ତର ପାଦାନ୍ତର

આમોશ હોય ઉસ વકત કાબ્ર કહે. એસી તરફ દીગર કલિમાત કા જવાબ હૈ. જब મુખ્યાજ્રીઝન પહોલી બાર કહેં કે **أَشْهُدُ أَنَّ مُحَمَّداً رَسُولَ اللَّهِ** તરફથી આપ પર દુર્દાદ હો યા યે હું કહે કે **صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ** : આપ પર દુર્દાદ હો યા રસલહ્લા (صلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَسَلَّمَ) હું નામૃતાર (૮૪.૧૨)

જબ દોબારા કહે, યેહ કહે :

قُرْٰشٌ عَيْنِيْ بِكَ يَا رَسُولَ اللّٰهِ  
या रसूलल्लाह ! आप से मेरी आंखों  
की छन्दक है

और हर बार अंगूठों के नाखुन आंखों से लगा ले, आधिर में कहे :  
**أَللّٰهُمَّ مَتَّعْنِي بِالسَّبِيعِ وَالْبَصَرِ**  
 ! मेरी सुनने और  
 देखने की कृप्यत से मुझे नहीं अता  
 इरमा.  
 (आया)

જો ઐસા કરે સરકારે મદ્દીના (ઉસે અપને  
પીછે પીછે જગત મેં લે જાયેંગો. (أَنْسَاً)

(دُرِّيْخَاتَ وَرَدَّاً الْمُحْتَارِج٢ ص٨٢، عَالْمِيْغَرِي ج١ ص٥٧) :

**صَدْقَتْ وَبِرْزَتْ وَبِالْحَقِّ نَكْتَبْ** تરજમا : तू सच्चा और नेहकार है और तूने हक किया है.

ઈકामत का जवाब मुस्तहब है। इस का जवाब भी ईसी तरह है फिर ईतना है कि قرآن میں جवाब में कहे :

تاریخ ما : اکٹلہاں عزوجل اس کو آدمیان کا دم رہے جب تک آسمان اور السیوت والارض جمین ہے۔

(બહારે શરીઅત, જી. 1, સ. 473, ૦૭ માટે) (નમાંજ કે અષ્કામ, સ. 4 તા 9)

## (2) શૂરથે કહુફ કી તિલાવત કી બ-ર-કત

سے کوئی دین بولنے والان کا بیان ہے کہ میں نے کبھی سٹاٹ میں اک  
شہر کو دेखا کہ وہ اک اک کਬھی کے پاس رہتے ہوئے تیلواویت کر رہا ہے  
اور ہمارا ام بانگ رہا ہے، میرے پڑھنے پر وہ نے بتایا : یہ میرے  
دوست کی کبھی ہے، اس نے تیلواویت کرتے ہوئے میری نیگاہوں کے سامنے<sup>www.dawateislami.net</sup>  
دھم توڑا، تادھن کے بآ'د میں نے اسے جواب میں دेखا تو ہال  
درخواست کیا، اس نے بتایا، جب تum لوگ مुझے کبھی میں رجھ کر  
چلے گا تو اک جذب ناک کھاتا میری ترک بٹا، کریب ٹھا کے وہ  
مuj پر ہملا کر دلتا مجھر اک ہنجھا ایڈ بُوب سُورت و پاکیزا  
بُوچو گوں وہاں تشریف لے آگے اور کوئے کو وہاں سے بگا دیتا اور  
میرے پاس بیٹھ گا، ان کی سوچ بات سے مuj بھوت سُکھن میلنا، میں  
نے ان سے پڑھا : آپ کیون ہے ؟ فرمایا : تum جو میں کے دین  
سُوراے کھڑک پٹا کرتے ہے میں اسی کا سوچا ہوں.

(الدرالكامنة في اعيان المائة لابن حجر عسقلاني ج ٥ ص ٣٥٢)

### (3) کعب میں لایا گئی

ہائیکورٹ ابھول علیا ہمدانی علیہ رحمۃ اللہ الْغَفِیٰ کو علیہ رحمۃ اللہ الْغَفِیٰ کو علیہ رحمۃ اللہ الْغَفِیٰ کے بآ'د کیسی نے اُسے شاہرے ہلب میں دھبا کے جس کے درو ہیواڑ سبھ کیتابوں کے بنے ہوئے ہے۔ علی سے ہلکا کا سبھ پوچھا گیا تو بتایا کہ میں نے **اعلیاً** عزوجل سے ہو آ کی ہی کے جس تراہ میں ہونا میں ہلب میں مسڑک ہوئے ہلکا تراہ آجیت میں بھی مسڑک رہے۔ لیکن یہاں پر بھی مुझے یہی مسڑکیت نہیں ہوئی ہے۔

(شرح الصدور ص ۱۹۰)

### (4) شوہن کے ہیوان کی نجات

شوبھ تریکت ابھی رے آہلے سوچتے اپنے ریساۓ ”مُوْهَنْ کے سادمے“ سکھا 38 پر لیختے ہیں : ”اوک شاپس کو ہلکا کال کے بآ'د جواب میں دھب کر پوچھا گیا : ما فَعَلَ اللَّهُ بِكَ : اعلیا عزوجل نے آپ کے ساتھ کیا مुआ-ملما فرمایا ؟ جواب دیا : **اعلیا** عزوجل نے میری بھیت فرمایا ہی۔ پوچھا : مونکر نکیر کے ساتھ کسی گوچری ؟ جواب دیا : **اعلیا** عزوجل کے کرم سے میں نے علی سے ارج کی، ہمارتے ابھو بک سیدیک و علیم رکھ کر آجھ سے کھا : ہلکا نے بھوت ہی بھروسہ ہستیوں کا وسیلہ پےشا کیا ہے لیکن یہاں ہلکا کو چوڑ دیا۔ یعنانے وہ مुझے چوڑ کر تشریف دے گا۔

(مُلَخَّصًا من شرح الصُّدُور، باب فتنة القبر الخ، ص ۱۴۱)

### (5) اولیا کے نام لےوا کی نجات

اوک نک شاپس جو ہمارتے سایہ ہننا ابھو یاری د کے ہیوانے اور آپ کے گاشیا برداڑ یا نی فرمائیں برداڑ بھادیم

थे, उन की वक्षात हो गई, तदक्षिण के बा'द कथ्र शरीर के पास मौजूद बा'अ अफराद ने सुना वोह मुन्कर नकीर से कह रहे थे : “मुझ से क्यूं सुवालात करते हो मैं तो अबू यज्जीद के गाशिया भरदारों में से हूँ.” युनान्ये मुन्कर नकीर उन्हें छोड कर तशरीक ले गये.

(ملخصاً من شرح الصدور، باب فتنة القبر الخ، ص ١٤٢)

ਦਾ'ਵਤੇ ਈਸ਼ਵਾਸੀ ਕੇ ਸੁਨਨਾਂ ਕੀ ਤਰਾਖਿਅਤ ਕੇ ਲਿਏ ਮ-ਦਨੀ  
 ਕਾਫ਼ਿਲਾਂ ਮੌਜੂਦ ਸੁਣਾਂ ਕੀ ਤਰਾਖਿਅਤ ਕੇ ਲਿਏ ਮ-ਦਨੀ ਈਸ਼ਵਾਸੀ ਕੇ ਲਿਏ ਮ-ਦਨੀ  
 ਕਾ ਰਿਸਾਵਾ ਪੁਰ ਕਰ ਕੇ ਹੁਣ ਮਾਣ ਅਪਨੇ ਧਾਰਾਂ ਕੇ ਜੈਲੀ ਨਿਗਰਾਨ ਕੋ  
 ਜਮਾਂ ਕਰਵਾਨੇ ਕਾ ਮਾ'ਮੂਲ ਬਨਾ ਲੀਂਗਿਆ। ਈਸ ਕੀ ਬ-2-ਕਤ  
 ਸੇ ਈਮਾਨ ਕੀ ਛਿਫ਼ਾਤ ਔਰ ਸੁਨਨਾਂ ਪਰ ਅਮਲ ਕਾ ਝੋਣ ਬਨੇਗਾ।  
 ਨੀਂ ਅਤਾਬੇ ਕਥ ਸੇ ਨਜ਼ਾਰਾ ਕਾ ਸਾਮਾਨ ਹੋਗਾ।” (ਮੁਦਦ ਕੇ ਸਦਮੇ, ਸ. 93)

(6) બેશક મુગે દો જનતેં અતા કી એઈ

ઉસે અલ્લાહ તથાલા કા યેહ ફરમાને આલીશાન યાદ આ ગયા :

إِنَّ الْبَرِّيْنَ اتَّقُوا إِذَا مَسَّهُمْ طَفْ

مِنَ الشَّيْطَنِ تَزَكَّرُ وَأَفَدَاهُمْ

مُبْصِرُونَ

(٢٠١) ﴿الاعراف﴾

તર-૪-માઝે કન્જુલ ઈમાન : બેશક

વોહ જો ડર વાલે હોં જબ ઉન્હેં કિસી  
શૈતાની ખયાલ કી ઠેસ લગતી હે  
હોશિયાર હો જાતે હોં ઉસી વકત ઉન  
કી આંખેં ખુલ જાતી હોં.

ઈસ આયતે પાક કે યાદ આતે હી ઉસ કે દિલ પર અલ્લાહ  
તથાલા કા ખૌફું ઈસ કદર ગાલિબ હુવા કે વોહ બેહોશ હો કર  
અમીન પર ગિર ગયા. જબ યેહ બહુત દેર તક ઘર ન પહોંચા તો ઉસ  
કા બૂઢા બાપ ઉસે તલાશ કરતા હુવા વહાં પહોંચા ઔર લોગોં કી  
મદદ સે ઉસે ઉઠવા કર ઘર લે આયા. હોશ આને પર બાપ ને તમામ  
વાકિઓ દરયાઝત કિયા, નૌ જવાન ને પૂરા વાકિઓ બયાન કર કે  
જબ ઈસ આયતે પાક કા જિક કિયા તો એક ભરતબા ફિર ઉસ પર  
અલ્લાહ તથાલા કા શાદીએ ખૌફું ગાલિબ હુવા, ઉસ ને એક ઝોરદાર  
ચીખ મારી ઔર ઉસ કા દમ નિકલ ગયા. રાતોં રાત હી ઉસ કે ગુરુલ  
વ કફન વ દફન કા ઈન્તિજામ કર દિયા ગયા. સુષ્ણ જબ યેહ  
વાકિઓ હજરતે સચ્ચિદુના ઉમર ફારૂક رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ કી ખિદમત મેં  
પેશ કિયા ગયા તો આપ ઉસ કે બાપ કે પાસ તા'જિયત કે લિયે  
તશરીફ લે ગયે. આપ ને ઉસ સે ફરમાયા કે “હમેં રાત કો હી  
ઈતિહાસ ક્યું નહીં દી, હમ ભી જનાજે મેં શરીક હો જાતે ?” ઉસ ને  
અર્જ કી, “અમીરુલ મુઅમ્બિનીન ! આપ કે આરામ કા ખયાલ કરતે  
હુએ મુનાસિબ મા'લૂમ ન હુવા.” આપ ને ફરમાયા કે “મુજે ઉસ કી  
કથી પર લે ચલો.” વહાં પહોંચ કર આપ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ ને યેહ આયતે  
મુખા-રકા પઢી :

وَلِئِنْ خَافَ مَقَامَ رَبِّهِ جَتَّنِ

(٤٦، الرحمن: ٢٧)

તર-જ-મએ કન્ગુલ ઈમાન : ઔર જો અપને રબ કે હુંજૂર ખડે હોને સે ઉરે ઉસ કે લિયે દો જન્નતે હું.

તો કબ્ર મેં સે ઉસ નૌ જવાન ને બુલન્દ આવાજ કે સાથ પુકાર કર કહા : “યા અમીરલ મુઅમિનીન ! બેશક મેરે રબ ને ગુજે દો જન્નતે અતા ફરમાઈ હું.”

(શ્રદ્ધાચંદ્ર, ૧૧૩)

### (7) દ-રજાત મેં ફક્ત

એક બુજુર્ગ ફરમાતે હું કે મૈં ને ખુદા તાલા સે દુઆ કી કે વોહ મુજે અહલે કુબૂર કે મકામાત દિખા દે. એક રોજ ક્યા દેખતા હું કે કબ્રેં ફટ ગઈ. અબ ઉન મેં સે કુછ મુર્દું તો “રેશમ” પર સો રહે હું ઔર કુછ “દીબાજ” પર, કુછ “ફૂલોં કી સેજ” પર ઔર કુછ “તખ્તોં” પર, કુછ હંસ રહે હું તો કુછ રો રહે હું. યેહ દેખ કર મૈં ને અર્જ કી : યા અલ્લાહ ગુરૂજ અગર તૂ ચાહતા તો ઈન સબ કો એક હી મકામ અતા ફરમા દેતા ! તો કબ્ર વાલોં હી મેં સે કિસી ને પુકારા કે ઐ કુલાં ! યેહ કબ્રેં આ’માલ કી મનાજિલ હું, જો “સુન્હુસ નશીન” હું વોહ ખુશ ખુલ્ક થે, જો “હરીર વ દીબાજ નશીન” હું વોહ શુ-હદા હું, જો “ફૂલોં કી સેજ” પર સોને વાલે હું વોહ રોજાદાર હું ઔર “તખ્ત વાલે” અલ્લાહ ગુરૂજ કે લિયે આપસ મેં મહિષત કરને વાલે હું, જબકે રોને વાલે ગુનહગાર ઔર હંસને વાલે તૌબા શિઆર હું.

(શ્રદ્ધાચંદ્ર, ૧૮૭)

### (8) મુફ્તિયે દા’વતે ઈલામી કી જળ કબી ખુલ્લી

શૈખે તરીકત, અમીરે અહલે સુન્નત અપની કિતાબ “ગીબત કી તબાહ કારિયાં” સફા 466 પર લિખતે હું :

તજ્જીવો કુરાનો સુન્નત કી આલમગીર ગૈર સિયાસી તહરીક, દા'વતે ઈસ્લામી કી "મર્ક્ઝી મજલિસ શુરા" કે રૂકન મુફ્તિયે દા'વતે ઈસ્લામી અલહાજ અલ હાફિઝ અલ કારી હજરતે અહ્લામા મૌલાના મુફ્તી મુહમ્મદ ફારૂક અલ અતારિથ્યુલ મ-દની عَلَيْهِ رَحْمَةُ اللَّهِ الْأَكْبَرُ કે બારે મેં મેરા હુસ્ને જન હૈ કે વોહ દા'વતે ઈસ્લામી કે મુજલિસ મુખ્યિલિગ ઔર અહ્લાજ ગુરૂરૂજાલ સે ડરને વાલે બુજુર્ગ થે ઔર ગોયા ઈસ હદ્દીસે પાક કે મિસ્ટાક થે : "كُنْ فِي الدُّنْيَا كَائِنٌ كَغْرِيُّبٍ" (كُنْ فِي الدُّنْيَا كَائِنٌ كَغْرِيُّبٍ) "ચુન્યા મેં ઈસ તરફ રહો કે ગોયા તુમ મુસાફિર હો." (૬૧૬ ચ ૨૨૩ હદિથ)

18 મુહર્રમુલ હરામ 1427 હિ. બ મુતાબિક 17-2-2006 બરોડ જુમુઆ નમાજે જુમુઆ કી અદાઈગી કે બા'દ અપની કિયામ ગાહ (વાકેઅ ગુલશને ઈકબાલ, બાબુલ મદીના કરાચી) મેં અચાનક હ-ર-કતે કલ્બ બન્દ હોને કે સબબ બ ઉમ્ર તકરીબન 30 બરસ જવાની કે આલમ મેં ઈન્ટિકાલ ફરમા ગયે થે. આપ રَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ رَحْمَةُ اللَّهِ تَعَالَى કો સહરાએ મદીના, બાબુલ મદીના કરાચી મેં દફન કિયા ગયા. વિસાલ શરીફ કે તકરીબન 3 સાલ 7 મહીને 10 દિન બા'દ યા'ની 25 ર-જબુલ મુરજજબ સિ. 1430 હિ. બ મુતાબિક 18-7-2009 હફ્તા ઔર ઈતવાર કી દરમિયાની રાત બાબુલ મદીના કરાચી મેં કદ્ય ઘન્ટે તક મૂસલા ધાર બરસાત હુઈ જિસ કી વજહ સે મુફ્તિયે દા'વતે ઈસ્લામી હાફિઝ મુહમ્મદ ફારૂક અતારી કી કબ્ર દરમિયાન સે ખુલ ગઈ. જો ઈસ્લામી ભાઈ સહરાએ મદીના મેં હિફાજતી ઉમ્ર પર મુ-તઅયન હું ઉન્હોંને સુખ કે વકત દેખા કે કબ્ર સે સબજ રંગ કી રોશાની નિકલ રહી હૈ. આરિઝી તૌર પર કબ્ર દુર્લસ્ત કરને વાલે ઈસ્લામી ભાઈઓં કા હલફિયા (યા'ની કસમ ખા કર) કુછ યું બયાન હૈ કે હમ ને દેખા કે તદફીન કે

تکریبیں ساہے تین سالاں بآ'د بھی مुکْریت یہ دا'�تے ہی سلسلہ می قدر میں سُلَّمَةُ النَّاسِیٰ  
 کی مुبَاڑک لاش اور کفین ہی س ترہ سلسلہ ماتھے کے گوئیا ابھی ابھی  
 ہی نیکال ہو گا ہو، تکریبیں کے وکٹ سار پر رخا جانے والیا سچے  
 سچے ہی ماما شریف آپ کے سارے مुبَاڑک پر اپنے جلوے لٹرا رہا  
 ہا، ہی ماما شریف کی سیधی جانیب کان کے نجی دیک آپ  
 کی گوکھوں کا کوچ ہیسسا اپنی بھائیوں دی�ا رہا ہا، پےشانی  
 نو رانی ہی اور یہ رکھے مुبَاڑک بھی کیبلہ رکھ ہا۔ مُکْریت یہ  
 دا'�تے ہی سلسلہ می کبھی مुبَاڑک سے بُرُشُبُرُ کی اسی لپڑے آ رہی  
 ہی کے ہمارے مسماں میں مُعَذَّر ہو گا۔ کبھی میں باریش کا پانی  
 عتلہ جانے کی وجہ سے یہ ہی مکان ہا کے کبھی مچی دھنس جائے اور  
 سیلے مہریم کے وُرُجُونِ مسیہ دھوکے سدما پھونچا ایں لیڈا جا ہی س وادیوں  
 کے تکریبیں دس روڑ بآ'د یا'نی شنبے بُرُح 6 شا'بُانُلِ مُعَذَّرِیم  
 1430 ہی۔ (28-7-2009) ب شعیور مُکْریت یہانے کیرام و علیہ السلام اے  
 ہی امام ہزارہ ہی سلسلہ می بآریوں کا کسیر ماجماع ہو گا، گولام  
 یادا ابتو یوسیہ ہاڑ یوسیہ رجاء ہیجنے اتنا ر م-دُنیٰ  
 سُلَّمَةُ النَّاسِیٰ  
 پھلے سے ماؤچوں شیگاڑ کے جریے کبھی کے اندر عتلہ تاریخی اے  
 اندر جا لگا ایں کے آیا مُنْتَدِلی کے لیے چیزیں مُبَاڑک بادھ ر  
 نیکالنے کی ہاڑت ہے یا اندر رہتے ہو اے بھی کبھی شریف کی  
 تا'میرے نو مُکْرین ہے۔ عنہوں نے اندر کا جائے جا لیتا اور  
 اندر ہی سے دا'�تے ہی سلسلہ می کے داراللہ ہیفتا اھلے سُنّت کے  
 مُکْریتی ساہیب کو سُرترے ہاں بیان کی عنہوں نے بُرُح مُبَاڑک  
 بادھ ر ن نیکالنے کا ہو کم فرمایا، گولام یادا ہاڑ یوسیہ  
 رجاء کو مُوکی کے مرا دیتا گیا یعنانے پورانی کبھی کے اندر یعنی  
 ماحول اور علیپر سے بیٹھی وگئیا گیرانے کے با وُرُجُونِ جل جل  
 علی ہمَدُ اللہِ عَزَّوجَلَّ  
 عنہوں نے ہی ماما شریف، پےشانی مُبَاڑک اور گوکھوں کے بآ'د ہیسے کی

કામ્યાબ મૂવી બના લી જો કે કુછ હી દેર બા'દ “સહરાએ મદીના” મેં લગાઈ ગઈ મુખ્તલિફ સ્કીનોં પર હજારોં ઈસ્લામી ભાઈયોં કો દિખા દી ગઈ, ઉસ વક્ત લોગોં કે જગ્બાત દી-દની થે, યેહ રૂહ પરવર મન્જર દેખ કર બે શુમાર ઈસ્લામી ભાઈ અશ્કબાર હો ગયે. ઈસ કે બા'દ આને વાલી રાત યા'ની બુધ ઔર જુમા'રાત કી દરમિયાની શબ 7 શા'બાનુલ મુઅઝ્જમ 1430 હિ. (29-7-2009) કો દા'વતે ઈસ્લામી કે મ-દની ચેનલ પર બરાહે રાસ્ત “ખુસૂસી મ-દની મુકા-લમા” નશર કિયા ગયા જિસ મેં દુન્યા કે મુખ્તલિફ મુમાલિક કે લાખોં નાજિરીન કો કેમરે કે અન્દર મહફૂજ કર્દી કંબ્બ કા અન્દરુની મન્જર ઔર મુશ્કિયે દા'વતે ઈસ્લામી કુદ્દિસ્સીલાસ્સાહી કી તકરીબન સાઢે તીન સાલ પુરાની સહીહ સલામત લાશ મુખારક કે ઈમામા શરીફ, પેશાની મુખારક ઔર ગેસૂ મુખારક કે કુછ બાલોં કી જિયારત કરવાઈ ગઈ. ચૂંકે યેહ ખબર હર તરફ જંગલ કી આગ કી તરફ ફેલ ચુકી થી લિહજા મુખ્તલિફ શહરોં કે જુદા જુદા અલાકોં કે ઈસ્લામી ભાઈયોં કે બયાનાત કા લુંબે લુબાબ હૈ કે ખુસૂસી મ-દની મુકા-લમે કે દૌરાન કઈ ગલિયાં ઔર બાજાર ઈસ તરફ સૂને હો ગયે થે જિસ તરફ મુસલ્માનોં કે અલાકોં મેં ર-માત્રાનુલ મુખારક મેં ઈફતાર કે વક્ત હોતે હૈ ઔર T.V. પર ઘર ઘર સે “ખુસૂસી મ-દની મુકા-લમે” કી આવાજ સુનાઈ દે રહી થી. હોટલોં, નાઈ કી દુકાનોં વગેરા મેં જહાં જહાં T.V. સેટ મૌજૂદ થે વહાં અવામ હુજૂમ દર હુજૂમ જમ્બ હો કર મ-દની ચેનલ પર મુશ્કિયે દા'વતે ઈસ્લામી કુદ્દિસ્સીલાસ્સાહી કી મ-દની બહારોં કે નાઝુરારે કર રહે થે. એક ઈતિહાસ કે મુતાબિક મ-દની ચેનલ પર “ખુસૂસી

## ਕਿਸੇ ਮੌਜੂਦਾ ਵਾਲਾ ਧੀਰੇ

જબી મૈલી નહીં હોતી દહન મૈલા નહીં હોતા

ગુલામાને મુહુમ્મદ કા કફન મૈલા નહીં હોતા

اَللّٰهُمَّ رَبِّ الْعَالَمِينَ اسْمُ اللّٰهِ تَعَالٰى عَلَيْهِ وَبِهِ وَسْلَمَ

صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

કથ મેં માયિત કે સાથ તબર્કાત રખિયો

જબ કિસી ઈસ્લામી ભાઈ યા ઈસ્લામી બહન કા ઈન્ટિકાલ હો જાએ તો તદ્દીન કે વકત કુછ ન કુછ તબરૂકત માયિત કે સાથ રખ દીજિયે, أَنَّمَا اللَّهُ عَزَّوَجَلَّ يَعْلَمُ مَا فِي الْأَرْضِ અમલ માયિત કે લિયે સુકૂન વ ઈત્ત્મીનાન ઔર નકીરેન કે સુવાલાત કે જવાબ દેને મેં મદદગાર સાબિત હોગા.

**ਹਾਰਤੇ ਰਾਖਿਆਂਦੁਨਾ ਅਮੀਰੇ ਮੁਆਵਿਥਾ** رَضِيَ اللَّهُ تَعَالَى عَنْ **ਕੀ ਵਾਣਿਆਤ**

ਹਾਜਰਤੇ ਸਥਿਅਨਾ ਅਮੀਰੇ ਮੁਆਵਿਆ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ ਨੇ ਅਪਨੇ ਇੱਨਜ਼ਿਕਾਲ ਕੇ ਵਕਤ ਵਸਿਥਤ ਫਰਮਾਈ : “ਏਕ ਦਿਨ ਹੁਝੂਰੇ ਅਕਛਸ صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِہٖ وَسَلَّمَ ਹਾਜ਼ਿਤ ਕੇ ਲਿਧੇ ਤਸ਼ਰੀਫ ਲੇ ਗਏ। ਮੈਂ ਲੋਟਾ ਲੇ ਕਰ ਹਮਰਾਏ ਰਿਕਾਬ ਸਾਂਘਾਤ ਮਾਆਬ ਹੁਵਾ। ਹੁਝੂਰੇ ਪੁਰਨੂਰ صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِہٖ وَسَلَّمَ ਨੇ ਅਪਨਾ ਪਹਨਾ ਹੁਵਾ ਏਕ ਕੁਰਤਾ ਮੁੜੇ ਬਤੌਰੇ ਇੱਨਾਮ ਅਤਾ ਫਰਮਾਯਾ, ਵੋਹ ਕੁਰਤਾ ਮੈਂ ਨੇ ਆਜ ਕੇ ਲਿਧੇ ਸੰਭਾਲ ਰਖਾ ਥਾ। ਔਰ ਏਕ ਰੋਗ ਹੁਝੂਰੇ

અન્વર ને નાખુન વ મૂંહે મુખારક તરાશે, વોહ મૈં  
ને લે કર ઈસ હિન કે લિયે સંભાલ રખે થે, જબ મૈં મર જાઉં તો કમીસે  
સરાપા તકદીસ કો મેરે કફન મેં રખના ઔર મૂંહે મુખારક વ નાખુન-હાએ  
મુકદ્દસા કો મેરે મુંહ ઔર આંખોં ઔર પેશાની વગેરા મવાજેએ સુજૂદ  
પર રખ દેના।” (الاستعياب في معرفة الأصحاب، ترجمة معاویہ بن سفیان، ج ٣، ص ٣٧٤)

## તબર્કુત રહને કા તરીકા

આ'લા હજરત, ઈમામે અહલે સુન્નત શાહ ઈમામ અહમદ  
રજા ખાન ફરમાતે હોય : “શ-જ-રાએ તથિબા (ઔર  
દીગર તબર્કુત) કબ્ર મેં તાક બના કર રખેં ખ્વાહ સિરહાને કે નકીરેન  
પાઈતી કી તરફ સે આતે હોય ઉન કે પેશો નજર હો, ખ્વાહ જાનિબે  
કિબ્લા, કે માયિત કે પેશ રૂ (યા'ની સામને) રહે ઔર ઉસ કે સુકૂન વ  
ઈત્ભીનાન વ ઈઆનતે જવાબ કા બાઈસ હો.”

(ફતાવા ૨-જવિયા, જિ. ૧, સ. ૧૩૪)

صَلُّو عَلَى الْحَبِيبِ ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

## કબી પર તલ્કીન કા તરીકા

ચલી હોય કે હુઝૂર સાચિદે આલમ ફરમાતે હોય : જબ તુમ્હારે કિસી મુસલ્માન ભાઈ કા ઈન્તિકાલ હો  
ઔર ઉસ કી કબ્ર પર મિઠી બરાબર કર ચુકો તો તુમ મૈં સે એક શખ્સ  
ઉસ કી કબ્ર કે સિરહાને ખડા હો કર કુદે હોય કે વોહ  
સુનેગા ઔર જવાબ ન દેગા. ફિર કહે : યાફ્લાન અબુફ્લાન્નું વોહ સીધા હો  
કર બૈઠ જાએગા, ફિર કહે : યાફ્લાન અબુફ્લાન્નું : વોહ કહેગા : હમેં ઈશ્વરાં  
કર, અલ્લાહ તાઓ તુઝ પર રહ્મ ફરમાએ. મગાર તુમ્હેં ઉસ કે

(المعجم الكبير للطبراني ج ٨، حديث ٧٩٧٩، ص ٢٥٠)

صَلُّوا عَلَى الْحَبِيبِ ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

www.dhadkan.net

મિઠી બરાબર કરને કે બા'દ કથ્ય પર અજાન દીજિયે મુક્ષસ્સિસરે  
શહીર હકીમુલ ઉમ્મત મુફતી અહમદ યાર ખાન ગુલિયે رَحْمَةُ الرَّحْمَن  
ફરમાતે હોય : “યેહ વક્ત ઈમ્પ્રિછાને કથ્ય કા હૈ, અજાન મેં નકીરેન કે  
સારે સુવાલાત કે જવાબાત કી તલ્કીન ભી હૈ ઔર ઈસ સે માયિત કે  
દિલ કો તસ્કીન ભી હોગી ઔર શયાતીન કા દફુઈથા ભી હોગા  
ઔર અગર કથ્ય મેં આગ હૈ તો ઈસ કી બ-ર-કત સે બુઝા દી જાએગી,  
ઈસી લિયે પૈદાઈશ કે વક્ત બચ્યે કે કાન મેં, દિલ કી ઘબરાહટ,  
આગ લગને, જિન્નાત કે ગ-લબે વગૈરા પર અજાન સુન્નત હૈ.”

(મિરાતુલ મનાજીહ, જિ. 2, સ. 444)

صَلَوَاتُ اللَّهِ تَعَالَى عَلَى مُحَمَّدٍ صَلَوَاتُ اللَّهِ تَعَالَى عَلَى الْحَبِيبِ!

## ککن کے لیے تین انمول توانے

(1) جو ہر نماج (یاً نی فرج سونتے و گیرا پڑنے) کے بآ'د  
احد نامہ پڑے، فریشنا (وسے لیخ کر موتھر لگا کر کیا مات کے  
لیے ٹھا رپے، جب **اعلیٰ حنفی** (وسے بونے کو کخش سے ٹھا اے،  
فریشنا ووہ نافیشنا (یاً نی دستا وے) سا� لایے اور نیدا کی  
جا اے : احمد وائے کھانے ہے ؟ ٹنے ووہ احمد نامہ دیتا جائے.  
یہ مامہ ہکیم تیرمیزی علیہ رحمة الله تعالى نے دیے دیتے کے فرمایا :  
”یہ مامہ تا علیس کو رحمة الله تعالى علیہ واسیت سے یہ احمد نامہ (عن  
کے ککن میں لیخا گیا۔“ (الدر المنشور، ج ۵، ص ۴۲ دار الفکر بیروت)

یہ مامہ فکیہ ہجنے اچال علیہ رحمة الله تعالى نے یہ سی دعاء اے احمد نامہ کی  
نیت سے فرمایا، جب یہ احمد نامہ لیخ کر مایت کے سا�  
کخش میں رپے دے تو **اعلیٰ حنفی** تا ایسا لے ہے سو وائے نکارے ن و اے  
کخش سے امانت دے، احمد نامہ یہ ہے :

اللَّهُمَّ فَاطِرَ السَّمَاوَاتِ وَالْأَرْضِ عَالِمُ الْغُيَبِ وَالشَّهَادَةِ، الرَّحْمَنُ الرَّحِيمُ إِنِّي  
أَعْهَدُ إِلَيْكَ فِي هَذِهِ الْحَيَاةِ الدُّنْيَا بِأَنَّكَ أَنْتَ اللَّهُ الَّذِي لَأَنَا لَا أَنْتَ وَلَا  
لَا شَرِيكَ لَكَ وَأَنَّ مُحَمَّداً عَبْدُكَ وَرَسُولُكَ فَلَا تُكْلِنْنِي إِلَى نَفْسِي فَإِنَّكَ إِنْ  
تُكْلِنْنِي إِلَى نَفْسِي تُقْرِنِنِي مِنَ الشَّرِّ وَتُبَيِّعَنِنِي مِنَ الْخَيْرِ وَإِنِّي لَا أَقْرِئُ إِلَّا  
بِرَحْمَتِكَ فَاجْعَلْ رَحْمَتَكَ لِي عَهْدًا عِنْدَكَ تُؤْمِنْهُ إِلَى يَوْمِ الْقِيَمَةِ إِنَّكَ  
لَا تُخْلِفُ الْمِيعَادَ“ (الدر المنشور، ج ۵، ص ۴۲ دار الفکر بیروت)

(2) جو یہ دعاء مایت کے ککن میں لیخے **اعلیٰ حنفی**  
کیا مات تاک (وسے سے اے ٹھا لے۔ ووہ دعاء یہ ہے :

اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ يَا عَالِمَ التَّسْرِيَّاً عَظِيمَ الْخَطْرِ يَا خَالِقَ

الْمَشَرِّ يَا مَوْقِعَ الظَّفَرِ يَا مَعْرُوفَ الْأَثْرِ يَا ذَالَّطَوْلَ وَالْمِنْ يَا كَافِ شَفَ الصَّرَّ وَالْمِنْ حَنْ  
يَا كَالَّهُ الْأَوَّلِينَ وَالْآخِرِينَ فَرِجْ عَنِّي هُمُومِي وَأَكْشَفْ عَنِّي غُمُومِي وَصَلَّ اللَّهُمَّ  
عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ وَسَلِّمُ”

(ફતાવા ૨-જવિયા મુખરજી, બ હવાલા ફતાવા કુશા, જિ. 9, સ. 110, મર્કુલ ઔલિયા લાણોર)

(3) જો યેહ દુઅા કિસી પરચે પર લિખ કર સીને પર કફન કે નીચે રખ દે ઉસે અગામે કબ્ર ન હો ન મુન્કર નકીર નજર આએ, ઓર વોહ દુઅા યેહ હૈ કે “لَا إِلَهَ إِلَّا اللَّهُ أَكْبَرُ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ، لَا شَرِيكَ لَهُ لَا إِلَهَ إِلَّا اللَّهُكُمُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَلَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللَّهِ الْعَلِيِّ الْعَظِيمِ” (ફતાવા ૨-જવિયા મુખરજી, બ હવાલા ફતાવા કુશા, જિ. 9, સ. 108, મર્કુલ ઔલિયા લાણોર)

**મ-દની ઝૂલ :** બેહતર યેહ હૈ કે અધ્યદ નામા (બલ્કે યેહ પરચા ઔર શ-જરા વગેરા) મધ્યિત કે મુંહ કે સામને કિલ્લા કી જાનિબ (કબ્ર કી અન્દરની દીવાર મેં) તાક ખોદ કર ઉસ મેં રખો. (બહારે શરીઅત, ડિસ્સા : 4, સ. 164, મકતબાએ ૨-જવિયા, બાબુલ મદીના કરાચી)

**મ-દની મશવરા :** દા'વતે ઈસ્લામી કે ઈશાઅતી ઈદારે મક-ત-બતુલ મદીના ઔર ઈસ કી તમામ શાખોં સે “કફન કે લિયે તીન અનમોલ તોહફે” કે પરચે હઠિથ્યતન તલબ કીજિયે, કુછ પરચે અપને પાસ રખ લીજિયે ઔર મુસલ્માનોં કી ફૌતાળી કે મવાકેઅ પર પેશ કર કે સવાબ કમાઈયે નીજ કફન ફરોશોં ઔર તજહીજ વ તકફીન કરને વાલે સમાજ ઈદારોં કો ભી પેશ કીજિયે કે વોહ હર મુસલ્માન કે લિયે કફન કે સાથ એક પરચા ફી સબીલિલ્લાહ દે દિયા કરેં.

## સાહેબ ઓફિશિયલ પ્રોટોકોલ

- |      |                              |                              |
|------|------------------------------|------------------------------|
| (૧)  | قرآن مجید                    | كاظم بارى تالى               |
| (૨)  | كتاب الأنعام في ترجمة القرآن | كتاب الأنعام في ترجمة القرآن |
| (૩)  | الجامع لأحكام القرآن         | الجامع لأحكام القرآن         |
| (૪)  | روح البيان                   | روح البيان                   |
| (૫)  | خران العرفان                 | خران العرفان                 |
| (૬)  | صحن البخاري                  | صحن البخاري                  |
| (૭)  | صحيف مسلم                    | صحيف مسلم                    |
| (૮)  | جامع الترمذى                 | جامع الترمذى                 |
| (૯)  | سنن أبي داود                 | سنن أبي داود                 |
| (૧૦) | المعجم الكبير                | المعجم الكبير                |
| (૧૧) | المعجم الأوسط                | المعجم الأوسط                |
| (૧૨) | شعب الأنعام                  | شعب الأنعام                  |
| (૧૩) | الجامع الصغير                | الجامع الصغير                |
| (૧૪) | كتب العمل                    | كتب العمل                    |
| (૧૫) | المسندة للإمام أحمد          | المسندة للإمام أحمد          |
| (૧૬) | المسندة لأبي علي الموصلى     | المسندة لأبي علي الموصلى     |
| (૧૭) | المستدرك على الصحيحين        | المستدرك على الصحيحين        |
| (૧૮) | مصنف ابن أبي شيبة            | مصنف ابن أبي شيبة            |
| (૧૯) | منجع الروايد                 | منجع الروايد                 |
| (૨૦) | الزهد                        | الزهد                        |
| (૨૧) | حلية الأولياء                | حلية الأولياء                |
| (૨૨) | أرواح عن اقتراف الكبائر      | أرواح عن اقتراف الكبائر      |
| (૨૩) | شرح صحيح البخاري لابن بطال   | شرح صحيح البخاري لابن بطال   |
| (૨૪) | فيض القدر                    | فيض القدر                    |
| (૨૫) | مرفة المفاتيح                | مرفة المفاتيح                |
| (૨૬) | برأة المناجح                 | برأة المناجح                 |
| (૨૭) | تاريخ بغداد                  | تاريخ بغداد                  |

(٢٨)	تاریخ دمشق	امام ائمہ القاسم علی ابن عساکر متوفی ١٥٥ھ دارالفنون بیروت
(٢٩)	تاریخ الخلفاء	امام عبد الرحمن جلال الدین السیوطی متوفی ١٩٦ھ باب المدینہ کراچی
(٣٠)	احیاء العلوم	امام محمد غزالی متوفی ٥٥٥ھ دارالصادر بیروت
(٣١)	الحدیقة الالهیة	پشاور علامہ عبد الغنی نابلی متوفی ١١٣٣ھ
(٣٢)	تذکرة الاولیاء	شیخ فرید الدین عطاء متوفی ٦٢٠٢ھ / ٢٠٢٦ھ انتشارات گھینہ ایران
(٣٣)	مشنی مولانا رام	مولانا جلال الدین روزی متوفی ٢٤٢ھ خدیجہ پتلی کشہر مرکز الائیاء الہور
(٣٤)	حیات اعلیٰ حضرت	مولانا فخر الدین قادری متوفی ١٣٨٢ھ مکتبۃ المدینہ باب المدینہ کراچی
(٣٥)	حیات محمد اعظم	حافظ محمد عطا الرحمن قادری رضا فاؤنڈیشن مرکز الائیاء الہور
(٣٦)	جامع العلوم والحكم	ڈاکٹر محمد کرام علی مکرمہ افیضیلہ مکرمہ
(٣٧)	روحانی حکایات	علامہ عبد الصطفی عظیم متوفی ١٣٠٩ھ مکتبہ غوثیہ باب المدینہ کراچی
(٣٨)	منهج العابدین	امام محمد غزالی متوفی ٥٥٥ھ دارالكتب الحججیہ بیروت
(٣٩)	الرسالة القشیرية	امام ابوالقاسم عبد الرکنی الشیری متوفی ١٣٥٩ھ دارالكتب الحججیہ بیروت
(٤٠)	الابریز	علماء عبد العزیز الباغی متوفی ١١٣٢ھ .....
(٤١)	القول البیان	علامہ امام حافظ محمد بن عبد الرحمن السحاوی متوفی ٩٠٢ھ مؤسسة ایران بیروت
(٤٢)	رذ المختار	علامہ سید محمد بن طلی متوفی ١٤٥٢ھ دارالعرفان بیروت
(٤٣)	فتاویٰ ہندیہ	علامہ ملا ظاظم الدین متوفی ١٣٩٦ھ کوئٹہ
(٤٤)	فتاویٰ رضویہ	اعیینحضرت امام احمد رضا متوفی ١٣٣٠ھ رضا فاؤنڈیشن مرکز الائیاء الہور
(٤٥)	بھارشریعت	صدر ارشادیہ مشق احمد علی عظیم متوفی ١٣٧٦ھ مکتبۃ المدینہ باب المدینہ کراچی
(٤٦)	ملفوظات اعلحضرت	اعیینحضرت امام احمد رضا مکتبۃ المدینہ باب المدینہ کراچی
(٤٧)	کفری کلمات کے بارے میں سوال جواب علم محمد علی عطاء قادری دامت برکاتہم العالیہ	مکتبۃ المدینہ باب المدینہ کراچی
(٤٨)	غیبت کی تباہ کاریان	علام محمد علی عطاء قادری دامت برکاتہم العالیہ مکتبۃ المدینہ باب المدینہ کراچی
(٤٩)	١٠١ مدینی پھول	علام محمد علی عطاء قادری دامت برکاتہم العالیہ مکتبۃ المدینہ باب المدینہ کراچی
(٥٥)	وَظِيفَةُ الْكَرِيمَةِ	اعیینحضرت امام احمد رضا خان ادارہ تحقیقات باب المدینہ کراچی
(٥٦)	فیضان سنت	علام محمد علی عطاء قادری دامت برکاتہم العالیہ مکتبۃ المدینہ باب المدینہ کراچی
(٥٧)	ماہنامہ شریفیہ	مبارک پور یونیورسٹی
(٥٨)	المفردات للغائب	علام احمد اغب الاصفہانی متوفی ٤٠٥ھ دارالشاملیہ بیروت

યાદ દારીત

ਦੀਰਾਨੇ ਮੁਤਾ-ਲਾਖਾ ਝੜੁਰਤਨ ਅਨੰਦ ਲਾਈਨ ਕੀਓਇਥੇ, ਇਸ਼ਾਰਾਤ ਵਿਖ ਕਰ ਸਫ਼ਲਾ ਨਾਭਰ ਨੋਟ ਫਰਮਾ ਲੀਓਇਥੇ। ਇਉਂ ਅਨੇਕ ਹਿੱਸੇ ਮੈਂ ਤਰਕੀ ਹੋਗੀ।

## કબી મેં આબે વાલા દોષત

**મજલિસે અલ મદી-નતુલ ઈલ્મિયા કી તરફ સે પેશ કર્દા કાબિલે મુતા-  
લાયા કુતુબ**

(શો'ભાએ કુતુબે આ'લા હજરત ઉલ્લિલી ﷺ)

- (1) કરન્સી નોટ કે મસાઈલ (કિલુલ ફીડીહિલ ફાહિમ ફી અહકામિલ કિરતાસિદ્રાહિમ) (કુલ સ-ફિહત : 199)
  - (2) વિલાયત કા આસાન રાસા (તસ્વ્યુરે શેખ) (અલ ચાકુ-તતુલ વાસ્થિતા) (કુલ સ-ફિહત : 60)
  - (3) ઈમાન કી પહેચાન (ધારિયા તમ્હીદ ઈમાન) (કુલ સ-ફિહત : 74)
  - (4) માઝાશી તરકી કા રાજ (ધારિયા વ તશરીહ તદબીરે ફિલાહ વ નજીત વ ઈસ્લાહ) (કુલ સ-ફિહત : 41)
  - (5) શરીરાત વ તરીકત (મકાલુલ ઉ-રફા-ઈ બિ ઈ'ઓજિ શર-ઈ વ ઉ-લમા) (કુલ સ-ફિહત : 57)
  - (6) સુખૂતે હિલાલ કે તરીકે (તુરુકુ ઈસાને હિલાલ) (કુલ સ-ફિહત : 63)
  - (7) આ'લા હજરત સે સુવાલ જવાબ (ઈજાહલ હાક્કિલ જલી) (કુલ સ-ફિહત : 100)
  - (8) છેઠેન મેં ગલે મિલાન કેસા ? (વિશાહુલ જીદ ફી તહલીલ મુઆ-ન-કિતિલ ઈદ) (કુલ સ-ફિહત : 55)
  - (9) રાહે ખુદા હંગું મેં ખર્ચ કરેને કે ફિગાઈલ (રદુલ કડૂતિ વલ વબા-ઈ બિ દા'વતિલ જીરાનિ વ મુવાસાતિલ ફુ-કરાઅ) (કુલ સ-ફિહત : 40)
  - (10) વાલિદેન, જૌઝેન ઔર અસાતિજા કે હુક્ક (અલ હુક્ક લિ તરીલ ઉક્ક) (કુલ સ-ફિહત : 125)
  - (11) દુઅ કે ફાઈલ (અહ્સનુલ વિઅબાલિ આદાજિહુઆ માઝુ જેહુલ મુદ્દા લિ અહ્સનિલ વિઅબા)
- (કુલ સ-ફિહત : 140)

**(શાઅએ હોને વાલી અ-રબી કુતુબ)**

અઝ ઈમામે અહેલે સુન્ત મુજાહિદે દીનો મિલાત મૌલાના અખમદ રામ ખાન

- (12) કિલુલ ફીડીહિલ ફાહિમ (કુલ સ-ફિહત : 74)
- (13) તમ્હીદ ઈમાન (કુલ સ-ફિહત : 77)
- (14) અલ ઈજાજાતુલ મતીનહ (કુલ સ-ફિહત : 62)
- (15) ઈકા-મતુલ કિયામહ (કુલ સ-ફિહત : 60)
- (16) અલ ફદુલ મૌહબી (કુલ સ-ફિહત : 46)
- (17) અજલલ ઈ'લામ (કુલ સ-ફિહત : 70)
- (18) અગ્રામ-જ-મતુલ ક-મરિયદ (કુલ સ-ફિહત : 93)
- (19,20) જદુલ મુતાર અલા રદીલ મુહતાર (અલ મુજલ્લાદ અલ અબ્દ્યલ વસ્સાની વસ્સાલિસ) (કુલ સ-ફિહત : 570,672)

(શો'ભાએ ઈસ્લાહી કુતુબ)

- (21) ઘોડે ખુદા હંગું (કુલ સ-ફિહત : 160)
- (22) ઈન્દ્રિયાદી કોશિશ (કુલ સ-ફિહત : 200)
- (23) તંગદસ્તી કે અખાબ (કુલ સ-ફિહત : 33)
- (24) ફિકે મદીના (કુલ સ-ફિહત : 164)
- (25) ઈમિલાન કી તથારી કેસે રેં? (કુલ સ-ફિહત : 32)
- (26) નમાજ મેં લુકમા કે મસાઈલ (કુલ સ-ફિહત : 39)
- (27) જન્ત કી દો ચાનિયાં (કુલ સ-ફિહત : 152)
- (28) કાખ્યાબ જેસાન કેન? (કુલ સ-ફિહત : 43)
- (29) નિસાબે મ-દની કાફિલા (કુલ સ-ફિહત : 196)
- (30) કાખ્યાબતાલિબે ઈસ્લામી? (કુલ સ-ફિહત : તકરીબન 63)
- (31) ફેઝાને એહયાઉલ ઉલૂમ (કુલ સ-ફિહત : 325)
- (32) મુક્તિયે દા'વતે ઈસ્લામી (કુલ સ-ફિહત : 96)

## કબી મંત્રો આનિન્દ્યા દોષત

- (33) હક્કો બાતિલ કા ફર્ક (કુલ સ-ફિદત: 50) (34) તદકીકત (કુલ સ-ફિદત: 142)
- (35) અરથાને હ-નફિયા (કુલ સ-ફિદત: 112) (36) આતારી જિન્ન કા ગુસ્લે મયિત (કુલ સ-ફિદત: 24)
- (37) તલાક કે આસાન મસાઈલ (કુલ સ-ફિદત: 30) (38) તૌબા કી રિવાયાત વ હિકયાત (કુલ સ-ફિદત: 124)
- (39) કબ્ર ખુલ ગઈ (કુલ સ-ફિદત: 48) (40) આદાબે મુશીદિ કામિલ (મુકમ્મલ પાંચ હિસ્સે) (કુલ સ-ફિદત: 275)
- (41) દીવી ઓર મૂવી (કુલ સ-ફિદત: 32) (42) દીવાના અહલે સુન્નત (સાત હિસ્સે)
- (49) કબ્રિસ્તાન કી ચુંદુલ (કુલ સ-ફિદત: 24) (50) ગૌસે પાક એણિલી હુદ્દી હુદ્દી હિકે હલાત (કુલ સ-ફિદત: 106)
- (51) તાલાકે અમીરે અહલે સુન્નત (કુલ સ-ફિદત: 100) (52) રહનુમાંગ જાહેર વરાબે મ-દીની કાન્દિલા (કુલ સ-ફિદત: 255)
- (53) દા'વતે ઈસ્લામી કી જેલભાના જાત મેં પિદમાત (કુલ સ-ફિદત: 24)
- (54) મ-દીની કામોં કી તકસીમ (કુલ સ-ફિદત: 68) (55) દા'વતે ઈસ્લામી કી મ-દીની બહારે (કુલ સ-ફિદત: 220)
- (56) તરબિયટે ઓલાદ (કુલ સ-ફિદત: 187) (57) આયાતે કુરાયાની કે અન્વાર (કુલ સ-ફિદત: 62)
- (58) અહાડીસે મુખા-રક્ક કે અન્વાર (કુલ સ-ફિદત: 66) (59) ફેઝાને ચહેર અહાડીસ (કુલ સ-ફિદત: 120)
- (60) બદ ગુમાની (કુલ સ-ફિદત: 57)

### (શો'ભાને તરાજિમે કુતુખ)

- (61) જન્નત મેં લે જાને વાલે આ'માલ (અલ મુજલુરખિય દી સવાયિલ અ-મવિસ્સાલેહ) (કુલ સ-ફિદત: 743)
- (62) શાહરાદે ઔદિયા (મેનજાજુલ આરિફીન) (કુલ સ-ફિદત: 36)
- (63) હુસ્ને અખલાક (મકારિમુલ અખલાક) (કુલ સ-ફિદત: 74)
- (64) રાહે ઈલમ (તા'લીમુલ મુન-તાલિમ તરીકતાઅલ્લુમ) (કુલ સ-ફિદત: 102)
- (65) બેટે કો નસીહત (અધ્યુહલ વલદ) (કુલ સ-ફિદત: 64)
- (66) અદા'વતિ ઈલત ફિંક (કુલ સ-ફિદત: 148) (67) આંસૂઓની દરિયા (બહરુભૂમાન) (કુલ સ-ફિદત: 300)

### (શો'ભાને દર્સી કુતુખ)

- (68) તા'રીફાને નહિવિયા (કુલ સ-ફિદત: 45) (69) કિતાબુલ અકાઈદ (કુલ સ-ફિદત: 64)
- (70) નુઝુનુનાગર શર્હનાખતુલ ફિંક (કુલ સ-ફિદત: 175) (71) અર-બઈનુના-વવિયા (કુલ સ-ફિદત: 121)
- (72) નિસાખુજાફીદ (કુલ સ-ફિદત: 79) (73) ગુલ દસ્તાને અકાઈદો આ'માલ (કુલ સ-ફિદત: 180)
- (74) વકા-યતુનાઝવ કી શર્હે હિંદા-યતુનાઝવ

### (શો'ભાને તમ્રીજ)

- (75) અજાઈખુલ કુરાયાન માઝ ગરાઈખુલ કુરાયાન (કુલ સ-ફિદત: 422) (76) જન્નતીએવર (કુલ સ-ફિદત: 679)
- (77 તા 82) બહારે શરીરાત (પાંચ હિસ્સે, હિસ્સા 16) (83) ઈસ્લામી જિન્દગી (કુલ સ-ફિદત: 170)
- (84) આઈનાએ કિયામાત (કુલ સ-ફિદત: 108)
- (85) સહાબાને કિરામ નન્દ: حسنى عَنْ نَبِيٍّ كَمَرْكَلَ رَسُولَ مُحَمَّدَ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ (કુલ સ-ફિદત: 274)
- (86) ઉમહાતુલ મુગમિનીન (કુલ સ-ફિદત: 59)

## સુનત કી બહારો

ઈસ્લામી કે મહકે મહકે મ-દની માહોલ મેં બ કસરત સુનતોં સીખી ઓર સિખાઈ જતી હૈ, હર જુમા'રાત ઈશા કી નમાજ કે બા'દ આપ કે શહર મેં હોને વાલે દા'વતે ઈસ્લામી કે હક્કતાવાર સુનતોં બરે ઈજિતમાં મેં રિયાબે ઈલાહી કે લિયે અચ્છી અચ્છી નિયતોં કે સાથ સારી રાત ગુજરાને કી મ-દની ઈલિજા હૈ. આગિયાને રસૂલ કે મ-દની કાફિલોં મેં બ નિયતે સવાલ સુનતોં કી તરબિયત કે લિયે સફર ઓર રોજાના કિકે મદીના કે જરીએ મ-દની ઈન્ઝામાત કા રિસાલા પુર કર કે હર મ-દની માહ કે ઈલિજાઈ દસ દિન કે અનદર અનદર આપને યાંત્રણ કે જિયેદાર કો જગ્માન કરવાને કા મા'મૂલ બના લીજિયે, **بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ** ઈસ કી બ-ર-કત સે પાબન્દ સુનત બનાને, ચુનાહોંસે નકરતા કરને ઓર ઈમાન કી ડિકાળત કે લિયે કુઠેને કા જોહન બનેગા.

હર ઈસ્લામી ભાઈ આપના યેહ જેહન બનાએ કે “મુજે આપની ઓર સારી હુન્યા કે લોગોં કી ઈસ્લાહ કી કોશિશ કરની હૈ. **بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ**” આપની ઈસ્લાહ કી કોશિશ કે લિયે “મ-દની ઈન્ઝામાત”/પર અમલ ઓર સારી હુન્યા કે લોગોં કી ઈસ્લાહ કી કોશિશ કે લિયે “મ-દની કાફિલોં” મેં સફર કરના હૈ. **بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ**



**મક-ત-બાતુલ મદીના કી જાણે**

સૂરત : વિલયાભાઈ મસ્કિટ, અધ્યાજ દાના દરગાહ કે પાસ. 9898615071

જામનગર : પાંચ હાટી, 9327977293

મોડાસા : સુકા બજાર, 9725824820

ગાંધીયામ : સપના નગર, મદીના મસ્કિટ કે પાસ, 8141474279

ઘોલકા : તાજદારે મદીના મસ્કિટ કે સામને, ટાવર બાગાર, 9374915797

**મક-ત-બાતુલ મદીના®** **مکتبۃ الرَّبیعہ**  
દા'વતે ઈસ્લામી